

કન્દુ પ્રેમાંદ કૃત

અંગોખાહરણ

નાઈની.

છાણી પ્રસિદ્ધ કરનાર.


બુક્સેન્ટ - મહાદેવ રામચંદ્ર આગુણે
ત્રણ દરવાજ - અદાવાદ.



અમદાવાદ.

પાણપુર નવી પોળમા થી “પ્રજાહિતાર્થ મુદ્રાવય ”
પ્રેસમાં પેલ ડાલાભાઈ દલપતરામે છાપ્યું.
આવૃત્તિ ૩ લ.

પ્રત ૫૦૦૦



સને ૧૯૨૦

સંવત ૧૯૭૭

કીમત ૮-૧૨-૦

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ગુજરાતી કોપીરાઇટ વિભાગ]

અનુક્રમાંક ०१०३ વર્તોંક

પુસ્તકસું નામ રામાયણ

વિષય ८-: ८

કવિ પ્રેમાનંદ કૃત.

ઓખાહરણ

મહોધી.

અપાવી પ્રસિદ્ધ કરનાર.

બુક્સેલર—મહાદેવ રામચંદ્ર જાગુષે.

ત્રણુ દ્રવાજ—અદાનાથ.




અમદાવાદ.

શાહાપુર નવી પોળમા શ્રી “ મજહિતાર્થ મુદ્રાલય ”

પ્રેસમાં પોલ ડાયાભાઈ દલપતરામે છાપ્યું.

આવૃત્તિ ૩ લ.

પ્રત ૫૦૦૦



સને ૧૯૨૦

સંવત ૧૯૭૭

કીમત ૦-૧૨-૦

કબીર કાંઈ.

આમા મહાત્મા કબીરના દોડરા અને તેમા રહેવા
શુદ્ધ પથીજ સહેળી જાપામાં એવો વિસ્તાર પુર્વે સમ-
ભાગે છે તે વાંચવાથી સુધી, ઈશ્વરી લીલા. ખૃતુ વિગેરે
સખ્યાનો પણોજ હિતકષ્ટ ઘ્યાલ આપે છે અમે તેવા પાયાલુ
દદ્યાવાણ માણ્યસને પણુ આ પુસ્તક સાહે જાન આપી નુતન
જાંદીમાં પ્રવેશ કરાવે છે. પુસ્તક ઇકત એકજવાર વાંચવા-
થીજ તે વારે વારે વાંચવાની પ્રેરણુ કરે એવો એમાં અદ્યતન
રસ છે. આમા કુલ ૨૦ અંગ છે અને તે એટલા બધા આ
કથેં છે તેનો વાંચવાથીજ સારાઘ્યાલ યશે આમા મહાત્મા
કબીરનો ઝોડા પણુ અંદર દાખલ કરેલો છે. પુસ્તકનું કે
ખા X પા છાંચ લાંબું પહોળું કાળળ જેજ હુચા પૃષ્ઠ સંખ્યા
૩૨૦, પાડું ઇસેરી વર્ખવાળું પ્રદું છતાં કિમતદ. ૨-૧૨-૦
ફેસ્ટેજ માદ્દે.

ગ્રાસવામી શ્રી તુલસીદાસલ ઈ.

રામાચણ.

(ગુજરાતીમાં) શ્રી રામાચણએ શાલું શાલ ધતિહાસનો
ધતિહાસ વ અને જાન તેમજ ઉપદેશથી અક્ષરનું અક્ષર રસમય
અનેહું વાતાવરણ વર્ચિન છે. આ તુલસીદાસની રખનામય વાણીથી
રચેલું છે કે તેનું રસમૃત પાણ કરતાં ભક્તોનાં હદ્દમ ડેલવા લાગે
છે અને ભક્તિરસથી ઉછળો ઉછળાને ઉભરાઈ જાય છે બાળસોધ ન
અખણારા સેરાકાયાનો મુળ ભાગ પણ ગુજરાતી અક્ષરમાં ર એનેં
છે. જેથી યોદું લણેલાં લી પુર્વો તુલસીદાસની અમૃત વાણી ધથીજ
સહેલાચથી વાંચી સમજ થાડે છે. પાડું સેનેરી ઊંઢું કિમત મોટી
સાઈકનાં સાધારણ મોટા અક્ષરની કિમત. ર. ૧૦-૦-૦ નાની
સાઈકનાં ગુટકા કિમત. ર. ૦-૦-૦

બાળવાદું ડેમાણ,

મહાદેવ રામચંદ્ર બાળુણે ખુકસેલર

નાલ દરવાજા-આમદાવાદ

અનુકૂમણીકી.

કડવામાં આવેલી દુંક બીજા.

ક્રમનંદિ.	પાતુ	ક્રમનંદિ	પાતુ
૧ અંભાળની પાર્થના.	૫	૨૦ એગીપાર વરસની ઉભરે પુનીને પરખુંવા બાયત	૨૦
૨ બાખુસુર તપ કરવા જાય છે	૬	૨૧ એઓબા મહાદેવને પુનવા જાય છે	૨૧
૩ બાખુસુરને મહાદેવે શાશ્વતપુરણ રાન્ય આપ્યું,	૭	૨૨ ચિત્રબેષા જોખાના નેખનનો ઉપાય બતાવે છે	૨૧
૪ બાખુસુર બાખુભતી રાણીને પ્રરખ્યો.	૮	૨૩ એઓબાને ચિત્રબેષા છે કે પુરુષ વનર શાખગાર કાન્દનો નથી	૨૨
૫ બાખુસુર કુલસમાં મહાદેવ પાસે ગયો	૯	૨૪ માળીયામાં જન્માણી થી રીતે જાય તે બાયત	૨૨
૬ ઉમીયાળ એક પુની અને એક પુત્ર કુલનાને છે.	૧૦	૨૫ એઓબાને ચૈત્રમાસનું મત આપ્યું	૨૪
૭ મહાદેવ કુલસમાં જઈ ગણુપતિનું સુસ્તાં છેઠાં કરે છે.	૧૧	૨૬ એઓબા જોરમાની પુના કરે છે	૨૪
૮ ગણુપતિને મારી નાંખ્યા બદલ ઉં મીયાળનો વિલાપ.	૧૨	૨૭ એઓબા જોરમાનાસે વરદાન આપે છે	૨૫
૯ ગણુપતિ પહેલાં પુનાય એ વરદાન	૧૪	૨૮ જોરમાને વાથી પુષ્પ યથાયાતે	૨૫
૧૦ શુભ કામનાં પહેલું ગણુપતિનું સમરથું.	૧૪	૨૯ એઓબા ઉમીયાળને પગે લાગી	૨૬
૧૧ એઓબાનું અંત લુણુમાં ગણ્યાયદાદ ઉમીયાળનો આપ	૧૪	૩૦ એઓબા વચનનથી ભરથાર માને છે	૨૬
૧૨ બાખુસુરને હેડી ચંડાળધૂએ સા- વરધી આડી ધરી તે	૧૫	૩૧ એઓબાને સ્વમામાં ભરથાર દીડા તે	૨૭
૧૩ ચંડાળ કરે છેલો તે કથા	૧૬	૩૨ એઓબાને ભરથારનો અભ્યાસ	૨૮
૧૪ બાખુસુર પુત્ર ભાગવા મહાદેવ પાસે ગંભી	૧૬	૩૩ ચિત્રબેષાએ એઓબાને સ્વમામાયથી જગાડી તે બાયત	૩૦
૧૫ બાખુસુરને ત્યાં વરદાનથી પુની પેદા થઈ	૧૭	૩૪ એઓબા સુરજ દેવતાને આપ કે છે	૩૦
૧૬ એઓબાને ચિત્રબેષા કેવી રીતે નામ ધારથું કર્યી	૧૮	૩૫ એઓબા રેખે છે ને ચિત્રબેષા વિનાનેછે	૩૨
૧૭ એઓબાયાદને માળીયામાં જુહી રાન્ય બાયત	૧૯	૩૬ સ્વધૂં જુહુ છે તેની ધારણા એઓબાને આપે છે	૩૨
૧૮ એઓબાયાદનો નેખનદંતી થઈ છે	૨૦	૩૭ એઓબા પરખુંવા કંડાની લખ્યાને	૩૩
૧૯ એઓબા ચિત્રબેષાને નેખન વિશે	૨૦	૩૮ એઓબાને સ્વમામાં લદ્વરાય પરખુંવા આબા તે	૩૪
છીંકાત છે	૨૦	૩૯ એઓબા કુલખુંતથી કુપારને સ્વમામાં પરખી તે	૩૫
		૪૦ ચિત્રબેષા હાથમાં ચિત્રનું પુતળુ બતાવે તે	૩૬
		૪૧ ભરથારણું વચન પણ્યા બાયત	૩૬

કણ્ઠું	પાતું	પાતું	
૪૨ ચિત્રલેખા દ્વારામણે ઓખાને ભરથાર બેબા જાય છે	૩૭	૫૭ બાણુમતી પુત્રી જમાઈની છાની સંભાળ કે છે	૬૮
૪૩ ઓખા અનિરદ્ધને દ્વારામણીલાવી	૩૭	૬૮ અનિરદ્ધનું યુદ્ધ નારહણ જુબે છે તે	૭૦
૪૪ ઓખા અનિરદ્ધને નીંદ્રામણીજગાડેછે	૪૦	૬૯ દ્વારકાની કથા	૭૩
૪૫ ઓખા અનિરદ્ધ નીંદ્રામણ છે તેથી પગ ચાંપે છે તે	૪૦	૭૦ અનિરદ્ધને કણોયદમાં પુરો	૭૫
૪૬ અનિરદ્ધ જાગી હિંદેયો તે આખત	૪૧	૭૧ કંગવાને ગરૂડ મોકલ્યો	૭૬
૪૭ અનિરદ્ધને અને પરથુવા કાલાવાલા કરે છે	૪૧	૭૨ ઓદ્ધલ અનિરદ્ધને સીધામણું હે છે	૭૭
૪૮ બાણુસુરની નગરીમાં નિશાન ગડાં ગડોવાને	૪૧	૭૩ બાણુસુરે કણ્ણા પરથુવા	૭૬
૪૯ અનિરદ્ધ ગાઢ સંભળે છે	૪૩	૭૪ કૃષ્ણ જાદુ સૈંના લઘ આવ્યા તે આખત	૭૮
૫૦ ઓખામાળીયામાં પરથુવાની તેથારી કરે છે	૪૩	૭૫ બાણુસુર કૃષ્ણને અપમાનના શાદ કરે છે તે	૮૦
૫૧ માળીયામાં અનિરદ્ધ પરથ્યા તે	૪૪	૭૬ બાણુસુરના હાથ છેદ્યા તે બાય	૮૧
૫૨ ઓખા સાચે પ્રેમનો સંબંધ	૪૫	૭૭ આણુસુર મહાદેવ પાસે આવ્યો	૮૧
૫૩ બાણુસુર ઓખાને પરથુવવા એનો લાંબે છે તે	૪૭	૭૮ મહાદેવ બાણુસુરની મદદ આવ્યા તે	૮૨
૫૪ બાણુસુર સાથે અનિરદ્ધનો જુહનો વિચાર	૪૮	૭૯ મહાદેવને કૃષ્ણ બેટા	૮૩
૫૫ અનિરદ્ધ માળીમાં આવ્યા તે	૪૯	૮૦ કૃષ્ણે હાથ દેરની બાણુસુરની પીડા મટાડી તે આખત	૮૩
૫૬ અનિરદ્ધને ઓખા કાલાવાલા	૫૧	૮૧ પાર્વતીમાં પીપરીઓના તેદાયા તે	૮૭
૫૭ અનિરદ્ધને નારદ આસીવીદ	૫૨	૮૨ અનિરદ્ધને તેલ ચીંચારાણું ગીત	૮૭
૫૮ અનિરદ્ધથે બાણુસુરની સૈના મારી તે	૫૪	૮૩ અનિરદ્ધ સંબંધી ગીત	૮૮
૫૯ અનિરદ્ધથે જુંગળે દસ્તાવ્ય આર્યો તે	૫૪	૮૪ અનિરદ્ધની પોડલી	૮૮
૬૦ બાણુસુરને અનિરદ્ધની લડાની	૫૮	૮૫ બાણુસુર પગ પખાળે તે આખત	૮૦
બાખત	૫૮	૮૬ બાણુસુર જોરવ નોતરે તે આખત	૮૦
૬૧ સદર	૬૦	૮૭ કન્યાને વળાવવા આખત	૮૨
૬૨ સદર	૬૧	૮૮ ઓખાને શૈયરો વળાવવા આવી તે	૮૨
૬૩ સદર	૬૨	૮૯ ઓખામાછ સાસરે જાયછે તે આખત	૮૩
૬૪ સદર	૬૪	૯૦ ઓખામાછને સાસરે જતાં શીધામણું	૮૨
૬૫ અનિરદ્ધને અંધન કો	૬૬	૯૧ અનિરદ્ધ કણ્ણા લઘ જાય છે તે	૮૪
૬૬ ઓખાને અંધન કો	૬૭	જાદુ ગીત	૮૪

→॥ શ્રી ગણેશાય નમः ॥←

ઓખા હરણ.

શ્રી ગણપતીની પ્રાર્થના.

॥ રાગ આશાવરી--એક નામ મુજને સાંભર્યુ, શ્રી જોરી
કુત્રગણેશ; ૧ વર્તીનાઅંગથીઉપન્થો, તાતતણોઉપદેશ. ૧ મા
તાજેનીપાર્વતીને, પીતાશંકરદેવ; નવખંડમાંજેનીસ્થાપના,
કરે જુગ જુતળ સેવ. ૨ સીંદુરે શાલુગારસજ્યાનેકંટૈપુષ્પના
હાર; આયુદ્ધ ઇરસી કર ધરીને, હણ્યા અસુરાચપાર. ઉપેહેલા
કરમાં જળકમંડળ, બીજે મોઢીક અહાર; ત્રીજા કરમાં ઇરશી
સોહીએ, ચાથેરે જઘમાળ. ૪ ચાલોસઈયરો દેવજઈનેપુળએ
ગણપતીરાય; મોટા લીજે મોઢીક લાડુ, લાગીએશંભુ સુતને
પાય. ૫ એવા દેવ સાચા મુનીવાચા, પુરે મનની આશા; એઉં
કર જોડી કહે વૈશ્રવ, દાસતણો જે દાસ. ૬

શ્રી અંબાજીની પ્રાર્થના.

કદવં ૧ લું.

આધશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહીં પાણી; સુ
રિનરમુનીજન સર્વે કળાણી, તું કેણે ન કળાણિ. ૧ તારું વ
ણુંન કેઈ પેરે કરીએ, જે મુખરસના એક; સહસ્ર ઝેણાશેષ
નાગને, મા તોએ ન પામ્યો શેખ. ૨ જુજવાંસ્પથરેજુગદંબા
રહી નવખંડે વાપી; મહા મોટાજડમુઠ હતામા, તેમની દુર-
મત કાપી. ૩ ભક્તિ ભાવ કરી ચરણે લાખું, મા આધશક્તિ

ઓખાહરણ.

જાણી; તેમને સહાય કર્સતું સમર્પી, નગરકોટની રાણી.૪
તું તારા ત્રિપુરાને તોતળા, નમબુદ્ધેશરંગ રાતે; ભીજુથોભા
શી મુણે કહીએ, ર્થના અની બહુભાતે. ૫ હંસાવતીને બ-
ગલામુખી, વહાણુવટી તું ભાય; ભીડભડે તેમને સંભાડુકરણે
અમારીસહાય.૬ મા શેવકજન તારી વીનતી કરે, ઉગારણે
અણે ભાય અન્ના આવી પાડ કરે, વીશનુ વાંસરી વાય. ૭
શીવજી આવી ડાક વગાડે, નારદજી ગુણુ ગાય; અભીદગુ-
દ્ધાદ તણું હોય એછિવ, મરહંગના ઝણુકાર. ૮ સીંહાસન
ઘઠાં જુગદંબા, અમૃત દષ્ટે જેતી સોળે શાણુગાર તેંસન્યા
મા, નાહે નીરમલ મોતિ.૯ ઘીર ખાંડ વત મહશર્કરા આ-
રોગો જુગ ભાય; અગર કપુરે તારી કરું આરતી, શેવકજન
શીર નભાય. ૧૦ તું અન્નાણી તું ઝ્રદાણી, તુ હેવાધી હેવસકલ
વિષમાં તું છે માતા, કરું તમારી સેવ. ૧૧ માના શરણુથ
યા પ્રતીપાલન, પહેાતી મનની આશા, કુશળક્ષેમ રાખણે
અંબા મા સર્વને, એમ કહી ત્રિપુરાદાસરે. ૧૨

કુદં ૨ જું.

રાગ હેઠારો-હુસો શ્રી પુરુસોતમ શીરનામું, હુસો સકળપ
દારથ પામું, વાખું વાખુરે, હુઃખ સકળ કુળી વરતણું રે. (રાગ
દાળ) હુઃખ સકળ વામું કુળીવરનાં; સુષ્ણુતાં પ્રાયશ્વિતભાય;
ઓખાહરણ ને સાંભળો, મહારોગથકી મુકાય. ૧ તાવતરીએ
એકાંતરીએ, નચઢે તેની કાય; જુતનોભણુકારોતેને; નચાવે
સ્વમા ભાંય. ૨ પરીક્ષાત પુછે કહેને શુકજી ઓખાનો ભરી

માબ; ડાણ સેતે થણો ઓભા; અનીરુદ્ધને વીવાહ. તે પ્રથમ હુસા દાનવસુતાને, કહાવતા જે દશરંધ; હવેહરામનીકહુ ક ચા., જે મ ઉપને આનંદ.૪ હત્તિએ વૃંદાવનમાં લીલાકીધી; વાચો મધુરા વંસ; પ્રથમારી પુતનાને; પછી પછાડયો કંસ. ૫ પછી પધાર્યા દ્વારીકામાં પરણ્યાછે બહુ રાણી; શોળ સ-હજી શતાગળી તેમાં અષ્ટ કરી પટરાણી. ૬ તેમાં વડાં જે દૃક્ષમણુપ્રદ્યુમનતેનાતન; પ્રદ્યુમનનાઅનીરુદ્ધકહિએકર્મ કથા પાવન, ૭ આદ્ય અલ્લા અધિ કરતા મરીયી જેના તન; મરીયીનાસુતકસ્યપ કહીએ હિરણ્યકશ્વપ રાજન.૮ વીષ્ણું બક્ત પ્રદ્બાદળ તેને ઠાલા શ્રીભગવંત; પ્રદ્બાદનોસુતવી-રાચન બ્રણીરાય તેનો તન.૯ ખળી તણો સુત બાણાસુર; જે-નું મહારદ્દર ચરણેમન; એક સમે ગુરુ શુક આંદ્યા ત્યારે થોડ્યો વચન.૧૦ અહોગુરૂ અહોગુરૂ; કહોને તપ મહીમાય; સુક વાણી બોલીયા તું સાંભળને જગરોય.૧૧ ત્રણુદોક-માં લોળાશંભુ આપશે વરદાન; મધુવનમાં જઈ તપ કરો આરાધો શીવ ભગવાનરે. ૧૨

કૃતું ૩ લું.

રાગ ભારૂ-રાય તપ કરવાને જથરે, એતો આંદ્યો મધુવન માંથરે; કીધુકીધું ની મજબુનસ્નાનરે; ધરીયું સીવળ ડેરુધ્યા નરે.૧ રાય એડાછે આસનવાળીરે; કર જમણામાંજપમાળા જાલીરે, ભાળાધાદ્યા સુશ્રીએ કાનરે; નોએ આરાધે સીવ ભગવાનરે.૨ ઇધીર ભાંસસુકાઈ ગરુરે; શરીર સુકા કાષ્ટતથ-

શુરે; મહાનપીઓં કેમે નવ બોલેરે, એના તપથી ત્રીભુવન
ડોલેરે. ઉ વળતી બોલીયા શંકરરાયરે, તમે સાંભળો ઉમ્મી-
યાયરે; એક અસુર મહાત્મ સાધેરે, મારું ધ્યાન ધરીને આ
રાધેરે.૪કોણ કહીએ જેનો બાપરે, તેતો માંડી બેઠો મહાજ
પરે; તમે કહો તો વરહાન આપુરે, કહો તો પુત્ર કરીને થા-
પુરે,૫ વગતાં બોલ્યા રૂદ્રાણીરે, મારીવાતસુણો સુલપાણીરે
હુધપાઈને ઉછેરીએસાપરે, આગળ ઉપજવે સંતાપરે.૬ બેદ
ભસ્માંગઢનો લદ્યારે, વરહાનપામીને પુંઠળથચોરે; વરહાનરા-
વણુનેતેમ આખ્યારે, તેણેજનકીનાથસંતાખ્યારે. ૭ માટે સી
સીખામણ હીજેરે, ભોગા રૂદું ગમે તે કીજેરે; વળતાયોલ્યા
શીવરાયરે; તમે સાંભરો ઉમ્મીયાચરે.૮ સેવા કરી ચઢાવે જ-
ળરે, તેની કાયા કરુનીરમળરે સેવાકરી ચઢાવે સુગંધરે, તેની
બુદ્ધિ કરુ ધનધનરે.૯ જે કોઈ ચઢાવે બીલીપત્રરે, તેને ધરાવું
સેનાનું છતરે; સેવા કરી વગાડે ગાલરે, તેનેકરીનાખુંન્યાલરે
૧૦ નારી પાનીએબુદ્ધિતમારીરે, આપતાં નવરાખીએવારીરે
હુતો ભોગોનાથ કહેવાઉંરે, હવે કપટી નાથ કેમ થાઉંરે.૧૧
એવુંકહીને ચાલ્યો ભોગોનાથરે, મુક્યો બાણાસુરરથીરહાયરે
તુંતો જાગ્ય બાણાસુરરાયરે, તનેવરહાન આપે શીવરાયરે, ૧૨
હુતો જાગુંછુંમહારાજરે, આપોશોણીતપુરનું રાજરે; શીવમા
ગુંધું વારંવારરે, મુને આપો કરહજરરે. ૧૩ કરએકેકો એવો
કીજેરે, ૧૪ સહસ્રહસ્તીતાણું બળહીજેરે; અસ્તુ કહીને શીવે
વર આપ્યોરે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યોરે. ૧૪

કદવું ૪ થું.

રાગ આશાનરી-વરદાન પામી વળીયો બાણુસુર, શાણી
તપુરમાં જાય; વનનાં વસી પશુરેપંખી, તે લાગ્યાફુરીવાય
૧કાંઈ નવ દીઠું સાંભળ્યું, જે મ વૃષ્ટ ચાદ્યું જાય; આ રી રેઝે
વા લાગ્યાં સર્વેદીડો બાણુસુરરાય. ૨ નગર સમીપે ચાલી
આંયો, બાણુસુર બળવાન; કૈબાંડનામેરાયતણેધે ૨ પ્રગટ
ચચો પ્રધાન. ઉકોઈક હેશની કન્યા લાવી, પરણુાંયો રાજન
હેશ જીતવા સંચર્યો રાય બાણુસુર બળવંત. ૪ પાતાળે ના
ગલોક જીતી, ચાદ્યો તણુંબાર, હેશ હેશના મહીપતી જીત્યો
કેહેતાં નાઓપાર. પસ્વગ જઈને હેવજીત્યા, હેવ નાડાંય,
સરજે વરતી સાંગ આપી, બાણું તણું કરમાંય. ૬ જીસુર-
ને પાછોવળીયો, મળીયા નારદમુન; પ્રણામકરીનેપાચેલાંયો
તેણે સમે રાજન. ૭ યો નારદજ ઓ નારદજ, ના થયું મારું
કામ; એક જોધ્યો ન મહુયો સ મી, ચોહેંચે મનની હામ. ૮
નારદ વાણું બોલીયા, તુંસુણું બાણુસુરરાય; જેણે તુજનેહા
થ આઘ્યા, તે શીવશું કર સંઘામ. ૯

કદવું ૫ મું.

રાગ દાળ-કૈલાશ પર્વત જઈ રાજયે, ભદ્રીભીડાવીબાય;
જળમાંહીનેમનાવડોલે એમ ડોલે ગીરીનાય. ૧ટોપકવચને
ગાઢા ફરશી, કડકડાટથકુથાય; તેણે સમે ઉમીયાજી મનમાંલા
ગ્યાંરે બહીવાય. ૨ જઈને શંકરને ચરણું નમીયાં, અહેં અહેં
શીવરાય; શાને કાનેભીહેં પાર્વતી, આચો બાણુસુરરાય. ૩
શાણીતપુરનું રાજ્ય આપ્યું, ઉપરકર હજર; વળી માગવાશું

આંયોછે, અંધ તણેા કુમાર. રસહસ્ય હાથ તો મુજને આ
ખ્યાતેતો સ્વામી સત્ય; એક ચોધ્યો મુજને આપો, બુઝ કર
વા સમર્થ. પાચો શીવ આપણું એ વઠીયે, આપ આંયા
મારી નજરે; ફટલુંડાંતુંએ શું એલ્યો, ખોટી હડ આતજરેક

કૃષ્ણ ૧ હં.

રાગ દાળ—તેતો તારે વણું કહે મેં ઉપજાંયો છેએકજે
કરછેદન કરીતારાને, કરશે કડકા અનેક. હતે તો સ્વામીકેમ
હુલાણું ચિંતા મુજને થાય, લેખાણાસુર લૈજ તુને આપુએક
ધ્વજય. રજ્યારે ધ્વજ આ ભાગી પડસે, ત્યારે કરતારાછેદા
સે; રધીર તણેા વરસાદ વરસસે, તારા નગરને વિષે. ડત્યારેતું
એમ જાણુને, રીપુરીતપન થયો સાર, વરદાન પામી વળીઓ
ખાણાસુર, સોણીતપુરમાં જય. રચેકસમે મહાહેત કહે, મારે
તપ કરવાનું મન તેણુસમે ઉમીયાએ માંડયું, અતિધણું રૂદન
પ અહો શીવજીઅહોશીવજી; જનમારોકેમ જય; મારેનથી
એક બાળક તે, કહો વલે શી થાય. રમહારદ વાણિ એલીયા
લે આ મારુ વરદાન; એકપુત્રનેએકજ પુત્રિ, ઉપજવજેસંતા
ન. રવરદાન આપી મહાહેવજી, વન તપ કરવાને જય; ઉમી-
યાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. રશિવનાં ધર મોટાં
જણિને, રખે આવતું કોય, એ બારક મેહલું બારણે તે, બેઠાં
બેઠાં જોય. રદક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;
હથ ચરણને ધુંટણું પાની, દુંકુઅંગ સ્વરૂપ. ૧૦ ચતુર્ભજને
હંડ મોટી, દિસી ફર્મ વિશાર; સોભા તેની શી કહું, કંઠે ધુધ

રમાણ. ૧૧ પેહેલા કરમાં જળકમંડળ, બીજે મોડીકાચાહાર; ત્રીજી કરમાં ફરસી સોદીયે, ચાથે રેખપમાણ. ૧૨ ગણેશને ઉપજલીને, બોલ્યાં પાર્વતી માત એની પાસે જોડ હોયતો, કરે તે બેઠાં વાત. ૧૩ વામ અંગથી મેલ લઈને, ઘડીયું કન્યારૂપ, સોભા તેની શી કહું, શુક્રહેવ કહે સુણુ લુપ. ૧૪ સેંથોટીલડી રાખડી અંબોડા વાંકી મોડ; કંઠકપોળને કામની, તેડે મોડા મોડ. ૧૫ હેઠળી કુલડી વેલણ ડામલી, રમત નાની ભાત; કંઠપોડા નાડાછડી તે આપ્યો લઈને હાથ. ૧૬

વલણ—પરીક્ષતને શુક્રહેવ કહે કુંવરી કન્યા જેહરે; ધર સાચવવાને બાળકો, એ પ્રકટાંયાં તેહરે.

કૃદું ૭ મું.

રાગ દાળ—હેવી નહાવણુ કરવા બેઠાં, નારહ આંધ્યાત્યાંય, ખાળક એ જોઈને નાઠા, ગયા શીવ છે જ્યાંય. ૧ નારહ ચાલી આંધીયા, મધુવન તતખેવ, ઓરે શીવળીએ રેશીવળી, નહૃત લુંડી ટેવ. ૨ વન વગડામાં ભમતા હીંડો, માથેવાલો ધુળા; આક ધંતરો વીળ્યા ચાવો; કરમાં લ્યો ત્રીસુળ. ૩ તમેરેવન માં તપ કરોને, ઘેર ચાલ્યુ ઘરસુત્ર; તમો વીના તો ઉમીયાજ એ, ઉપજાંયો છે પુત્ર. ૪ મહાહેવ ત્યાંથી પરવાર્યા, કૈવાશનો વાંય, ગણુપતી વાણી બોલીયા, આડી ધરી જેષીકાય. ૫ અલ્યા જર્ટિલા જોગી ભસ્મ અંગે, હીસંતો અદલુત; આજ્ઞા વીના આધીકાર નહી હોય પૃથ્વીના છો લુપ. ૬ વચ્ચનએવું સાંભળીને હોપીયા શિવરામ; લાતો ગડડા પાટુમુડી, આંધ્યા

ઘરની માંય.૭ ગણુપતીનો ગડહેપડ, અહાંડ ભાગી જાય; નિ
કાક તોખળભરવા લાગ્યું, આ તે શું કહેવાચ.૮ ત્યારે શિવ
જ ડોપીયાને, ચડી મનમાં રીશા; કોષ કરીને ત્રિસુળ મેદ્યું,
છેદ્યું ગણુપતીનું શિશ. ૯ માગસર વહી ચોથને દહાડે પુત્ર
માર્યો તર્ત; તે દહદેથી ચાદ્યું આવ્યું, ગણેશચોથનું વરત ૧૦
તે મત્રતક તો જઈને પહ્યું ચંદ્રના રથમાંય; તેથી ચતુર્થીને
દીવસે, ચંદ્ર પુજન ચાય, ૧૧એવે શિવજીએઘરમાં આવ્યા,
જ્યાં ઉમીયાજ નહાય; ઓખા બેઠીતી બારણે તે, નાશિગઈ
ઘરમાંય.૧૨ લવણુ હોટડીમાં જઈને ચેઠી, મનમાંવાતવિચારી
ભાઈના કટકા કીધા માટે, સુજને નાખસે મારી. ૧૩ મહા
હેવજ ઘરમાં ગયાને, ઝાંકયાં ઉમીયામન; નેત્ર ઉધાડી નીર
ઘીયું ત્યારે દીઠા પંચવદ્દન ૧૪ વસ્ત્ર પહેરી ઉમીયા કહેછે,
કેમ આવ્યા મહાહેવ, આક ભાંગ ધંતુરો ચાવો, નહૃતલુડી
ટેવ. ૧૫ નાહાતા ઉપર સુંદોડયા આવો, સમજે નહી મન
માંછે; એ બાળક મેદ્યાં બારણુ, કેમ આવ્યા મંદીરમાંછે. ૧૬
છાની રહે તું પાપણી, મેં જેયું પારણું બધું; આટલા દહાડા
સતી જાણુતો, પણ સર્વ લુંટી ખાંધું ૧૭ પણ સુજ વિનાતે
ગ્રજકીધી, એવું તારું કામ; પાર્વતીજતમેરાખ્યુહિમાચયાનુ
નામ. ૧૮ વચન એવું સાંભળીને, ઉમીયાને ઊઠી જવાણ; કાલે
તમો કહી ગયા હતા, જે પ્રગટ કરનો બાળ. ૧૯ ત્યારે શાંકરે
નીચે જેયું, મનમાં વાત વિચારી, તારી પુત્રીતો નાશી ગઈ,
તારા પુત્રને આવ્યો મારી. ૨૦

ક્રમં ૮ મુલાં.

સાખી—વારી વિના જુરે વેલડી, વાછરુ વિના જુરેગાય; બાં ધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય ૧ પુત્ર ધાન્યનેપુત્ર ધન, પુત્રજ આગેવાન; જે વેર પુત્ર ન નિપત્યયો, તેનાસુનાં બળો મશાણુ રપુત્ર વિના શિવ મારે પાંજરુ, વન ઉલે અભિબળિશ, શિવશાથી માર્યોગણુપતિ,, મહારો પુત્રક્રયાંથી મળી શા. તરાગ વિલાપનો વલણુ-ભોલો હો બાળારે હો ગણુપત, ભોલો હો બાળા. ૨૬, ઉમીયાલ્ કરેછે ઝદન, હો ગણુપત, શિવ શાને માર્યોમારે। તન, હો ગણુપત. ૧ શિવ પુત્રવિનાનેવી માય; હો ગણુપત; તેની સંપત્તિપર વેર જાય, હો ગણુપત. ૨ શિવ પુત્ર વિનાની માય, હો ગણુપત; તેતરણાથી હળવીથાય. હો ગણુપત. ત ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણુપત; મેં તો આપ્યું હતું વરદાન; હો ગણુપત. ૪ પેલા નારહીયાનું કામ, હો ગણુપત. ૬ મેં તો માર્યો તમારો તન; હો ગણુપત; આજ ઉંયો શો લુડો દંન, હો ગણુપત. ૭

રાગ આશાવરી—નંદી લુંગી મોકલ્યાતે ચેહેલીપાળોનેથ
હસ્તીએકમહુયે. માર્ગમાં, તેશર કીધોધાય. ૧ તેગજનુસુસ્તક
લાવીને, ધડઉપરમેલયુનેટ; ગડગડીને હેકુમેદુ, આગળ નીકળ્યુ
ચેટ. ૨ કાળા એના કુલસ્થળ; વરવા એનાહાંત; આગ એને
સુંદ મોટી લાંખા પહોળા કાન, ઉહેવમાં જશેશું પોશાસે, અ
પ્રારમુજનેહુખ; હેવતાસવેમેણું હેસે, ધનપાર્વતીની હુખ. ૪

કૃતું ૯ મું.

સાખી—રપગુણુનેવાડ પડયા, ચાલ્યા રાજદ્વાર; ગુણુને આ
ખા બેસણું, રપને કર્યો જુહાર. ૧ રપતો આખાં શીવેનાગ
રાં, ડોઈ નોગી અભિષુત; ચતુરાઈ હીધીબે ચારણું, વળીકોઈ
કોઈ રજુત. રપુન્ય વિનાધન કયાકામ્હો, કયા કામ્હો ઉદ્ક
વિષુકુભ; એ હો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણુ વિનારૂપ.
૩ સ્વરૂપહીયો શીવ ચાતુરી, નિકરરૂપ તાર પાછુદે; રપગુણ
ચતુરાઈ નહીં, એતોદુખ માંહે. જમાયાદીની તે સોમકુમુરખ
થર હીનીનાર; લોચન હીયે કુકડકુ જાયબેસે ઉડી ઝાડ. ૫

કૃતું ૧૦ મું.

રાગ માર્ઝ—પંથી જ્યારે ચાલે ગામ, પહેલુ લે ગણુપતિનું
નામ; કથા અંથ આરંભે જેહ, પ્રથમ ગણુપતી સમરે તેહ. ૧
સોભાગ્યવંતી શાણુગાર ધરે, ગણુપતી ડેર સમરણ કરે; સોની
સમરે ઘરતાંઘાટ, પંથીસમરે જાતાંવાટ. ૨ પંચવહનના ડેહરા
માંય, પહેલી પુજા ગણુપતિનીથાયએવિના મુજને પુલેતો, સ
વ્રો મીથાથાય. ૩ ઉથલો-શાનેકાજે રૂવે પાર્વતી, શાનેલોચન
ચાળેજેને ઘેરવિવાહ વાજન હસે, ત્યાં બેસરો ધીનેગોળોરે. ૪

કૃતું ૧૧ મું.

રાગ દાળ-ઓખાઓખાકહી ઉમીયાઓ, સાઢકર્યા બેચાર
ત્યારે ઓખા આવી ઉલ્લી, નીસરીને ઓઠડી બાહ્યાર ૧ ભાઈ
ભરાવીબામની તુંતો નાસી ગર્દ; મહાહેવે ગણુપતીનેભાર્યા
લે સુદ્ધ મનેનવકહી. ૨ તે માટેતાર અંગ ગળણે લુણુ, ખેલો

કાય; જ હૃત્યના કુળમાં અવતરણે, ઓણીપેર બોલ્યાંભાય ત
ઓાખાબાઇતો થરથર દુંજયાં, એતોવાત એડિંગઅપરાધપાએ
માતા મારી, આવડો શોઠંડ. ૪ ઉભીયા કહેમેં આપ હીથિતે
કેમ મીથ્યા થાય; હૃત્ય કુળમાં અવતરણે, હેવવરી ફોઈજાય
પ ચૈત્રના મેનારકમાં, આઈ તાહારે મહીમાય; ઓાખાહરણ
ને સાંલળો, મહા રોગથકી મુંડાય. ૬ ચૈત્રમાસનાત્રિસદહાડા,
અન્ન અલુણુ ખાય; ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા, પા-
છલા કહેવાય. ૭ પાંચ દીવસ ને નવ પગેતો, ત્રણ દીવસ
વીશેક; ત્રણ દીવસ નહિ થાય તો; કરવો દીવસ એક. ૮ એ
મ્રકારે પત કરવું, સમગ્રસ્તીજન; અલુણુ ખાયેને અવનીસુવે
વરી એકે ઉજવળ અન્ન. ૯ દેહ રક્ષણુ દાન કરવું લવણુકેરં
જેહ; પાર્વતી કહે પુત્રીને, સ્વાભાગ્ય લોગવેતેહ. ૧૦ વૈશાખ
સુદી તૃતીયાને દીન; તું આવજે મુજ પાસ; જોર્યકરીનેપુત્રી
તાહરી, પુરીશ મનની આજા. ૧૧ સુકદેવ કહે રાજ સુણો
અહી થયો એહ મ્રકાર; હવે બાણુસુરની શીગતથઈ તનેકહું
વિસ્તાર. ૧૨ વલણુ-કહું સકલ વિસ્તાર એનો સુણો રાજ
નીરધારરે; હવે બાણુસુર ત્યાંરાજકરતો ઓણીતપુરમોઝારરે.

૪૩૩ ૧૨ મું.

રાગસામશ્રીનીચાલ-રાયબાણુસુરનેબારણે, વાશવાઓવીરે
ચંડારણિ; નિત્ય પ્રત્યેરજવરતી, કર્યું ઝાકઝમાંર, બાણુસુરને
બારણે. ૧ રાય મેહેડિયેથી હોટો ઉત્તર્યો, થયો પ્રાતઃકાર મુખ
આગસ્થાડિધરા; સાજરણું છે સાર. બાણુસુર. રક્ષણબાણુ-

સુરવરતિવહે, મનમા પામીહુઃખ; મુજને હેખીકેમ ફેરોયું, અ
લીતાહરેપુખ. બાણુસુર. ઉ ત્યારેચંડાદણિવરતિવહે સાંભરી
ચેરાય; તમે ઉચચાનિયછું, મુખકેમ હેખાડાય. બાણુસુર. ૪
ત્યારે બાણુસુર વળતોવહે, સાંભળે રંડાય; સાચુરે બોલને
કામની. કરુંથે કડકાય. બાણુસુર. ૫ ત્યારે ચંડારણી વરતી
વહે, સાંભળોને રાજન; સાચુ બોલુ જેવો ઘટે, તેવો હેનેડંડ,
બાણુસુર. ૬ પ્રાતઃકાળે જેઈએ નહિં, વાજીયાનું વહન; ત-
મારે કંઈ છોડ નથી, સાંભળો હોરાજન, બાણુસુરને. ૭

કંડું ૧૩ મુઃ

રાગ આશાવરી-ચંડારતો કંઈએકનથી, રાયદશવાધના કહે
વાય; પહેલાચંડારજેનેકહીયે, નહિઉતરી નવ નાહાય. ૧ ખિને
ચંડાલજેનેકહીયે, પુત્રીનું ધનખાય, ત્રિને ચંડાલજેને કહીયે,
દુલેમાત પીતાય. ૨ ચોથાચંડાલ જેને કહીએ, હરેપારકીનાર;
પાંચમોચંડારજેને કહીયે, પરદારા શુંખાય. ઉછઠો ચંડાર ફેને
કહીએ, હરેપારકુંધન, સાતમોચંડારકેનેકહીએ જેનું મેલું મન
૪ આડમો ચંડાર ફેને કહીએ, કરમાયુ વહન, નવમો ચંડાર
ફેને કહીએ, નહીં તનયાકેતન.

કંડું ૧૪ મુઃ

રાગ આશાવરી-ખરીએ બાણુસુર રાય, પુત્ર માગવાને
જાય, મહાહેવળની પાસે આવી, બેઠોતપકરવા. ૧ હજરહાથે
તારીપાડી તવ રીજયા શ્રીમહાહેવ, આપોને આપોશિવળ
પુત્રએકતત્પેવ. રચીતકોપ લહીયા તેડાંયા કર્મતણું જેનાર
પુર્વરાજ તુંતો કંડાવે વૈશ્ય તણો અવતાર. ઉતારેપેટેએકજ

હો, લાડખાયો બાળ; બોજન કરવાતું બેઠોતે, સાંભળને ભુ-
પાળ. રતુજમાં તે જ મનાને આગ્યો, વેગે તારો બાળ; માટી
વારો હાથ અરહેવા બારકના હતા તે બાર. ૫ ત્યારે તુજને
સંખ્યા આચી, દાંડી કાઢીએ આળ; બારકયારેથરથર ધર્જયો
સાંભળને ભુપાળ. ૬ બાળકને તો રીસ ચઠીને, નવ ગણ્યો કાંઈ
તાત; તુજને પુત્ર ઠંડાલો નથી, તું વારીએ જન્મ સાતરે. ૭
કૃત્ત ૧૫ મુ:

રાગ દાળ—ઉમયાવાળી બોલીયાં, તું સુણુ બાણુસુરરાય
તારા મનમાં જોગમે, તને આપું એક કન્યાય ૧ ત્યારે બાણુસુર
કહે પુત્રી મારે, કોઈ કપુત્રસમાન; મુજને ટાળો વાંગીએ, આપો
એ વરદાન. ૨ કેદાઈક દેશનો રાજ જોઈશ, રાખશે મારું નામ
પોષ માસથી પુરણુ માસે, પુરણુ થશે મન કામ. ઉવર પામી
વળીએ બાણુસુર, શ્રોણુતપુરમાં જાય; બાણુમતીને ગર્ભરહ્યો
છે, તેનો કહુ મહીમાય. ૪ પોષ માસથી પુરણુ માસે, પ્રગત
થઈ કન્યાય; વધામણીએ પરવર્યા તે, રાજસભામાં જાય. ૫
શાણુનોશરીનોદીએ, તેની જન્મ પત્રીકા થાય; કીધા બગાકરી
ગુરૂળાએદ્વયા, પોતેણીવાર. ૬ પેહેબી ઉમયાળના અંગથી
પ્રગટી છે કન્યાય; તેને નામે રાશી જોઈને, નામધરો ઓખાય.
૭ અહુ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર; એથી તારા
હાથનો, વેગે ઉત્તરસે બાર ૮ ત્યારે આકાશ વાળી એવી થઈ,
તું સાંભળ નૃપ નીરધાર; એ પુત્રી દાચછાવરને વરશે, કોકાણુ
રૂપ કુમાર. ૯ જ્યારે પુત્રી પરણુશે, વરતસે હાહાકાર; બાર તે

તારશે તુજ હાથનો, તુજ જમાગ તેણીવાર. ૧૦ તે માટે તેડી
પરધાન, ઓળ્હીપેરે પુછેછે રાજન, હેવ વચન મીથાય નવથાય,
તે માટે કરવો ઉપાય. ૧૧ રચ્યો માળીયા સુંદરસાર, તે માટેકરે
ઉપાય; ઓખાખાઅને ચિગલેદાને, મેદ્દા મંહીર માળીયાં માંયરે.

કુદું ૧૬ મું.

રાગ ધનાશ્રી-પરીક્ષતે પ્રશ્ન કર્યું વિચારીજી, કહે કેમ પ્ર
ગત થઈએઉ નારીજી; ઓખાને ચીત્રલેદા કેમ ધરયાંનામજી
કેદવીધીએઆંયાં અસુરને ધામજી. ૧ (દાળ.) ધામ આંયાં
અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં; મુને વિસ્તારીને વર-
ણુવો, કેવી રીતીએ અવતર્યાં. ૨ શુકૃહેવ કહે સુણું પરિક્ષત,
અભીમન્યું કુમાર; પ્રશ્ન તે પુછ્યું મને, તેનો સંહેદ ખોઇની
રધાર. ૪ એકવારહેવપાતાળનાઠા, બાણુસુરના તાપથી; ત્યારે
વર્ણા કેરા જગનમાં, કન્યાપ્રગટી આપથી. ૫ કન્યા કહે કેમ
પ્રગટ કીધી, કહે અમસરઘું કામ; ત્યારે હેવ કહે હૈત્યદુઃખ
હેછે, બાણુસુર જેનું નામ. ૬ કન્યા કહે દુઃખ કાં ધરો બાણુસુર
આવશે પાતાળ; એના પીતાનાચરણપુજવા, નીત્ય જાય
છે પાતાળ પણ ત્યારે મને પુત્રી કરીને સાંપણે હું જઇશ એને
ઘેર; સાંકડી સગાઈએ સુતા થઈને કરાવું લુજની પેર. ૭ તેણે
સમે પાતાળ આંયો; બાણુસુરરાજન, તેનેહેવે હીકરી આ-
પી પ્રસન થઈને મન. ૮ પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આ
પો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દક્કાતો, ઉત્તરે શીરનીગા
ળ. ૯ ત્યારે રાજ કહે પ્રધાનને, આ પુરી સુકુવન, કાલે તેડીને

તુંતો આવજે, જાણું નહીં કેં જન. ૮ પ્રભાતે તે પ્રધાન આ-
યો; પુત્રી બેડી જ્યાંય; પુત્રી તો સમાધીલઈ, હરી ધ્યાન ધરે
છે ત્યાંય. ૧૦ વાયુ દ્વાર જેણું ઝંધીયાંને ઝ્યાંયા જ્વાસાંખાસ;
જમણું પગના અંગુથાપર, રહી છે અટ માસ. ૧૧ તેનોઈનિ
પાછો વહ્યો, પછી પુર ભણી પ્રધાન; અટમાસપુરણુતપથયું
ત્યારે પ્રધાર્ય ભગવાન ૧૨ માણય કહેતાં કન્યા કહે, મુને કરો
આજ્ઞા ગ્રકાશ; ખુત ભવિષ્યવર્ત્તમાન જાણુને, ઉડીચહું આ-
કાશ. ૧૩ એટલે પ્રલુચે તેને પાંખ આપી, વર આપીને વળી
યા હરી; પ્રધાન આંયો પુર વિષે, તે કૈબાંડ પુત્રી કરી. ૧૪
વલણું—કુંવરી થઈ પ્રધાનની, તેનું પ્રાકમ કેં ગ્રીછે નહીં
શુક્રહેવ કહે રાય સાંભળી, એચીત્રલેહાની ઉત્પત્તિ કહી ૧૫.
કદવું ૧૭ મું.

સાખી—ભાઈરવે ને કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ;
જે ઘેર પુત્રી લાડકવાઈ, તેનાં માખાપ માગે ભીખ. ૧ બાળો
અગ્રિ બધુ વન દૃષ્ટિ; છળવડે પર્વતકોરાય, અભળારૂઠીને કરે,
માણીધર નવ કળાય. ૨ એટલાં અંતન લીજીએ, જોઈઠીએ
કુશળાં. રાગ ઢાળ—નગરથકી એક જોજન, રાએ મેહેલ રચા-
યો સાર; ગોખ બારીને અટારી તેને, કહેતાનાવેપાર. ૩
મુરકુટ માણી મોતીએ જડયાં, માંહેપૂરોજનાપાટ, હયશાળા
ગજશાળાછે; હીંચવા હીંડાળા ખાટ. ૨ દીવસ માસ ને વરસ
જ્યાં, કન્યા મોટી થાય, ચીત્રલેહાને સંગેરમતાં, ઉલટ અંગન
માય. ઉસવાલાખ જોદ્રા રખવાળો, મેહેલચાછે રાજનં; એમકરે

તાં ઓખાબાઈને, આવ્યું જોખેખન છતમેરાત્રેજો। દીવસેજો।
નવમીચોલોચન; ઓખાકેરા માળીયામાં રખેસંચરે પવનરે.
કદવું ૧૮ મું.

રાગ દાળ-સોણીતપુરપાટણુ ભલું, રાય બાણુસુરનું ગામ
ઓખા તેની પુત્રીકહીએ કરતી ઉત્તમ કામ ૧ ઘડી એકમાં
લાવે સોગટાં, ઘડિ એકમાં પાટ; નાનાવિધની રમતરમે ઘડી
એકે હીડોળા ખાટ. ૨ ઘડી એકમાં ઢીગલાં પોતીયાં રમતી
હોડા હોડ; હીડોળો હિંયવાને કાજે, રેશમકેરી હોરી. ઉઘમઘમ
ઘમઘમ વુધરાગાને, વુધરડીનોગોર, નાનાવિધનું ગાણું ગાતાં
મધુરો નિકળો સોર. ૪ રમે જમે આનંદ કરે પહેલાં મંગળ
ગાય; જોખનવંતી થઇછે ઓખા, મંદીર માળીયા માંયરે પ
કદવું ૧૯ મું.

રાગસામેરી-જોખનીયું વાયુને ઓખા નાનડીરેલોલ, મારે
જોખનીયાની જય ઐની મારે ઘડી ઘડીરેલોલ; તુંતો સાંભળ
શૈયર ઐનડીરેલોલ, મારે મુરખ પીતા કાંઈજેતોનથીરેલોલ ૧
ઓલોઓખા વળતી વાણું સાંભળ ઐનડીરેલોલ; મારે જય
કન્યા કાળ વર જોતો નથીરેલોલ; મારા જોખનીયાના દીવશા
દહાડા ચાર જો, નાણેરે મળસે પણું ટાણે નહી મળેરે લોલ. ૨
કદવું ૨૦ મું.

રાગ આશાવરી-પાંચું વર્ધની પુત્રી તેતો, જૌરીરે કહેવાય;
તેને કન્યાદાન હેતો, કોઈ યજ્ઞ ફરા થાય. ૧ પણું પુત્રીકરાપી
તાનેકોઈ, સનજાવી કહો વાન; હેવ વી ૧૯નું ફરાને વરસ
થાય જો સાંત. રપુત્રીકેરા પીતાને, કોઈ કહેવોરે ધવધવ; ગાં-

ધર્મ વીવાહનું ફળ જેને, વર્પ થાય જે નવ. એમકરતાંવળી વચ્ચમાં, આવી પડે કાંઈ વાંક; મનુષ્ય વીવાહનું ફળ જેને, અ-ગીયારે આંડોઆંક. ૪ એમકરતાંવરસજયને બારપુરાથાય; પુત્રીનું મુખ પીતા જુવે, બેસે અહંહત્યાયરે. ૫

ક૧૭૩ ૨૧ મું.

રાગ આશાવરી-ચીત્રલેહા એહુંચેરે બાલી, સાંભળસૈયર વાત, તારે કાજે નહિં પરણાવે, બાળુ તારે તાત. ૧તારે કાજે જે પરણાવે, છેદાયરાયના હાથ; તારે કાજે નહીં પરણાવે, પ્રધ્યાન મારે તાત. ૨તાતકેરી આજ્ઞા લેઈ, આવેનેઓ આય; વચન સાંભળી ઓાખાવળી, ત્યાંથી બાલી જાય ઉતાતાયાપો આજ્ઞાતો, શાંભુપુજ્વાજઉં; બાળુસુરપ્રત્યેપુત્રીએ, વચન પ્રકા શી કલુ. ૪ઘેડી પુત્રી એમનકહીએ, એસીરહે. મંહીરમાંયઘેર આવે મહાદેવજી, પુજુનેલાગોપાય. પવચન સાંભળી ઓાખા ચાલ્યાં, પોતેણુવાર; ચીત્રલેહાસૈયરમારી, ઉપાય કરવોસાર.

ક૧૭૩ ૨૨ મું.

રાગસામેરી-ઓાખાતારેશ્વરણુઝબુકેઝાલરે, ઓાખાતારાકુ મફુમરાતા ગાલરે; ઓાખાતુંતો ચ લે હંસનીચાલરે, ચોળીને રંગરે ઓાખા તારા ચુંદીરે. ૧ ઓાખા તારે બોંધેમાળું બંધરે, ઓાખા તારુંમુખુંપુનમચંદરે; આખા તારેમનઉંપજ્યોઆ નંદરે, કસળીનહોરે ઓાખા તારા સાળુડેરે. ૨ ઓાખાં તારેસો લીતા શાળુગારરે, ઓાખા તારા તેજતણો નહીં પારરે; ઓાખા તને કર્ષ થયાં દશાખારરે, પાલવે નેપુરરેઓ ખાતારેવાજતારે.

કડવં ૨૩ મું.

સાખી-નહેરે બેની તારે વિશ્વુવા, કરકંકણુ સુદ્રિકાને હાર
એ પુરુષ વિના ચેહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. ૧ સે
થા ટીલદીરાખડી, નૈણુ કાજળ કુમ કુમ આડ; પુરુષ વીનાપે
હેરેજેપ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. ૨ (ચોપાઈચાલફેર)
બદ્ધાંતે તોડી નાંખ્યાહારરેઆતુંલેતારો શાણુગારરે, હુંતોનહી
પામું ભરથારરે, નહી ઓદું ઘાટડીરે. ૧ બાણુસુરમારોબાપરે
મારાં કોણુ જનમનાં પાપરે મુને નહીં પરણુંવે બાપરે, જો
ઉં વાટડીરે. ૨

કડવં ૨૪ મું.

રાગ ગોડી-વરવરવાને ચોગ્ય થઈને, પ્રગટયાં સીનાંચેનજી
ઓખા કહેછે ચીત્રલેહાને, વાત સાંભળમારી બેહેનજી. સૈયર
શું કીજે, અનીહાંરે હોહેલા કેમ લીજે; મારી બેનીરેદ્વાપ કર્મની
દીજે, અનીહાંરે કે વિષ ધોળી ધોળી પીજે. ૨૫. આજ મારે
ભડું જોખનીયું મદ પુરણુ મારી કાયજી; પીતા તો પ્રીછે નહી,
મારો કુંવારોભવ કેમ જાયરે સૈયર. ૧ સાસરે નીત્ય જાય ને
આવે, સૈયર તુજ સમાણીજી; હું અપરાધણુ હરખે પીડાણી,
આંખે ભરું નિત્ય પાણીરે. સૈયર. ૨ એરે હુખહું હુખળી, મને
અજી ઉદ્દક નવ ભાવેજી; આ અવાસ રૂપી શુળીએ સુતાંતો
નિદ્રા કેઇ પેરાવોવેરે. સૈયર, ૩ જળ વિનાની વેલડીને, લુણ
વિના જેવું અજીજી; ભરથાર વિનાભામનીએતો, હોહેલા કાઢે
દનરે. સૈયર. ૪ ધન્ય હશે કામનીને, જેણુ કંઠે કંથ ગ્રહી રા-

ખ્યાજું હું અભાગ્યાણીએ પરણ્યા પીયુનો અધરસુધારસનવ
ચાખ્યારે. સૈયર પમરજાહા માટે માણસ કરે, આંખનો અ-
ણુસારોજું; તે સુખ તો મેં સ્વપ્ને ન હીંકું; વ્યર્થ ગચોજન-
માર્યારે. શૈયર, દુસ્વામી કેરો સંગ નહીં સ્થામાને, એથી
ઓજું શું નરતુંજું; હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ
નેઅન જાએ ઊરતુંરે. શૈયર, ૭ ઓજું વાતર્યે નહીં મુજને
ભરથાર ભોગમાં મનજું; આંહિ પુરૂષ આવે તો પરણ્યું, નવ
પુછું જેશીને લખરે શૈયર. ૮ વચન રસિક કહેતાં કરણા ભારે
આવે લટકતી ચાલેજું; પ્રેમ કટાક્ષ પીયુને બોલાવે; તેર્દીયા
ભીતર સાલેરે. શૈયર, ૯ સુખ દુખ કર્મ કર્યું છે, હું લેવાઈ
મારે પાપેજું; અંધોગરી મારા કર્મ કરી, શુણીએચાવીમારા
બાપેરે શૈયર. ૧૦ મરકલડે સુખ મધુરે વચને, મરજાદ નવ
આણીજું; શાક પાકપીયુને નવપિરસ્યાંઅધોપાલવતાણીરે.
શૈયર, અકલગતીછે ગોવીંડજીની, શું નીપજશે એનીજું; ગો
પાલજીનું ગમતુ થાયે, મનહું મારું રહે નહીંરે શૈયર. ૧૨
કડવું રૂપ મું.

રાગ મેવાડની દેશી-ઓખાને કહે ચીત્રલેહા જે, તું તોસાં
ભળ બાલસનેહી જે; આપણું મોટા માખાપનાં છોડ્યેને, કેમ
કહીયે કાળુકે ગોડ્યેને. ૧ એની લાંઘન લાગે કુલમાં જે, પ્ર-
તીષ્ઠા જય એક પલમાં જે; અમે તો તમ પાસેન રહીએને,
જઈ બાણુસુર ને કહીએ જે. રવાત બાણુસુર રાય જાણે જે
આપણું એનો અંતર આણું જે; મને મેલ્લીગયોતારી પાસે

જો, તારો બાપ રહ્યો વિસ્વાસેનો. ઉમેં તો નથાય તારું રક્ષણું
જો, તુજુ માંહીશે છે અપલક્ષણાણું; એની છોકરવાહન કીજેનો,
તારા બાપ થકી તો બહીજે જો છતને દેખુછું મદમાતી જો,
નથી ચેટ ભરી અંન આવી જો, તારુંવચન મુને નથી ગમતું
જો, જોઅનીથું હશેસઉને દમતું જો. પકામબ્યાપે સર્વ અંગે
જો, એની રહીએ પોતાના દંગેજો; તુંતો એઠી નિહાળોપંથ
જો, કાલયહમાં કયાંથી હશે કંથ જો ક તેંતો મુને આંખમાં
ધાલી જો, માથે છાંણુથાપીને ચાલીજો; હુંપ્રીઈકામનુંકારણું
જો એનીરાખજો હૈયામાં ધારણુજો, તુંતો જીવેલોકમાંએકઠાં
જો, વમણું કયાંથી પામરોકાઠાંજો, એનીડગલાંન ભરીએલાંખાં
જો, ઉતાવળોન પાકે આંખાનો ઈ મારી ઓખાબાઇ સલુણું
જો, આંધો ચૈતર માસએમ કરતાં જો; પણીઓખાળવૃત
આચરતાં જો અલુણું અન્નજમીહીનખુવેજો. દ્વારીપક બાળો
ને અવનિએસુવે જો, માત ઉમીયાને આરાધે જો; થયું પુરણું
પત એક માથેજો, ડોણું જાણું એકાંતે જો. ૧૦

અનાસ એક સ્થંભ રિષે, પત કીધું ઓખાયરે;
સ્વનામાં સંજોગ સ્વનામીનો, ભર્ત પ્રેમાનંદગાયરે.

કડપું ૨૬ સું:

રાગ ઢાલ-ખાઇ તુંએ કુંવારી હુંએ કુંવરી સાંભળશૈયર
વાન; ગોર્યમાનીપુજાકરીએ; જોપામીસુંનાથ. ૧કોણુમસવાડે
ડોણુમસવાડેકોણુહાહાડે, ગોર્યનીપુજા થાય; મને કરીને આપો
પુતળાં હું પુજુ મારી માય. ૨ ફાગણું વહબીજના દહાડે કરવું

રે સ્થાપન; ચૈતર સુદી ત ના દહાડે, કરવું ગોથાપન. ત સક્ષન
સહ્યા પાથરી, સંદેસરાનાં પુલ; પુજી અરચી ઓાખા માગે,
જે જે વસ્તુ અમુદ્ધ્ય. ૪

કડવું ૨૭ મું:

રાગ ધોળ—ગોરયમા માગુરે ગોર્યમા માગું માગું માહારા
બાપનાં રાજ; માતા સહાએ સોહાગણી. ૧ ગોર્યમા માગુરે
મહારા ભાઈનાં રાજ; ભાલી તે હાલ હુલાવતી. ૨ ગોર્યમા
માગુરે ભારા સસરાનાં રાજ, સાસુને પ્રભાગણી. ૩ ગોર્યમા
માગુરે દિયર જેઠનાં રાજ; દેરાણી જેઠાણીનાં જેડલાં ૪ ગો
ર્યમા માગુરેતમારી પાસ; અખંડ હેતાતનઘાટી. ૫ ગોર્યમા
માગુરે હુંતો વારંવાર; ચાંદ્યો ચુડોને રાખડી. ૬ ગોર્યમા
માગુરે સરખા સરખી જોડ; માથે મન ગમતો ધણી. ૭

કડવું ૨૮ મું:

રાગ દાળ—એકદહાડોચિત્રલેહાને, ઉંઘ આવી સાર; વાસી
પુણ્યે કરતી પુજા ઓાખા તે નિરધાર. ૧ એટલે ચિત્રલેહા જ-
ગી, જુવે તો વાત વિપ્રિત; વાસી પુણ્ય ચઢાંયાં દીડાં, થઈર
હી ભયલીત. ૨ વાસી પુણ્યે પુજા કીધી, નાહ પામે ભરથાર.
ભરથાર જો હું નહી પાસું, તુ સાંભળ મોરીમાય. ઉઆલેતા
રાં પતળાં, મારી પુજેછે બલાય; ઉપર પાણી રેડીએ તો, આ
હુરાં ધોનાય. ૪ ઉંચેથી પછાડીએતો, ભાગી લુકો થાય; તું આ
લે તારાં પુતળાં, મારી પુજેછે બલાય પ પંદર દહાડા પુજા
કીધી, ઓવાંયાં નહી ઓલ; તુંતો યેની કહેતી હતી જે નહી

થ; તું આલે તારાં પુતળાં, મારી પુજે છે બલાયરે.

કુદું ૨૬ મુઃ

સાખી—શીવનાંલીજેવારાણું; જેણું નેત્રે બાહ્યોરેકામ; ત્રિ
પુરા હૈત્યને વિડારીયો, હુતો કેમ મેલું નામ, ૧ શીવ અંખ
ડાનંદ જેણું; ગંગાધરી શિષ્ય; ભાગીરથી તપથી ઉઠાડીયા, હું
કેમ મેલું તે ઈશ ૨ શીવ બોળોસુવે સમશાનમાં, ચોળોત્યા
રે રાખ; મારો ત્યારે બિક્ષાવૃત, આપે તેને લાખ. ૩

કુદું ૩૦ મુઃ

દાણ—હિમાચળની ભાણેજાઈ, ગણુપતી મારો વીર; મ-
હાદેવજીની પુજા કરીયે, મન રાખીને ધીર. ૧ અચેરી ગતમાં
ઓખા ચાહ્યાં તેનો કષુ વિસ્તાર; સનાનકરીનેકામનીયેતો,
સભ્યાશોળશાણુગારરે. ૨ નેપુર વાજે વિંછવાગાજે, ઝાંઝરનો
ઝમકાર; નાગદમણુંજુમણુને વળી, ઉપરએકાવળહાર. ઊડા
વચુદેલોજુલતીદામણું, દામનીયેચકલીઓચારપગોપાવલાંને
નેખુરવાગે, ધુધરીનો ધમકાર.. જવાળે વાળ મોતી પરોંયાં,
મોતીની શેરો સોળ; દરપણુલીધુ હાથમાંને, મુખે ભરીયાતં
ઓળ. પકનકથાળ મોતીએ ભરીઓ માંહેશ્રીકૃણ ફેરેંગ પા-
ન; આકથંતુરો અગથીઓ, શાંખાવળી નિરવાણ. ૬ આકાશ
માર્ગે પક્ષણુને, વેગે ચાલી જય; ઈંડ્રકેર્વિમાન ચાલે, એ-
વી છે સોભાય. ૭ મહાદેવને પાર્વતીષીઠા, પાસારમતાં સાર;
મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. ૮ સ્વામી
કાંઈ બેલા થયા, એ બાણું તણું કુમાર; હવે તું એમ જાણું છે

જે; કરસે અંગીકાર. દ્વારા વર્તોએ મન વિચાર્યુ, હવે તે વંઢી વાત; મહાહેવળને કામ જાણી, લોચને દીધા હાથ. ૧૧ ત્રીજું લોચન ઉધાડ્યું, શાંકરને લેલાટ; પાસે આવી ઓાખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૨ તેણે સમે ઓા ખાઆવી ઉભીયાને લાગી પાય; આવડી ઉતાવળીથઈઆવી, નહીંપામેભરથારે.

કુદું ૩૧ મુ.

સાખી—ઓાખા કહે છે અમે પેઠા પાણીમાં; તરવા તુંબા અણાં; હું આવી સસુદ્ર વચ્ચમાં, તુંબા પુટી ગયાં. ૧ ઓાખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હુંગઈ; પીવા ઝણોણિ પાય, મારાં ભર્યાં સરોવર ગયાં સુકાઈ. ૨ આણી તીરેથી અમે અળગાં થયાં, પેલી તીરે નવ ગયાં; કર્મ તણે સંજેગે, અમે મહ્ય જઈ વચે રહ્યાં. ૩ હું તો આવી ઈશ્વર પુજવા, સામો દીધો આપ; પરણ્યા પેહેલું રંડાપણ થયું, મારાં કીયા જન્મનાં પાપ. ૪ ઉભીયા તુંતો મોરિમાવડિ, છોડના દીને છેહ; માવિન તમો કેમ છુટસો હુંતો પુત્રિ તમારિટેહ. (દાળ.) પ્રેમે પ્રદક્ષિણા નરીને, કરણેડિ ઉભી બાળ; પારવતિ કહે માગ્ય વર, હું આપું તે તતકાળ. ૧ ઓાખા વળતું વચ્ચન યોલિ, હરખશુંતેણુવાર, માતા મુજનેઆપીએ, મારા મન ગમતો ભરથાર. ૨ ત્રણુવાર માગ્યું ફરિ ફરિને, મુને વર આપો આદિશ, લાજ મુકીને ઓાખા યોલિ, તવચ્ચી પાર્વતિને રિશ. ૩ નિર્બન્જ થઈતેં કામજ કીધું, માટે હેઉંછુંતુજને આપ; જ પરણુને ત્રણુવાર તું, એમ યોવ્યાં પાર્વતિ આપ. ૪

વળ નિંજે કહ્યુને તે તેરસેઆવિ, તારેત્રણુ હજોભરથારશ્રાપ
એવો સાંભળિને,કંપી રાજકુમાર પ પુરુષને નારિધણુરિ,તું
સાંભળ મોચિ માય; નારીને તો પુરુષ બીજો, શ્રવણુ સુછુયો
નવ જાય. ૬ સુંદર માધવ માસઆવશે, દ્વાદશિનો દન, ત્યારે
સ્વપનામાં આવિ પરણુસે, પ્રાણુતણુા જીવન. ૭ તું જગ્યા હેડ
ઓણઅલે, તનેકહું છું સત્ય વિવેક; ત્રણવારતો પરણુસે, પણ
વરતો એકનોએક. ૮ વર પામી ઓખાખાઈ ચાદ્યાં, મંદીર
માણિયે સાર; અરે બાઈ હું પરણુ આવિ, સુંદર વરભરથાર.
૯ એમ કરતાં ઓખાખાઈના હીન ઉપર જાય દિન; સુંદર
માધવ માસ આંયો, દ્વાદશિનો દન. ૧૦ સુંદર સજ્યાપા
થરિને, સાણુગાર્યુ ભોવન; આજસ્વપનંતરમાંઆવસે, મુજ
પ્રાણુતણુા જીવન. ૧૧ સંદ્યા થઈ રવિ આથમચોઆથમચો
કુષ્યપ તન; હજુએ ન આંયો હજુએ ન આંયોપ્રાણુતણુા
જીવન. ૧૨ ચોહોર રાત તો વહી ગઈને, હજુનાંયોકોઈ,
ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મીથ્યા હોય. ૧૩ વાવાયને
આરિ હાલે, ખડખડાટ બજુ થાય; એ આંયો એ આંયો
કહીને, તુરત એડી ચાય. ૧૪ તમો આંયા તે હું જાણું છું,
મારી સગિ નખુંદના વિર; બોલ્યા વિના નહી ઉધાડું હૃદિ
છે મુને ધીર. ૧૫ વેણુા લીધી હાથમાં ને ગિત મધુરાં ગાય;
ચેન કાંઈ પડે નહી, ને ભણુકારા બજુ થાય. ૧૬ તેવામાં એક
બારણુ ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાખાઈએ તો હોટ
કરિ; દ્વાર ઉધાડ્યું ત્યારે, ૧૭ આણુસુરે મેહેલ રચ્યોછે, તેનો!

સ્થંભજ એક તે તણો પડછાઓતે, ઓાખા નજરે હેણે. ૧૮
ઓપેલા આવ્યાછો, તમઉપર જઈ વારી; ઓદ્યા વિના તો
નહી ઓદ્વાલું, છું ગુણવંતી નારી. ૧૯ઓણાસુરજોણાણુશેતો
દેસે બેઠિના પ્રાણું; શાનેકાને આંહી ઉલાછો, સાસુના સંતા
ન. ૨૦ ઓાખાબાઈને માળીયામાં; પાડેછે બકોર; ઈશ્વરને
પાર્વતિઓગળને સાંભજ્યોછે સોર. ૨૧ ઈશ્વર કહે છે ઊમી-
યાળને ડોણું રૂવેછે નાર; ઊમીયાકહેછેમહાહેવળ, ઓાખા
રૂવે નીરધાર. ૨૨ વચન આપણું મીથા કરવા, ષેઠી બાણું
માર; તામરી વિધા મોકલીતે નિદ્રાનોલંડાર. ૨૩મહેયરાત
તો વહી ગઈ ને, મીચાણું લોચન, સ્વર્ણાંતરમાં આવી
પરણ્યો મહ્યુમનનો તન. ૨૪

કુદું ૩૨ મું.

રાગ ધોળ-સ્વર્ણાંતરમાંદીઠિસોરઠીયાનીજનરે સ્વર્ણાં
તરમાં વડસસરો ભગવાનરે. ૧ સ્વર્ણાંતરમાંખળકે મીંઠળ
ચુડીરે; સ્વર્ણાંતરમાં ઓાખા દીસેછે અતી રૂડીરે. ૨ સ્વર્ણાં
તરમાં વરત્યાંછે મંગળ ચારરે; સ્વર્ણાંતરમાં આરોગ્યા કંસા
રે. ૩ સ્વર્ણાંતરમાં કરેછે પીઉજશું વાતરે; સ્વર્ણાંતરમાં
હશીહશી તાલી દેછે હાથરે. ૪ ચીત્રલેહા ભરીરે નીદ્રામાંથી
જગીરે; ઓાખાબાઈને કોણું કરમગતી લાગી. ૫ ઓાખાખા
ઇને નાટક ચેટક લાગ્યુરે; તેતો હેમ કરીને થાશે અળગુરે. ૬
જગ્ય જગ્ય ઓાખા જગ્યરે, તહારે જે નેઈએ તે માગ્યરે. ૭

રાગ મારુ-ઓાખા ભરીરે નિદ્રામાંથી જગી, અંગોઅંગ

અંગુઠી લાગી, ઇટ પાપળી શીહને જગાડી, મને ભર્યા અ-
ગ્રત માંથી કહાડી. ૧ ઇટ પાપળીએ શું કીધું, અમૃત લઈને
વીજનજીધું; બીડી પાનની અડધી કરડી, ખાધી મનવિના-
મુખ મરડી. ૨ જુવો મહારા કરણુંની કરણી, વરશેમેદી ગ-
યા મુને પરણી; મહારા પીઓને મતી જે આવી. મહારાનાથ
ગયારે રીસાવી. ૩ મહારા હૃદ્યા કેરો હાર; આણિએ આપો
આણી વાર. ૪

૫૫૩ ૩૩ મું.

રાગ શારઠ-શૈયર શત્રુસેંથઈને લાગી, મને સ્વર્ણાંમાંથી
જગાડીરેહો, ઉમીયાનો. વર આજ સહ્યા થયોને જપતાં છે
દહાડી દાહાડીરેહો. ૧ અધવચ કુવામાં મુજને ઉતારીરે, વ-
ચેથી વરત મેદ્યા વાઢીરેહો; બાગખગીયામાં પુલ પુલ્યાંછેરે
હો પુલી મહારી તનડાની વાડીરેહો. ૨ પ્રેમાનંદ પ્રભુ જેતાં
ન ઓળાએ હો, એતરી જયછે દહાડી દહાડીરેહો. સર્ઘયરરે
લુંડીશૈયરશત્રુશેથઈનેલાગિ, મુનેસ્વર્ણામાંથીજગાડિરેહો. ૩

૫૫૩ ૩૪ મું.

સાખી-ચંદ્ર તુંતો જીવો કરોડ વરસ, સ્વપને થયો સંને
ગ; શ્રાપ હેઉંછું સુરજ હેવતા, મુજ જાગો પડિયો. શીજોગ. ૧
સ્વર્ણામાં મહારાપીગિજું, અમે કરતાં લીલા લેહેર; અમૃ-
તરસ હું પિતિ હતિ, તેમાં તેં મેદ્યા જેર. ૨ કંથ વિજોગે એ
કામનિ, ગાઇ પંડિતની પાસ; ભુલ જે પુછું પંડિતો, એક દી
ન હેઠેતિ માસ. ઉ રૂદ્રિકર પંડિત એ કુહે, સાંભળ ઓખા

કરનેડી; શોધી લહેા એ પીડિલુ; એક વરસે કરેાડ.૪ એંખાખા
પુછેએા પક્ષીડો, તારી એ પાંખો માગીશ; હું મહારાસજજ-
નને ભળી; તારી પાંખો પાછી દૃઢશ. ૫ પાંખખારીપથંતો
વેગળો, તારો પિઉ કોણુજ દેશ; માગીતાગી પાંખડીયે, તારા
સજજનને કયાંથી ભળશે. ૬ ચાંચકઢાવુંખપર્દ્યાતાહરી, ઉપર
ડારુવુંણુ; ભીને રંગે પીડિ ભાહરો, તને પિઉ ભળશે કુંણુ. ૭
પીડિ વીનેગ પીડી અઈ, મારુ તનમન સુકાઈ જાય; ગવરીતું
વાહન ચંડીતો, સઉ સફરનાજાય. ૮ લેખલખ્યા છઠો તણ્ણા,
તે મટી કયમ જાય; કર્મેલખ્યુંતેલો ગવે, તેની પક્ષકરે જહુરાય,
રાગ ધરાડી-મધ્યનીશાસમેરે; માળીયામાંરેતીરે રાજકુમાર,
કયાં ગયો કયાં ગયોરે, બાઈ મહારો સ્વપનાનો ભરથાર. મી
દળમારું કયાં ગયુરે, બાઈ મારોચુડલો હતો જે હાથ; હાતામાં
દળી ગયુરે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. ૨ પિયુ પરહે-
શિયારે, ઝુંડા મને લીધિ શે નવ સાથ; આજ વેરણ થઈરે;
બાઈ મહારા સ્વપના કેરી રાત. ઉલાવ સખી વીખ પીઉરે,
બાઈ મહારા કાઢું પાપી ગ્રાણુ; હવે હું કેમ કરુંરે; બાઈ મને
વાગ્યાં વિરહનાં બાણુ. ૪ પાપી મારોજીવડોરે, એંખાખાએ
પડતું મેદ્યુધરણુ; રોતારોતાંજ્યાંગયારે, એંખાબાઈયે રોપીયું
વાડિવન. ૫ જઈને પુછુ દુંમનેરે; કયાંઈમાહરો દીઠોગ્રાણુજ
વન; તું ગુણુ એલાડિરે, બાઈ જેને કરમ વિચાર. ૬ નાથમેલિ
ગયારે, બાઈ મહારાં કોણુ જનમનાં પાપ; આજ વેરણથઈરે,
બાઈ મહારા સ્વપના કેરી રાત. ૭ જોખન મેં તો જણોયુંરે;

આણું મારા પ્રભુને બેટ કરિશ જે પ્રભુ નહીંમળે, તો હું
માહારા ગ્રાણું તજીશ. ૮

કું ૩૫ મું.

સાખી-ઓખા ઇવે ચિત્રલેણા વીનવે, ધેલિસર્વયરનવરે-
થ; સ્વર્પને હીહું જે નીપને, તો હુઃખ ન પામે ડોય; ૧૯૩
વલોવે માંખણું નીપને, હુખુ કોઈ નવ ખાય, મુને વાહાદી
હતિ; અતિ સખી તું તો ચિત્રલેણાય. ૨ વેરણું થર્ઝ વીધાનિ
એણે આડા લખીયા આંક; એકવારઆવે મારા હાથમાં, તો
ઘસીને વાઢુ નાક. ૩ કરમલખાવેતોલખે, ભરિનેમેદ્યોઆક
કરણું પ્રાસી ભોગવો, તેમાં વિધાનિનો શો વાક.૪ વિધાનિ
આપે તેને લક્ષ હીચો, ન આપે તેને છેક; એકવારપોકારેબા
રણું, તેને પુત્ર જન એક.પલાંચ લેઈ લખતીહતે, તો આપત
સહુથી પેહેલું; મારા પીઉ વિનેગણું ન જાણુતી મારુ મરણ
લખાવતી વેહેલુંરે. ૬

કું ૩૬ મું.

રાગ આશાવરી-સ્વપનું સાચું નહોય, સદ્યરમારિસ્વપનું
સાચું ન હોય; ટેક. એકરંકહતોતે રાજ્ય પાખ્યો, સ્વર્પનાંત-
રમાં સાર; હસ્તી જુલે તેને બારણું રથ ઘોડા પરમ વિશાળ
જાગીને જોવાજયત્યારે, ગાંધર્વન મળો એક સ્વપનું. ૧ એક
નીરધનીયો તે ધનપાખ્યો, સ્વપનાતરમાંશાર; તેનેહેશવિહેશ
વહાણું ચાલે, વાણુંતર છે શાર; જાગીને જોવા લાગ્યો ત્યારે
કેને લાવે પાસ સ્વપનું.૨ એક મુરખ હતોતેસ્વપનાંતરમાં
ભણ્યો વેદ પુરણું; જાગીને ભણુવા જય ત્યારે, મુખે ન આ

વડે પાશાણુ, સ્વભૂતિ. ઉએક વાંગીયા તે સ્વભાવાંતરમાં, વજે
પાભ્યા બળ; તેનું ધોડીયું ધો જરે બાંધું; પારણું પરશાળ;
અગીને જોવા જય ત્યારે, કેનું લાવે બાળ; સ્વભૂતિ સાચું ન
હોય, સઈધિર મારી સ્વભૂતિ સાચું ન હોય. ૪

કૃદિપ ૩૭ મું.

રાગ કણ્યાણુ—ચિત્ર ચાળીને વાનો વાળીને; બેળીને પર
મેલીને, લેખણુ લાલીને કરમાં સાહીને, રંગ ભરતીરે ચીત્ર
કરતીરે. ૧ હવે સ્વર્ગના લોક લાખાયરે; લાખ્યા સ્વર્ગ લોકના
રાયરે; ઉપરલોકલખ્યુંને લુરલોક લખ્યું, જમ લોકને તપલોક.
લાખ્યા. રસત્યલોક લખ્યોનેવૈકુંઠ લખીયું; શુષ્ણલોક લખીયો.
નેગાંધર્વ હેશ લખીયો; હવે ઓાખાખાઈ તમે ઓરાંઆવોને
આમાં હોય તેને આવીને બોલાવોરે. ૩ ઓાખા આવીને
કાગળમાંનોયરે, એતારાતે રાતે લોચને રોયરે, બાહ્ય બાહ્ય
આતો નથી ગમતુરે, એને રણુવગડામાં મેલો જઈને રમતુરે
૪ ચિત્ર ચાળીને વાનો વાળીને, લેખણુ લાલીને કરમાંસાહીને
રંગ લેળીને પર મેલીને; હવે પાતાળ લોક લાખાયરે. ૫ અતળ
લખીયુંને વિતળ લખીયું, શેતુતળ લખીયુને પાતાળ લખીયું
તળાતળ લખીયું રસાતળ લખીયું, મહાતળ લખીયું તેણીવાર
રે, ફલખીયા પાતાળલોકનારાયરે, નાગ લોક લખીયાતેણીવા
રે; વાસુકીનાગ લખીયાને ત્રિશ્રુતનાગ લખીયા પુંડરીકનાગ લખીયાને
મળીધરનાગ લખીયાશેષનાગ લખીયા તેણીવારે. ૭
મારીઓાખાખાઈ સુલુષીયોરાંઆવોને, આમહોયતેને હશીને

બાલાવ્રાને; ખાજુયથાજુયચેતમાદર્પણે; હુંશું સ્વમમાજમાં પરણી
આવા ઝર્પણે; કાંતો ડાળા લીલાપીળા સાપરે, લાખનારી
ચિંતલેહા તારા બાપરે. ૮ ચિત્ર ચાળીનેવાનો વાળીને, હીનો
ખાળિને ડાખળ ખાડીને, હેઠે મૃત્યુલોક લખાયરે, લખિયામૃ
ત્યુલોકનારાયરે. ૧૦ અજમેરલખિયુને અદીયારલખીયું; મુલ
તાનલખિયુનેતાર્વાડ લખિયું એ. રાસન લખીયોને બંગાળ
લખીયોને, એકમુખાને અક્ષમુખાલખોયા. ૧૧ સ્વાનમુખાલ
ખીયાનેમંજરમુખા લખી, હસ્તમુખ લખીયાને ગાંધર્વ મુ-
ખાલખીયાએકટંગાલ્લખીયાનેઅસ્ત્રિવાળા લખીયા, લખી
વનસ્પતીલારચારદારરે. ૧૨ ઓખાઆવીજુવો ભરથારરે; ખાઈ
કાગળલખીયાતેતારેપાડે; હુંશું રવઘનાંતરમાં પરણીઆવાંજા
ડરે. ૧૩ બાઈલખતાંતેલેખણુતુટીરે, ખડીઆમાંથી રશનાઈયુ
ટીરેથયાકાગળના અંબારરે; તનેસ્વરઘનું નથી લાદ્યુસારરે. ૧૪

કંડં ૩૮ મું.

સાખી-સોારઠહેશસોહામણુજને જોયાનાડોડ; શ્રીરસ્તના-
ગરને ગોમતી, ત્યાંતો રાજ કરે રણછોડ. ૧ સોારઠ હેશ સોહા-
મણું, નચઢ્યો ગાડ ગીરલાર; ન-હારો ગંગા ચોમતી, તેને
એળો ગઢ્યો અવતાર. ૨ સોારઠ હેશ સોહામણું વેદ વેદ હેલુ
કરંત; ગંગોછક ભરી કંચુકી; ચાચ હસી જરણું ધરંત. ડસોારઠા
સુષઢ માનવી; રાજ નીતનીત કરે કહેવાર; એક નથર લલીં
માનવી, તેને ઉભા ઉભા જુહાર. ૪ સોગ જુલાસી—આજદે
સ્વઘનામાં હીઠી સોહીયાની જાનરે, ભાસુદુરે લાલચુભ આ

થાં પરાણુયાને; આજરે સ્વચ્છામાં હીડી જોમતીની તીરે,
આજ સ્વચ્છનામાં હીડાહુણાધરણુના વીરરે; આજરે સપનામાં
હીડાસુંદરવરલરથારે; તેમાંઓહથરિદ્ધાંને અદ્ધાં જગતારે.

કદ્દર ૩૬ મુ.

રાગ કદ્દાણ-ચીત્રચાળીને વાનોવાળીને, રંગ લેળીને પટ
મેલીને; રંગ ભરતીરે ચીત્ર કર્તીરે, લેખણ લાવીને કરમાં
સાહી. ૧ હવે સોરઠ દેશ લખાયરે, ત્યાં નગર લખીયુંદ્વારકાં
યરે; લખી જાદવપતી રાજધાનીરે તેની સોભાતોસુરજ સમા
ધીરે. ૨ લખીયા જાદવ પરીવારરે; ઉથસેન લખીયા તેષ્ઠીવા
રે, હૃતવર્મા લખ્યા સાતવીક લખીયા, ઓધવ લખીયાને
અહૃતલખીયા. ઉવાસુહેવ લખીયાતેણીવારરે; ઓખા આવીને
જુયોને ભરથારરે; બાઈ તેતા એધાણુ મળીયાં, આ ઘરડાને
માથે પળિયારે. જેને માથે મુગટ કુંડળ કાનેરે એવા જે લ-
ખાયા ભગવાનરે; ઓચા આવી જોવાનેભરથારરે, બાઈના
સરઘું હૃપ તેના ચાળારે. ૫ મારા નાથજ જોતાને આતે કા
જારે, તેને વડસસરો વડસસરો સહુ કહેતારે; હુંપરણીત્યારે
ચોરી સાહીને રહેતારે. ૬ લખીયા હૃપણુતણુ કુમારરે; એક
લાખ ફરતા હુંથારે; એંથી ડાગળ લખીયા તેષ્ઠીવારરે; ઓ
ખા આવી જુયોને ભરથારરે. ૭ એસે રીછડાનાથાળરે. એને
માથે મોટા વાળાંએના કુગમાંમારો કંથ, એને ધાવણનાથે
હંતા. ૮ એસે રૂપાળોને ઉચોરે, એને મોકે નથી મુછેણ; ત્યારે
લખીયા પ્રહણુ મહરે, ઓખાનું કંઈક સાન્યું મનરે, હું જાણે

હોય હે નહોય, મુજને પરણું ચોહાય, એને સગોસસરો
સૌ કહેતારે, હું પરણી ત્યારે મારી પાસે રહેતારે. ૧૦
વલણુ-એમ કહીને અનીરૂપ લખીયા, ક્ષાળું ન લાગીવારરે.
મુખ ભરડી ઉલ્લી રહી, બાઈ એ મારો ભરથારરે. ૧૧

કક્ષું ૪૦ મું.

રાગ ટાળ-ચિત્રલેહાના હાથમાંથી પેલું લખીયું પુતળું
જોહ; પ્રેમ આણું ઓખાખાઈએ, જુટી લીધું છોહ. ૧૫૨ માંલે
ઇને કામની, કંઈ હેઠે આલીંગન માળીયામાં મેલી ચાલ્યા
પ્રાણુતણુંલુંવન. ૨ આણુંવાર હુંનહી જવા ડેઉ, મેં જાણ્યો
છે છેડો; મારા પીઉલ પરવરો તો, મુજને સાથેટેડો. ૩ ચિત્ર
લેહા એણુંપેર બોલી, સંજોદેછે જોડ; તેતો પહોડયો છે દવા-
રકામાં, આ તો ચિત્રામણુના ઘોડારે. ૪

કક્ષું ૪૧ મું.

રાગ પરજ-આપો આણું, એ વર મુને આપો હોઆણું
નીકર કાઢુ મારો પ્રાણિનું, એવર મુને આપો હો આણિનું. ૨૫;
મેતોસ્વર્પને હીઠો ને છોગાળોરે, તેની પાપણુનો છે ચાળોરે;
મારુ મનદું હુયું લટકાળો; તે વર મુને આપો હો આણું. ૧
જેના હીર્થાહુ અજાણુરે, મકરાહૃત કુંડળકાનરે; અંગ શોલે
એ લીનેવાન, તે વર મું ૨ જેના લક્ષ્ણ વીસને બારરે, મુને
પરણું ગયો છે કાલરે; તેને વરસ થયાં દશ બાર. વર મું ૩
વરની લટકતી છે ચાલરે; મુને પરણું ગયો છે કાલરે; તેને
ટપકુ કીધું જોરે ગાલ. વર મું ૪ રાજે પીતાંભરપરીધામર
મુને કહેતો ગયો નહીં નામરે; ત્યારે કુયાંથી સરે મારુ કામ

તેવરમું છ્યોત્ત્રલેહા બોલીવાણુરે, સઈયર કેમ થઈ અજાણુરે
બાઈ મારી ત્યાંતે જાએ ડોણ, તે વર સું દ કોટ કાંગરે ચ્યાભું
ડાંયરે, છપનકોડછે ચોકી માંયરે; ચક જળહળતું છે ત્યાંયરે,
મુને માર હેલા માંય, તે વરસું ૭

કુદું ૪૨ સુઃ

રાગ મારુ—ઓષ્ઠા કહે છે સુણુ સાહેલી, લાંય કંથને વે-
હેલી વહેલી; બાઈ તુંછે સુખની દાતા, લાંય સ્વામીને થાય
સુખસાતા. ૧ ચતુરાને કહે ચિત્રલેહા, બાઈઓણાઉપાય
કેવા; દુર પંથછે દ્વારા મતી, કેમ જવાય મારીવતી. રત્યાં જઈ
ન શકે રાયશક્ક, રક્ષણ કરે સુદરશનચક; જાવું જોજનસહસ્ર
અગ્રીયાર, તારો કેમ આવે ભરથાર. ૩ નયણે નીરની ધારા
વહેછે, કરનોડીને કન્યા કહેછે, બાઈતારી ગતીછે મોટી, તને
કોઈ ન કરી શકે ઓટી. છસૈયરને સૈયર૦હાલી, છે મેં જ મણે
હાથે જાલી આપણુ એઉ જણુ સંઘાતી, તું પ્રાણુદાતાછે, વિ-
ધાન્તિપ માબાપ વેરી છે મારાં, મેંતો ચરણ સેવ્યાછે તારા;
વિધાન્તિ તું હીનદ્યાળ, એમ કહીને પગે લાગી બાળ દ ચિત્ર
ત્રલેહાયે ધારણા હીધી, પછી હેઠ પક્ષિખુની કીધી. ૭

કુદું ૪૩ સુઃ

રાગ દાળ—ચ્યોત્ત્રલેહા કહે ઓષ્ઠાબાઈ, મારે દ્વારકા માંનલુ
પ્રશુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ગ્રાવું, ૧ અગ્રીયાર
સહસ્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ; સુદરશન જો ચક
મળેતો છેદે મારું શીશ. ૨ બાઈ તુજને તાણુ તો નવ પડેને
જેમ તેમ વહેલી થાને, લાંય મહારા કંથને તું; ઓટીયાયછે

શાને ઉ જાતી વેષા ઓખા કહે છે, મારો વરણે રૂડો; કર્મે
અહ્યાંછો કુંવારાં, માટે રખે ચેહેરતાં ચુંદો. ચીત્રલેખાએ ક-
હેવા માંડખું, મનમાં સખો ધીર; તુજ સ્વઅનામાં પરણી ગયો.
મારી માડી જાયો વીર. ૫ ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ
રહી વાટડી; મારો વર રૂડો જાણું; રખે ઓઠતી ધાટડી. ૬ હું
નહીં ઓઢું ધાટડી, તું એ શી બોલી વાત, તુજ સ્વપનામાં
પરણી ગયો, મારી માડી જાયો ભાત. ૭ એવું કહીને ઉડી
તે, પવનવેગેજાય; આકાશ માર્ગે સંચરી, પોણાચી ગોમતી
માંચ. ૮ ગોમતીમાં ભરદન કયુંને વિચારીયું તે ડામ; પ્રભુના
ઘરમાં ચારી કરવી, નહીં એકલાનું કામ. ૯ પણીતેણે નારદ
મુની સંભાર્યા, તતક્ષણું આણ્યા ધાઈ; કહેરે મુજને કેમ સં
ભાર્યા, ચીત્રલેહા બાઈ. ૧૦ બાળાસુરની દીકરીને, લાયું છે
સ્વપન; અનિરૂદ્ધ સેને વરીગયો, વિંહળ થયું છે મન. ૧૧
ચારી કરવા હું આવી, સુદર્શન આડુંથાય; તેમાટે તમને સં-
ભાર્યા, કરવા માહારી સહાય. ૧૨ નારદ કહે છે ઓરે બાઈ,
એમાં તે શું કામ; એક તામસી વિદ્ધા એવી ભણ્ણાનું, ઉઘે
બધું ગામ. ૧૩ ચીત્રલેહા કહે સાચું કલ્યુ, પણ છેતરવા જુ-
ગહીશ; ચેહેલું સુદર્શનચક મળેતો, છેહે માર્દ શીશ. ૧૪ ચ-
કરની ચીંતા નવકરશો, જેમાર્ગે જાશે ચોકીઝરવા; તેરે માર્ગે
હું જરૂરિશ, જેસાડીશ વાતો કરવા. ૧૫ પણી તામસી વિદ્ધા
ભણ્ણાવી, જીબે જીપતી જાય; ચોસઠ કણા માંચાસુંડાતે, ડશક
ગેહું ખાય. ૧૬ ગામ તો ધારણું પડ્યું ને ઉંધ્યા કોણ;

ચિત્રકોહા નગરમાંપેડી; મુકી મનનો શોક. ૧૭ નારદે વિચા-
ણું ચિત્રકોહા, અનીહૃદતે લઈ જાયે; શીવને શામળીયો વહ
થે; જુદુ જોવા જેવું થાશો, ૧૮ ચક્ર ચોડી ફરતું આવ્યું; મા-
રગમાં નીરધાર; તે માર્ગસામા મળીયા, નારદભ્રાહુમાર. ૧૯
નારદ કહેછે ચક્રને, તું દાહાડીજાયછે ફરવા; એક ઘડીવારથે
શાને, મુજસાથે વાતો કરવા. ૨૦ તુંને હું તોક્યાં મળિશા, તું
સાચી કહેને વાત, ડેઈ દહાડીમુજનેસંભારે, દવારકાંનોનાથ
૨૧ ચક્ર મુખથી યોલીયું, વળી મારું તે ધન્યભાગ્ય; તમારા
દરશનનોતા, કયાંથીપામુંદાગ. ૨૨ લોણું ચક્ર સમજ્યું નહીં
એહું નિરાંતવું થઈ; પેલી નારી ચેડી નગ્રમાં, ચોરીકરવા ગઈ
૨૩ જેતી જેતી જ્યાં ગઈ, કૃશ્ન તણુરે ભોવન; ત્યાંથી આ-
ધેરી પરવરિ, જ્યાં પહોડયો પ્રદુદુમન. ૨૪ ત્યાંથી આધેરીપ
રવરી, મહાવિષ હેરો વિર; સોડ ઘાલીને સુઈ રહ્યો મહા ધનુ
ધૂધારી ધીર. ૨૫ હુમણ્યું જો હું એને જગાડું, માહારા મારી
દરે કડકાય; માથે હીટાળો લેઈ લીધેને, ઉલટ અંગ ન માય.
૨૬ જુગતઅંબે જે જુગતઅંબે, કરંતી તે જાય, હિંદોળો કે
ઇ જાતા હીઠો, નારદે તો ત્યાંચ. ૨૭ હીહેરો લેઈ પરવરીને,
સુમર્યા વૈકુંઠવાજ; પવન વેગે સંચરી આકાશ માર્ગજય.
૨૮ એવઢીમાં આવી પહોંચી, શોણીતપુર મોઝાર; તે હેકાણે
નારદજીઓ, જન ફાયર વિચાર. ૨૯ એ જ્યારેગઈત્યારે, હું એ
આરે જારી; તેણે તેણું ફામ ફર્જું, હું ચોડી સીફને થાડી. ૩૦
નારદ કહેછેચુકુરને, તું નીકદ્યુંચોઢી ફરવા, આવડીવાર સુર

ખ હેમ એહું, મુજસાથેવાતોકરવા, ત૧ નારહ કહેછે ચકરને
ઉડરાખતાંગામ; કાલે પછી ચોરી થશે; તું ન કેઠિશ મારું
નામ. ઉરાખાકાશ માર્ગે પક્ષીણી, તે વેગે ચાલીજય; ઓ-
આખાઈતોવાટજુવેછે, મંદીર માળીયા માંય. ત૩ વા વાયને
બારીહાલે, ખડખડાટખડુ ખાય; ચિત્રલેહા પાપણીતે, હજુએ
ન આવી આંય. ત૪ ચિત્રલેહા ચાલીઆવી, મંદીરમાળીયા
માંય; ભલે લાવી ભલે લાવી, હું જગાડું ભરથારરે. ત૫

કડઢં ૪૪ મું:

રાગ આશાવરી-ઉંધ્યા પેહુ જગાડીયે, ભર નિદ્રામાંથી
ઉઠાડીયે, મનસંગાથે એવા ખીલાયે અલંકરણ્યાતો શીદ લિ-
લ્યે. ૧ ભરથાર પહેલિ ભામની, જે અત્રરાંધી ખાય; વા-
ગાળ થઈ અવતરે; ઉંધે મસ્તકે ટંગાય; ભરથાર પહેલી
ભામનીજે, સુવે સંજ્યામાંય; આંધળી ચાકેરણુ અવતરે, પડ
માર્ગ માય. ઉભરથારનું જે કલું ન માને, આપ મતી જે ના-
રી; તેતો નારી અવતરે-કાંઈ ખીલાડી મંજારી. ૪ ભરથારનું
જે કલું ન માને, કરે તરફેડા કંચ, હડકાઈ કુતરી અવતરે
એણુ માથેપડશેજંત. ૫ ઓખાહરણેચીત્રલેહાને; તુંતો બેલે
આપ, પેહુ પહેલાયો હોયપીરણુ; કરડવાચાંયો હોય સાપરે.

કડઢં ૪૫ મું:

રાગ સાખી-સ્નિયરીત્ર અનેરાં, ડેઝ તેનોન લહે ભરમ
સ્નિય શામને ભોળવે; પણ ખોયો પોતાનો ધર્મ. ૧ રાગઢાળ
ઓખા કહેછે ચીત્રલેહાને, હવે ન ઓલીશ આડું; તું કહે તો

મારા પેઉને, પગ ચાંપી જગાડુ. ૧ ચિત્રલેહાકહે ઓખાખાઈ
આવડી ઉતાવળી શું થાય; એ મોટાનો કુંવરકહાવે, કાંઈક
હશે હથીયાર. ૨ ઓખારીઠે જઈ જોગા લાગી, તો મોટી એક ગ-
દાય; ઉપાડીને અણગી કીધી, ઓખા ચાંપે પાયરે. ૩

કુંબ ૪૬ મું.

રાગ મારુ-મહાખળીયોતે જાગીયો; તેનાખળનોનાવે પા-
રરે; હરુદ હાક મારી; કીધો છે હોકારરે. ૧ રમક ધમકંગલાં,
વાગે ઠારો ઠારે; આતો નહોયરે ન હોય; મારા બાપ જીનું
ગામરે. ૨ દ્વારીકામાં વસે, સઘળા વૈષણુવ જનરે; અહો રાત્રી
બઢા કરેછે, ત્યાં સહુ કીરતનરે. ૩ ભજન નાદ કેરા ચરડકા,
તે હોય અપારરે, ભુત બેરવ જોગણી, અસુર કોઈની નારરે,
ડાકણુંછો સાકયણી છો કોણુ છો બદ્ધાયરે; ચિત્રલેહા કરું
છે વીરા, ખમા ખમા ખમાયરે. ૫

કુંબ ૪૭ મું.

રાગ હેવશ્રી-અનિરુદ્ધ તે જાગીને ચેખે, ભુવનથી આરડાદે
ખે; કોણુ કારણુ અમને લાવીયાં હો, ચિત્રલેહા ઓદી શી-
મી. ૧ તમને લાચીદું જાણી, ઓખાને કરો પરાણી; વરવ-
રવાને અરથે હો, તમને લાવીયા હો. ૨ તમે નારીછો ધન્ય;
દીશાછે કુંવારી કન્યા; પરણુ તો થાય છે અન્યા; કેમ પરણુ
હો અસુરનંદની હો. ૩

કુંબ ૪૮ મું.

રાગ ધવળ-આણુસુરની નગરીમાં, ગડગડીયાં નીશાનરે;
ઓછેનેશબદે અનીરુદ્ધજાગીયારે. ૧ જાણ્યા જદૃવરાય; જુગતી

ન હેઠેરે; ચેષેરે ચેષે અસુરનાં ભાળીયાં, ર આતો નહોય અનારી નગરી, નહોય અમારુ ગામરે; ન હોય ન હોય કનકન દ્વારિકારે. ત ન હોય અમારી વાડીરે, અમે રમતાદહાડી દહીરે; ન હોય ન હોય પુષ્પ કનકનો ટોલીયોરે. ૪ અહિયાં ના ધણુવાગે, રણતુર ધણુરાંગાજેરે; ન હોય ન હોય શાંખ શબ્દોમણુરે. ૫ મને કેદ રંડા લાવીરે, મારી દ્વારકાં છંડાવીરે કેદરે ભામનીયે મુજને બોળવ્યોરે. ૬ આતો ઉંચા ઊચા માળ લોઠે જડ્યાં કુમારે; રત્નાગર સાગર શે નથી ગાજતોરે. ૭ ચિત્રલેહા બોલી આળરે, તમે જોઈને હેઠે ગાળરે; આ૧૦; ૧ છે આ કન્યા સુપે વરોરે. ૮ ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત, સુદ્ધ ધાલી હાથરે, જાણું જોઈને જાતગળીમાં કેમ બોળીયેરે. ૯ મરે વડવો જુગળુંન, અમે પ્રભુમનરાયનાતનરે; તેમાટે નહું પરણું હૈતની હીકરીરે. ૧૦ ચિત્રલેહા બોલી વાત, ટાંકી રાખે તમારી જાતરે; હવડાં વાતો કાઢીશ વડુવા તણું. ૧૧ શનક સુરને મારીરે, સોણાઙજર લાભ્યા નારીરે; તારા સમને તાર બાપેએક નથી પરણુંરે. ૧૨ એક લગ્ને વરી નવ પુષ્યાં કુળ ને પરીયાંરે; જાતભાત કોઈની પુછી નહીરે ૧૩ તારા બાપન ને ફર્દ, અરજુન સન્યાશીને ગાઈરે; મેં કાઢીને બોલ એવું દે નહીરે. ૧૪ જેણે વાયો વંદ્રાવનમાં વંશ, જેણું મારયો મામે કંસ, ધાવતાં મારી માસીપુતનારે. ૧૫ ધાવતા મારી માસી કરી રાખી કંસની દાસીરે; કુખજના કુળની વાતો કહેનાં નથીરે. ૧૬ તારો વડવિયો દધી માંખણુંનો ચોર, ચારયાં વંદ્રા-

નમાં ઢારે; છાશ પીનેતો ઉછરીયોરે. ૧૭ સત્રાળતને કાળેરે
મણી લેવા ગયા મહારાજરે; ત્યાંથી પરણી લાંબા બંધુવં-
તી રીછદીરે. ૧૮ લાંબા નખને ટુંકા ફેશ, વર્ણો હીસે એનો
વેશરે; ખુંડા સુખના છુંછાઉપર શું મોહી રહ્યોર. ૧૯ કહે તો
વાત વધારી કહીએ નીકર અહીયાંછાનાં રહીએરે; પુછો છો
તો કાન્યાનુંકુળ સાંભળોરે. ૨૦ એનો વડઊવો જુગળવન, એનો
વડઊવોકૈલાસનો રાજનરે; ઓાખાનીમાડીતો ઉમીયાસ્તીના
રહીમાચળની ભાણુજરે, ગણુપતી તેનો વીરરે; જીમીયાના
અરધાંગે ઓાખા ઉપનીરે. ૨૨ તારો વડવો જુગળવન, તેમ
એનો વડવો બળીરાજન; એક સમે બળિરાચેયજ્ઞ માંડીયોરે.
૨૩ બળીરાજ જગતનો અધીકારી, તારો વડઊવો ભીખારીરે
સાડાત્રણુ ડગલાં માટે કરણેડીયારે. ૨૪ આટલી વડાઈશાને
કરોછો; એના બાપની ભુમીમાં રહોછોરે, કરમહીણુના કપા
ળમાં ફોઇ ચોઠે નહીને. ૨૫ કહેતો વાત વધારી કહીયે, નીકર
આંહીથી છાના રહીયે; આંબા છો તો કાન્યા સુખે વરોરે.

કંડું ૪૬ મું.

રાગ દાળ-અનીરુદ્ધ વળતો ફોપીયોને, કયાં ગઈ મારી ગ-
દાય; તમારા બેજણુના હવે, મારીકરું કટકાય. ૧ તમે જાણું
અહીયાંલાવી, કર્યું બલેરું કામ, તમને બે જણુને મારી, ઉડી
જડી દ્વારીકા ગામ. ૨ ઓાખા ત્યારે થરથરધુલ, વેગે આ-
વી આડ; મારાપીઓળને હું મનાવું, તુલાવીતે તારો પાહાડરે.

કંડું ૪૦ મું.

રાગ સીધવો-માહારા સોરઠી સુખાણુ, મહ્યા મને મેલ-

સોમાં; મારા જીવના જીવનપ્રાણુ, મહુયા મને મેલશોમાં. ૧
 મારા શરીરના શાણુગાર મહુયા મને મેલશોમાં, મારા હઈડા
 ડેરા હાર મહુયા મને મેલશોમાં. ૨ મારી સાસુડીના જયા,
 મહુયા મને મેલશોમાં, સ્વઘેશીદાદ્યોતોહાથ, મહુયા મને
 મેલશોમાં. ઉત્તમને દાદાજીની આણુ, મહુયા મને મેલશોમાં;
 તમે ચાલો તો કાઢુ ગ્રાણુ, મહુયા મને મેલશે માં. ૪ ત્યારે
 અનિરૂદ્ધ બોલ્યો વાણુ, સાંભળ સુંદરી; અખળાએ નાંખ્યા
 બોલ, અમશું ઉથલડી. ૫ મારા વડવાની વાત, કાઢીને વઢી
 ત્યારે ઓખા બોલી વાણુ, એછે દાસલડી. ૬ કૈબાંડની તન-
 ચાય, પગની ખાસલડી; ત્યારે અનીરૂદ્ધ બોલ્યો વાણુ, હવેહું
 તને વડુ. ૭ તમે ગાળો હીધી સાર, મારુવેરવાળીયું; ચીત્રલેહા
 બોલી વાણુ, ગાળો હીધી સહી, તમે બે થયાં છો એક, ૮૨-
 ણાવું નહીં. ૮ પરણવાની પેર, સઘળી મેં લહી; મને મળીયા
 નારદ મુન્ય, વીધા શીખવી, ત્યારે ઓખા બોલી વાણુ, હવે
 વાર શાની; પરણાવ માળીયા માંય, રાજકુંવર નાહાની. ૯

કડક ૫૧ મું.

રાગ ધોળ-માળીયા માંમીથા અથ્રિ પ્રગટ કીધારે, માળિ
 યામાં હેવતા સાક્ષી લીધારે; માળીયા માં નારદ તુંબર વાયરે
 માળીયા માં કળસ ચોરી બંધાયરે. માળીયા માં પેહેલું મંગળ
 વરતાયરે, પેહેલે મંગળ શાંશાંહાન અપાયરે; ચિત્રલેહા આપે
 છે કરની મુદ્રીકાયરે, દાનેલેછેકું જુતણેસંતાનરે, માળીયા માં
 ખીજુ મંગળ વરતાયરે, બીજે મુંગળ શાંહાન અપાયરે

ચિત્રલેહા આપેછે સોળશાણુગારરે, દાનલેછે કશ્મ તણું સં-
તાનરે, માળિયામાં ત્રીજુ મંગળ વરતાયરે, તીજે મંગળ શાં
શાં દાન અપાયરે; ચિત્રલેહા આપેછે નવસરહારરે, દાનલેછે
કશ્મતણું કુમારરે, માળિયામાં ચોયું મંગળ વરતાયરે, ચોયું
મંગળ શાંશાંદાન અપાયરે; ચિત્રલેહા આપેછે ગાયોનાં હા
નરે, દાનલેછે કશ્મતણું સંતાનરે. માળીયામાં સમે વરતે સા-
વધાનરે, માળીયામાં આરોગ્યા કંશારરે; માળીયામાં ચાર
સોલાગ્યવંતી તેડાવોરે, એઓખાબાઈને સોલાગ્યવંતીકહીએા
લાવોરે. માળિયામાં ઓખા અનિરૂદ્ધ પરણી ઉઠ્યારે, માળિ
યામાંસોનાઈયે મેરે તૃઠ્યારે.

કડું ૫૨ મું.

રાગ ચોપાઈ ત્રિતાળ-ઓલ્યા શુકળ પ્રેમ વચન, સાંભળ
પરિક્ષત રાજન; મળીને બેડી બેઉ સર્દીયર નારી; ઓલ્યીવચન
કૈભાંડ કુમારી. ૧ સુખ બોગવો સ્થામાને સ્વામી, ચિત્રલેહા
કહે શીરનામી; બાઈ તું કરનેપી ઉનાંજતન, રાંકહાથે આવ્યું
રતન. ૨ વરકન્યા સુખે રહેને, બાઈ મુજને જવા હેને; અત્ર
બેનું આપેછે. રાય ત્રીજું માણસુસ્કેમ સમાય. તતમો નરનારી
કીડા કીજે, હાવે મુજને આજ્ઞા દીજે; બોલી ઓખા વળતી
વાણી, મારીસૈયરથઈ અજાણી. ૪ હવે સતી ઓખા વળતી
ભાખે, બાઈ કેમ જવુંજ પાખે; આપણું બેજણ દિન નિર-
ગમશું, અન્ન વેચીને જમીશું. ૫ હુઃખ થાશેતો દઈશું ચાવા
પુણું નહીદેઉ તુજને જવા; બેની હુંતો રહીશ જુખી, તુજને

નહીં થાવાહેઉ હુઃખી. ૬ હુંતો આપીશ મારો ભાગ, હમણાં
નથી જવાનો ભાગ; માથાપ વેરીછે માહારા, મેંતો ચરણુશે-
વ્યાછે તમારા. ૭ તુજ તાતધેર ન જવાય, જાણું બાણુસુરને
થાય; ચિત્રલેહા કહેસુણી વાણી મારી સૈયર થઈ અજાણુ. ૮
પ્રધાનપુત્રિકહેવાઉંછું માત્ર, હુંછું આદ્ધાણિનું ગાત્ર; તુજ અર્થ
લીધો અવતાર, મેળંથાં નારો ભરથાર. ૯ એમ કહી કરી
પ્રસન્ન, ચિત્રલેહા ગઈ અહ્સ સહન; ઓખાચે આંખડી ભરી,
કંચે આસનાવાસના કરી. ૧૦ સ્વામીઆશાબંધીનારી, પછી
ચિત્રલેહાને વિસારી; જે દહાડે તુજને સ્વર્પન, તે દહાડે મુજને
સ્વર્પન. ૧૧ જાણું પરણ્યો છું ઓખાનારી, ઉઘાડી મેલીતી
ભારી; એનેસરખીવિનોગીની પીડા, નરનારી કરે કામ કીડા.
૧૨ એની ચઢતી જોખન કાચા, પ્રિતબંધને બાંધીમાચા; નેહ
જણુંવેછે ઓખાનારી. રમે અનિરૂધ કુંજભિહારિ. ૧૩ જે
નેહયે તે ઉપર આવે, ભક્ષમોજન ફરેમનભાવે; પહોંચ્યો ઓખા
નોંધાનોંધ, પછી આંચ્યોઅસાડતેમાશ. ૧૪ આંચ્યો
વર્ષાકાળનાઠન, મેહ ગાજે વરસે બહુપરજન્ય; ઓલેઆકાશે
વિજણીકરી, ઓલે કોકીલાવાણી મધુરી. ૧૫ મહાતપસીનાં
મન ડોલે, ત્યાંતો મેર બપૈયા બોલે; તેમ મરહન કરેછે અંગે;
કેશરચંદન શરચે રંગે. ૧૬ આંખે અંજન આભરણ શાર, કરે
તંખોળ કેરા અહાર; તંખે નીદુવટ ચાંદદો તેવો, ચંદ્ર શરદ
પુનમના જેવો. ૧૭ શીશપુલ સેંચો સીંહર, તણે મોદ્યો
અનીરૂધ સુર; કાને આલઝમકતીજોણ, કામકંબર રહ્યોછેમોલી

૧૮નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનીરુદ્ધ નીહાળી માદ્યો માદ્યો ભરકુટીને જોડે મોરચો સુખનેમોડે. ૧૯ માદ્યો માદ્યો છુંટીલાવટે મોહીએ મોહીએ કેસ કલંકે; મોહીએ મોહીએ ધુઘરાનેધમકે, મોહીએ મોહીયોઅંજરને ઝમકે૨૦હીતુ મેડીએ સુંદર કામ, તેણેવિસાર્થુદવારીકાંગામ; ધણુંભક્ષલો જન કરે આપ તેણે વીસાર્થી મને આપ. ૨૧ પાભ્યો અધરા ખૃત પકવાન; તેણે વિસાર્થુહરીનું ધ્યાન; ઓાખાસુખ તેણે સા ગર, તેણે વિસાર્થી રતનસાગર. ૨૨ અનીરુદ્ધની ચાલેછે ગમતી નારી હીડે નરને નમતી; નારનારી સુખ ઓાચરતા, હીડે ઓા ખાની પુંઠળ ફરતા. ૨૩ ઘેના કીધો ભરજાહા મેદી, નવ સુને હીવસે કે રેણી; રાત દીન નીરગમે છે રતી, ચાર આંખે જરેછે અમી. ૨૪ સુધયુધ તોવીસરી તહી, એટલે ચોમાસુગયુવહી. વલણું-ચોમાસુ તો વહી ગયું, આંધો આસો માસરે; કન્યા ટળી નારી થઈ, ઓાખા પામી સુખ વિલાસરે.

કુંઠું ૫૩ સું.

રાગ મલાર-વર્ષાર્થી રતુ વહી ગઈરે, રમતારંગ વિલાસ; સુખ પાભ્યાંધણુંરે, એટલે આંધો આંધીન માસ. ૧ એક સમે સૈયર આવી, સરદપુનમની રાત; માણેકઠારીપુરાણીમારે, ઉત્તમ દીસે આસો માસ. ૨ ચંદ્રમાને કીર્ણેરે બેઠા હીડોળેનરનાર હાશવીનોદમાંરે, કરતાંવીધવીધ વીલાસ, ઉરક્ષકરાયનારે તેણે દીઠી રાજકુમાર; કન્યારૂપ કયાં ગયુંરે, ઓાખા દીસે હવેનાર પચીતલેહા કયાં ગઈરે, એકલી દીશે છે ઓાખાય; રાતી રાતી

આંખડીરે; પુલ પુલી હીશેછે કાય, પાહીરે ઉરદાંકતી, શકે થયાછે ન ખપાત; અધરખે શાંમતારે ડોઈક પુરુપહંતનો ધાત ક શેવક સંચયોર્ણે એવો હેખીને દેદાર; મંત્રિ કૌબાંડનેરે, જઈને કદ્યા સમાચાર. ૭ પ્રધાન પરવયોર્ણે, જ્યાંછેઅસુર કે-રેનાથ રાયજી સાંભળોરે, મંત્રિ કહેછે જોડીહાય. ૮ દોકીક વારતારે, કાંઈક આપણુનેલંછન; જ્યાંછે હીયેરે, કેમ કહીયે વજજર વચન. ૯ બાળકી તમતાણુરેતેતો થઈછે નારીરૂપ; વારતા સાંભળીરે, આસનથીદળીયોખુપ. ૧૦ દ્રજન ભાગી પડીરે એતોઅમથીઅકસ્માત; બાળુકોએચો ઘણુંરે, મંત્રિ સાંભળી શાચી વાત. ૧૧ સીવે કદ્યું; તે થયુંરેતારી ધ્વજ થશે પતન; તેવારે જાણુન્ઝેરે, રીપુ કેઈક થશે ઉત્પત્ત. ૧૨ જાઓ મંત્રી તમેરે, જુઓપુત્રિ કેરી ચેર; તેને કેઈજાણું નહીંરે, તેમતેડી લાવોધેરં તપ્રધાનપરવયોર્ણ, સાથે ડાદ્યા ડાદ્યાજન; ઓખાને માળીએરે, હેઠે રહિનેકહેછે વચન. કઉભાંડ. ૧૪ ઓચયોર્ણે ઓખાજીહીએનેદરશન; ચિત્રલેહા કયાં ગઈરે, ચાલો તેઢે છે રાજન. ૧૫ થરથર ધ્રજતીરે, પડીચેટડાચામાં ફાળ; શું થાશે નાથજીરે, આવી લોગી માજંબળ. ૧૬ તમે રખે બોલતારે નાથજી દેશોમાં દરશન; મુખ ઉડી ગયુંરે, ઓખા નીર ભરે ક્ષાયન. ૧૭ બાળાખહુંયાકુળિરેકાંઈકદળિકેડ વરણ; કશાણુ કર્સ્યા વીનારે, કંચુકી પેહેરી અવળે વરણ. ૧૮ બારીએંબા બાળકીરે, ઉલ્લી રહીને ત્યાં; આવો કોબાંડે કુંવરીનેરે ભયંકર વચન ઓલાવી. ૧૯ ચીત્રલેહા કયાં ગઈરે, તું એકલ્લી હીસે

ખાળ; કન્યારૂપ કયાંરે, ખીજશે બાણુસુર લુપાળ. ૨૦ શ-
રીર સંકોચતીરે, કરતી મુખડાકેરી લાજ; ધરમાં કોણુ છેરે
મુજને સાચુકહેનેઆજ. ૨૧ગળસ્થળકળકરધરીરે, કોઈ પુરૂષ
દંતનો ઘાત, શાણુગટ તાણુતીરે, બોલી ઓખાભાગીવાત. ૨૨
૧ દીક સાંઝ નથીરે; ચિત્રસેડાએ કીધું સયન; તેણું આકળીરે,
કુખણી નીરભર્યુ લોચન. ૨૩ મંત્રોઓચોર્યારે, ઓખાબોલી
આળપંપાળ; હેઠા ઉતરોરે, નહીતો ચડીને જોઈશું માળ. ૨૪
વલણુ-માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભારરે; એવુ
જાણીને ઉતરો, રાય ડોખ્યા છે અપારરે.

કંદું ૫૪ સુ:

રાગસામગ્રી-કન્યાએકોધજણુાવીએ, હાકોટચોપ્રધાન; લંપ
ટણોલંતોલાને નહી, ધડપણે ગઈ સાન. કન્યા૦ ૧ પાપીપ્રાણ
દેવા કયાંથીઆવીએ, બોલતો ક્ષુદ્રવચન; એ વાતસારુકીધી
લઈશે, જલનોડીછેદન. કન્યા. રહુતોડાહ્યો દાનવતુને જાણુતી
ભારેખમરેકઉભાંડ; એવું આળકોને ન ચડાવીએ, ભાગી પડેરે
અહાંડ. કન્યા૦ ૨ કહેવા હેને તું મારી માતાને, પછીતારી વાત;
હત્યા આપુ તુજને, કરું જંપાપાત. કન્યા૦ ૪ કઉભાંડ લાગ્યા
પછી કંપવા, પુત્રી પરમપવીત્ર, પછી કાલાવાલા માંડીયા, ન
જાણું સ્વીચરીત્રે. કન્યા૦ ૫ બાઈરાજએ મુજને મોકદ્યો, લોકે
પાડ્યો વીરોધ; ઓખા. પુછ્યામાટે, આવડો સો કરાધ. કન્યા.
૬ એવું કહેતાંસેવકમોકદ્યો; બાણુસુરનીપાસ; રાજએ મંત્રીને
કહાવીશું, જુએ ચઢીને અવાસ, કન્યા૦ ૭ કઉભાંડ હોપ કરીને

ગાળયો, વજડાંવ્યાં નીશાન; માળીએથી બંનેઉતરો, બાણું
સુરની આણુ. કન્યા૦૮ દાસને આપી આજા, સ્થંભ કરોને
છેઢન; ઓખાએઅંસુડાંદાળીયાં, ચંપાસે સ્ત્રામીન. કન્યા૦
૬હેકારોઅસુરનો સાંભળી, ઉભો થયો અનીરૂઢ; મેધનીયેરે
ગાળયો, કંપીનગરીયુધ. કન્યા૦૧૦ મંત્રીકહેસુભટ સાંભળો
કોઈનેધ્યાયોદ્યોયાંહી, આપણાનાહે ઉઠીયો. મેધ શાફ્ટથી
સહી. કન્યા ૧૧ ઓખાએનાથનેબાથમાં વાલીયો; શું જુવો
છો વહી; મરડી જાયો જુધને; હવડા જાઉ કહીં કન્યા૦૧૨
આ શું ઉધમ વઢવાતણો, નથીબાપનુંધામ; દાન તેને માનવ
છતેનહિ; નહેયરૂતુ સંઘ્રામ કન્યા ૧૩ નાથ કહે સુણું સુંદરી
વાતસધળોથઈ; હવે ચારી શાની આપણે, બેશીએ બારી જઈ.
કન્યા૦ ૧૪ વલણ—જઈ બેઠાં નરનારી બંને, વાત વીપ્રીત
કીધીરે; છજે ભજે કામ કુંવરી; ઓખા ઉછંગે લીધીરે.

કુદું પ્ર મુ.

રાગરામકળી-નોડી જોવાને જેઢુ મળીયા ટોલેજી, ઓખા
એસારી અનીરૂઢ ખોરેજી; કંઠમાં બાવલડી વાલી બાળાજી,
હેખીને કઉભાંડને લાળી જવાળાજી. ૧ દાળ-જવાળા પ્રગતી
જાગપ્રગતી; સુભટસહુ જોવા મહ્યા; મંત્રી કહે ભાઈસખળ
સાલે, જેમ હરી ઉછંગ કમળા. ૨ લદ્યું સ્વરૂપને લક્ષ્ણવંતો;
આવી સુતામુંગ બેઠો; જ્યાં પરશ નહી પંખીતણોતે; માળી
યામાં કેમ પેઠો. ૨નીશાંકથઈને છજેબેઠાં; નિર્બંજ નરનેનારી
હાસ્યવિનોદ કરે ઘણોને; લાંયા ન આણું મારી. ઉ ઓખાએ

અપરાધમાંડયો; ધાઈ ધાઈ લેછે સોઈ; પ્રધાન કહે એ પુરુષ
મોદા કારણુ હીસે કોઈ. ૪ અંધુજ વરણી આંખતડીને, બ્રહ્મકૃટી
રહી ખમખમી; રોમાવળી વાંકીવળી; વઠાં રહ્યો છેટમટમી
૫ માળ ઘેર્યો સુભટસર્વે, બોલેછે આનંદ; અહે વ્યભિચારી
ઉતરહેઠો; એમ કહે કઉલાંડ. કાચદ્વપ આયુશના ધાણી; જમ-
પુરીના માર્ગસત્ય; અસુર સરીઆ રીપુ માથે, કેમ થઈ એકો
સ્વસ્થ. ૭ બાળુરાયની હીકરી, તને ઈદરે ન થાય આળ; તે
રાજકુંવરીની સંગે; તું ચઢીને બેઠો માળ. ૮ સાચુ કહે જેમ
શીશરહે, કોણુ નાત કુળને ગામ; યથાર્થ તું ભાખજે, કેમ
સેંધું ઓખાનું ધામ. ૯ અનીર્ય વળતી બોલીઓ; સાંભળો
સુભટ માત્ર; ક્ષત્રિનંદન હું ઈચ્છાએ; આંગે બાળનો જમાત્ર
૧૦ મંત્રીકહેઅહ્યાબોદ્યવીચારી; ઉતરસે અલીમાન, જમાત્ર
કોનોબાળકો, કોનેહીધું કન્યાદાન. ૧૧ અપરાધ પુરણુ ઉત્તર
હેઠો, તનેબાળુરાયની આણુ; આદાનવતારા પ્રાણુ લેસે, મણું
આંધું જાણુ. ૧૨ વીચારજણુંધ્યાનો; જે પડ્યો વરાંશેચુક
સીંહહોયતો હાડે ઉડે, પણુ હીસેછે જાંધુક. ૧૩ એઉ જણું
બોઇને; પાછોચાદ્યોકોભાંડ કોભાંડનુંવાયક સાંભળી, બોદ્યા
ખળિરાજનો તન. ૧૪ સાંભળતામાંચાર લાખજોદ્રા, મોકદ્યા
તતકાળ; તે ઓખાએ હીડા આવતા; પડી ચેટમાં ફાળ. ૧૫
રાગપરજ-કામનીએ જ્યારે કટક દિદું ઓખા થઈ નીરાશ;
અરે હૈવ આ શું કીધું; મારા મનમાંહતીમોટીઆશ. ૧ વાલા

કેમ વઠસોરે વઠસો, મારા પાતળીયા ભરથાર.વાલા૦૨ એક
અરેપીણું તમે એકલા; કરમાં નથી ધનુશને બાણુ; ઓા પાપી
પીતાકોપીઓા; તે લેસે તમારા પ્રાણુ. વાલા૦૧ આછીપોળી
ધીએઝબોળી; માંહે આંભારસધોળી, તમેજમતાહું પીરસતી
ભરીકનક કચોરી.વાલા૦૨ આલેટે પાલેટે અવરનીપર રૂધન
કરેઅપાર, બોલાવી બોલે નહી, નઇણે વરસે આંસુની ધાર
વાલા૦૩ વળી બેઠો ઉડેને વળી, થાય વધન વીકાસણ વીર
તીર બાણુ જ્યારે છુટશે, સહેશો કેમકોમળશરીર.વાલા૦૪
મારા માતપીતાનેબાણુથયુનેકટક મોકદ્યું પ્રૈાદ. પાપીબાપે
કંઈ નવ જાણું, બાણુસુર મહા મુઢ. વાલા૦૫

કૃદ્ધં ૫૭ મું.

રાગ દાળ—ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક, અમો
એવું યુદ્ધ કરીએ, તે જાણું નગરના લોક.૧ તું જાણુ પેઉએ-
કલાને, હાથ નહી હથીયાર, તારા બાપે ચાર લાખમોકદ્યાતે
મારે મનછે ચાર.૨ તું જાણુ પેઉ એકલાને, કર નથી ધનુષ્ય
નેબાણુ, એક ગદાજ્યારે ઝરશે ત્યારે, લેઈશ સર્વના પ્રાણુ. તુ
ચીત્રલેહા ચતુરનારી, વીધાનીનોઅવતારીઓાખાએતે ધ્યાન
ધરીયું, આવી માળીયામોજાર, ૪એવું કહીનેજેયું સેજ્યામાં
ગદાતો નવ હીઠી, ચમકીને પુછ્યું ચીત્રલેહાને, અંગ લાગી
અંગીઠી.૪ ચીત્રલેહા કહે મહારાજ હુંતો ચતુરથઈ નવ ચુકી
મેં જાણું મુજનેમારશે, ગદા દ્વારીકામાંમુકી.૬અનીરૂધકહે
શાનેવહું; મારેહાથનથી હથીયાર, ચીત્રલેહાએનારદસંભાર્ય

માળીયા મોઝાર. ૧૨નારદ કહે મુજને કેમ સંભારો, કાલાંડ
કેરીતન, મહારાજ જુદ્ધેચઠેઅનીરૂઢ્ધ, હીજેઆશીર્વાદવગ્ન.
૧૨નારદેઆશીર્વાદ હીધો, શોભાજ્યવંતી ઓખાબાઈ; બલો
બલો પુત્રપ્રદ્યુમનનો, ચીરંજીવીઅનીરૂધખાઈ. ૮બલોતુંપુત્ર
પ્રદ્યુમનનો, વીરધણો વીકાળ; અંતરીક્ષ ઉલો હું જોઉં છું
આણું સરવનો કાળ. ૧૦ અદ્યા ધણીવારતો એશી રહ્યોને,
વાત તણું નહીં કામ ઐરામાંબાકરીયો બાંધી, તે બોહયુંખા-
પનું નામ. ૧૧ અનિરૂઢ્ધ કહે શાને વહું, હૃથીયાર નથી કાંઈ
એક; જોઢા જાજાશોર કરેછે ત્યાં શો કરવો વિવેક. ૧૨નારદ
કહેછે ઓખાબાઈને, તું આઘ જગતની માત; તારું સમરથ
હોય જેટલું, તેઆપ સ્વામીને હાથ. ૧૩ ઓખાયેએકબેં-
ગળ લઈને કહાડી આપી ધરમાંથી બાહ્યાર; સ્વામીનાકરમાં
આપી, તેમાં હજર મણુનો ભાર. ૧૪ વીર વિકાશી લોંગળ
લીધી, માળીયામાંથી ધાય; ચાર લાખ જોઢા તરવરીયાં તે,
સામો જુદ્ધે જાય. ૧૫ ગેડી ગુમ ઇરશી તુંબર, છુટે ઝાંઝાં
બાણ; માળીયાને ઢાંકી લીધું જેમ આભલીયામાંભાણ. ૧૬
આવતાંભાણ એકઠાં કરીને, પાંછાં નાંમે બાળ; ઉંચેથીઆવી
પડે તે; આણે સર્વનો કાળ. ૧૭ ભડક લઈને લોંગળ મારી,
અનીરૂઢ્ધે જેણી વાર; તે અણુકારા કરતી આવી, તેણે કર્યો
સંહાર ૧૮ અનીરૂઢ્ધ કેરો મારધણો તે, જોઢાથી ન ખમાય;
મારી કટક સર્વો કટક કીધું, આપે નાડા જાય. ૧૯ રહોરહો
શા માટે નાથો, કાં થાઓછો રંક, હુંતમારા કાજાઓછુ,

મારો ન કાઢોવાંક. ૨૦ અંગ ધર્યને કાંઈ નવ સુને, આંયા રાયની પાસ; બાણૂસુરથેશી રહ્યોનેકટક થયું સૌ નાશ ૨૧ જોધા સહુ નાશ થયા ને, ચોર નાડો સાર; તમને આંયો સંભળાવવા, ધણું કરી પોકાર. ૨૨ નાશરાજ લુંગળાવાવી, ગ્રાણ તાહારો જાચ; બાણૂસુર પડ્યો ગાલરો, હૈવ આતે શું કહેવાય. ૨૩થીજા રાએ છલાખ મોકદ્યા, જઈ કર્યો સંગ્રામ મારી બાંધી લાવો કહુંછું, એને તો આડામ. ૨૪ જોદ્રા આંયાનેરમાંતે, કરતા મારો માર; છલાખ આવી ઉભા રહ્યા, તેના બળ તણો નહીં પાર. ૨૫ કોઈ એકને બે જોજન, તીવ્યા જેકહેવાય; કોને માથે સીંગડાંને, લોચન ઉદર માંય. ૨૬ ખડગ આંડાંતુંખરફર, જોગી હાથે નાળ; તોપ કવચ રણભાલા ખરછી સુદુગરને ભીડી માળ. ૨૭ સાંગ જોડી ગુખ્તી ગદાને, અળકતી તરવાર; બાણૂસુરના ચોજાતે, કરતા મારોમાર. ૨૮ કાંઈક કચરવાળું થયાને; કંઈકના કડકાય; કુંભસ્થહાટી ગયા ને પડ્યા પૃથ્વી માંય. ૨૯ અનીર્ધે પછી વિચારી, ગદા પડી છે ધરણું; જોદ્રા આંયા નેરમાંતે, કેમ પામશે ભરણ. ૩૦ પછી પડતું સુકયુંપૃથ્વી ઉપર, ગદા લીધી હાથ; કાળચકરની પેરે સેને, સૈસા સંહાર્યા સાથ. ૩૧ કોઈ જોદ્રાને ઝીકી નાંખ્યા, આદ્યા વળતી હેશ; કોઈને અહ્યોથ સુકીને; કોઈને પગનીઠેસ. ૩૨ કોઈનાં મોદાં ભાગી નાંખ્યાં, હાથનીલપડાહે; કોઈને મારી લુકો કીધો, લુંગળને ભડકે. ૩૩ એમ હુંલડ કરયુને ગાસપ ડીઓ, હુંખરાણું અહુ થાય; છલાખ ચકચુર કરીને, ગયો મા-

ળિયામાંથ. ઉછ નાડાનોદ્રા વેગે ગયા, જ્યાંછે બાણુસુરરાય
નાશ રાજ ભુંગોળ આવી, પ્રાણુ તારે જાય. ઉપ નોહેનોહે
કોઈ નહાનો કુંવર, હીસેછે કોઈ અળિયો; ધણીવારનો જુદ્ધ
કરેછે, કોઈનો ન જાય કળિયો. ઉદ કોભાંડને તડાવી પુછબું
હવે શું કરવું કાજ; આટલે છોકરે નીચુંજોવરાંધું, ધીકધીક
મારુરાજ. ઉ૭

કંડું ૫૮ મું:

રાગ બિભાસ—મતબાલો મહાલે માળમાં, જઈ નોદ્રાએ
સભામાં સંભળાંધું, કોભાંડને રહડીયો કાળ, મતબાલો મ-
હાલે માળમાં. ૧ જુગ જીત્યું પણ કાંઈનવદીઠું, સવરગ જીત્યું
પાતાળમાં; કહો કોભાંડ હવે શું કરવું, મારે બાળ્યો ભારખુ
પાળમાં. મતબાલો. ૨ સહુસેન્યાનું સાંચથ ભાગયું, બહુ બળ
દીઠુંછે બાળમાંરે; દશ લાખનો દાટજ વાહિયો, હજુછેવઢવા
ની ચામલાંરે. મતબાલો. ઉકહોપ્રધાન હવે શી વલે થાશે,
બાણુ પડયો જંબળમાંરે; રાતમાં જઈનેરોકીરાખો, નાસે પ્રા-
ત: કાળમાંરે મતબાલો. ૪ વિઝીયારે વરગ્યો તે નહીં થાય
અરગો, જેમ માઝી મધ્ય જારમારે; ભારક બકરીનેશાનેઓ-
સરો, તેમ જેવા સીંહની ઝારમાં મતબાલો. ૫ એ બારકને
જે બાંલીલાવે, તેને વધાવું રતન ભરી થારમાંરે; સીંહપણું
વેરાઈ ગયું ને થયું સંગ્રામ શીયારમાંરે. મતબાલો. ૬

કંડું ૫૯ મું:

રાગ સોરઠ—કોભાંડ કહેતુ સાંભર રાજ, કહું એક સાચો

મર્મ; એ લુંગળે દશલાખ મારયા, તેણે નરહથો તારો ધર્મ.
 ૧ અચરજ એક લાગે સુજને, પડી અસંગે વાત; એક લોં-
 ગરે દશલાખ માર્યા કીધ્યા મહા ઉતપાત. ૨ પુરવે મેં તને
 પીછીંયો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકાગઈ, રણરો-
 રાયો દશસ્કંધ ઉઅહંકાર ચંદ્ર માયે કરવો, તને રોહીણીશું
 સાંજે; છવીશ નારી પરહરી, મારે લોગવે અહરોગ. ૪ એ-
 વાં અહંકારહું અનેક અનેક કહું, સાંભરને લુપાળ; વાંકડોઈનો
 કહાડીયે નહીં, પાણ પુટયું તારું કપાર. પચાર. પચાર તુજખાપે
 કર્યો જેણે જીત્યા દશ હીગધાર; વામનરૂપવીઠિંદે કરીને, ખ-
 રી ચાંઘ્યો પાતાર. ૬ અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વન
 કીનેરાય; ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મન માંથ.
 ઉપેહુલી ધજા ભાગી પડી, વરસ્યો રધીરનો. વરસાદ નક્ષત્ર
 તુટીને પડયું ને થવા માંડ્યો ઉતપાત. ૮ હવે તત્થર થઈને
 શેન્યા સાંભારો, બેઠાનું નહિ કામ; દશદીશાતું જીતીને આ-
 યો, છોકરેઓહયું તારું નામ. દરાય પેહેલો મેંતુને પ્રિછિયો,
 પ્રતાપ તારો પ્રતક્ષણ; આ સરોએ વીલોકત્વમાં, ઉદ્ય પામો
 અસ્ત. ૧૦ સર્વ મૃત્યુપાતારમાં, કહેવાયોતું એક; તરણાવેત
 તુજને કર્યો; એ છોકરરે છેક. ૧૧ વચન એવું સાંભળીને,
 રાયની ગઈ છે સુદ્ધને સાન; સથુળ અંગહેખી રાજનું; પછી
 બાલીઓ પ્રધાન. ૧૨ કૌભાંડકહે તું સાંભળ રાજ પ્રાકમત
 હારું પ્રચંડ; શશા ઉપરસીંહ અખંડછે; તેમ પૃથ્વી કરુંશ-
 તખંડ. ૧૩ કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ;

શાણુિતપુરના સુભટ કેરા; અનહયાણ શામ. ૧૪ રીથાત
થયો વચન સાંભળી, આખ્યાં સહુ શાણુગાર; તું મારો વડો
ખાંધવ,આ તારો સર્વ લંડાર. ૧૫ જાઓવીર તમો વેગેજ
ઇને,કરી આવો શુભ કાજ; વધામણુવહેલીમોકલજે, પેદા
> શતરૂનો ફેડી ઠામ ૧૬વચન પીશા ચઢાવીને ઉઠયો, તેણુંદીધો
સ્ના શાણુગાર; સેન્યા સઘળી સજ કરી, તેની શોભાને નહીં
પાર. ૧૭ માહા મોટા ગજ ગીરીવર સરખાં, મદગળીત કહે
વાય; હીરા માણુક રત્ન જડીત અંબાડી, તેની જયોતે રવી
દંકાય. ૧૮ સુર્યવંશીને સોમવંશી, પાખરીયા કેકાંણ; મોરડે
મોતી જડીન તને; હીરા જડીત પવાણ. ૧૯અનેક અશ્વ હો-
રીયા આગળ, ગણું ન આવે પાર; અનેક પાંખખીરથ ઊ-
ટાસને, તેણુંસુભટથાયઅશ્વાર. ૨૦સીંહલદીપનાહસ્તીમોટા,
તને જડયાં માણુકઅપાર; મેધાડમર છત્ર ધારીને, તેણું મંત્રી
થયો અશ્વાર. ૨૧ નગારાંનીતો ધોંશ વાને, શરણીઓનાતુર;
સેન્યા સઘળી પરવરી, જાણુસાગરઅંધું પુર. ૨૨નાળગોળા
કવચ ભાથા, કરતા મારો માર; માળીયા આગળ ડિભાએટલે,
ઓખા કરેવિચાર. ૨૩સ્વામી તમારા મનમાં આવે તો, કહું
વિનતી આજ; ચિત્રવેહા દ્વારીકાં લેઈ જથ તો, સીને સઘળું
કાજ. ૨૪ વચન સુણુને જવાળા લાગી, ચઢી અનિરૂધનેરીસ
ચરણું કેરી આંગળીથી, જવાળા લાગી શીપ. ૨૫ યુદ્ધ વિષે
સનમુખ રહુ તો; ન લાને મારો વંશ; બાણુસુરને એણુંપેરે
મારું; જેમ હૃષ્ણુ માર્યો કંશ. ૨૬ એવા માંહે જોદ્રા આંધા;

હેવા લાગ્યા ગાળ; કરોધ રહુડો બહુકામ હુંવરને, કીધીઈ-
ચછા હેવા ફાળ. ૨૭વલણુ—ફાળ દેઈ અંત લેજિ, હો તારોતવ
કીધોરે; ઓખાએ અનિહૃદમાળીચામાં, ઉચકોદંડવતકીધોરે
કડબું ૬૦ મું.

રાગ લુપાળ. ઓખા કહે કંથને એમ નકિને; ખળી ઓશું
વદતાં બીજે, એ ધણુને તમોએક જાતે; સૈન્ય મોકદ્યું મારા
તાતે, હૈત્યનેવાહનતમો પાળા, એ કઠણું તમે સુંવાળા એને
તોપેકવચનેખકતર, તમારેચાંગે પીતાંખર હૈત્યને સાંગ્યનેખહું
ભાલા, પ્રલું તમોઓડાલામાલા; આતો મસ્તકખહું ખળીયા,
તમો સહેમળપાતળીયા. પેહેલું મસ્તકમાણાંછેહો સ્વામી
પછી અસુરને બેહો; તમારીહેહેખેખીને હુંતો મોહું, નેતરે જુદુ
કરતાંકેમન્નેઉવા, સુવાહૈત્ય કરહેડાકારા, પ્રલું પ્રાણું પેછેમારા;
ઇચ્છા અંતરમાપેઠી હૈત્યેમાળિયુંલીધું લુંટીધણો. કરોધીવિ-
રોધીછેખાળું, હાંકે ઇન્દ્રનું જાએ આશન; જન સ્થંભે તાતની
હાકે. બાળ સેન્ય ચદાવી છે ચાકે જેતે નામેતેમેરું હાકે, ચક
ધારીસરખે નવ ચાલે; ક્ષત્રીસાથરહેછેખીતો, તમોકેઈ પેરેએને
જાતો. મંત્રી રથોછેહંતજ કરડી, શું ધાયોછો મરડી મરડી.
કંથ કહેનકરું સંચામ, નાશી પોડાનો કિયો ઠામ. હનેજીન
તા છુંટવું નહીં. સહન્યમારીએસામાથઈ. નથી ઉગારવાનોડી-
પાય; ત્યારે ભય પામે શું થાય. નાઠેલાંછન કુળમાંછે શામને
લાંછન મુળમાં. વહુવરવા જે મણીધર ન ડેલેતોઅળશીયા
તોસે ઘનગાનેકેસરીહોફાળ. નાઉછળોતોજાણુચોશીયાણ, ક્ષત્રી

શાંઠેદેખીનેટણ, નશાંઠેતો જાણુવો વિંટળ. હાકેવાધનમાંડકાન
તો જાણુવો નિશ્ચેસ્વાન; ઘરમાં જેધાકોરહે ચેરી, તો ચરાણ
લીનાનો રહે એશી. એમ કહીને ઓાખા અળગી કીધી, ભડ
ગાજ્યોને ભોગળ લીધી; અસુર સેન્યામાં જઈને અડીયો
છજેથી કપીની પેઠે પડીયો, જે મચંદ્ર પેશે વાઢળમાં, તેમ
અનિરૂધ પેડો ઢળમાં; વાઢળ ચંદ્રને લે જેમ વીંટી તેમ અ-
નિરૂધને લીધો વિટી. અસુરકહેએમાનવી કશું, બધું સીંહમાં
બગલું તશું; જે મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી
ઉગરે તેનાંએવાં વાયક સાંભળી, અનિરૂધ ધાયોહોકારોકરી;
નાંખે હૈત્ય ખાંડાં મુદ્ગલ, તેમ વિષણુ નાંખે ભોગળ. વીસ
સહસ્ર અસુર સઉતુટ્યા, એકીવારે બહુસર છુડ્યાં; આયુધ
ધારા રહીછે વરશી, છુટે પરીધ આયુધરે ફરસી. થાયહાનવ
ટાળેટોળાં વરસે ભીડીમાળનેગોળી; એલે હુંદલીના ગહેગ-
ડાટ, થાયખાંડાતણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે ચુચ્ચવાટ
રથ ચક્ક વાજે ગડગડાટ; હોય હુયના ધણ્ણા હણુહણુટ, હેખી
હોહલી નાથનો ધાટ. થાય ઓાખાને ઉચાટ; હેખે હેહલો નરો
ધાટ; પછી દાનવનો વાધ્યોધાટ, અનિરૂધે સુકાવી વાટ. કોઈ
જીકયા જાલી કેશે, કોઈ ને ઉડાડ્યા પગની ડેસે, કોઈ હણ્યા
ભોગળનેભડાકે, કોઈનાંમેંભાગ્યાંલ પડાકેકોઈ નેભાલાવાગ્યા
ભય કોનાંનાકવાદ્યાં ટચ; કોઈઅધુક્યરા કોઈ પુરા, સારી
સેન્ય કર્યું ચકચુરા. તેરણુમાં ભયાનક ભાશે, ખળ હેખીઓ-
ખા ઉલાશે; મેંતોઆવડું નોહોતું જાણું, ચિનદેહાયે રતનજ

આણું. થાય પરશેવો અનિર્દ્ધને દીકે; પોતાના વલભાંએ
ખા જીકે; બડ ગાજુંને પડયું ભંગાણ, નાઠો કૈબાંડ લેઈને
પ્રાણ. થઈ બાળુસુરને જાણ, એક પુરુષે વાહ્યોબાણ; અસુરને
ચઠ્યો બહુ કોપ, સજ્યાંકવચ આયુધને તોપ. વાગી હાકને
ચઠ્યો બાણ; તે તો થઈ એખાને જાણ.

કૃષ્ણ ૧૧ મુઃ

વલણ—જાણ થયું જેતાતચઢીએ, કોણ જીતસે સહસ્ર હા
થરે; ઓખા આંખ ભરતીર્દ્ધન કરતી, પછીસાદકરતી નાથરે.
રાગ સામથ્રી-મારા સ્વામીહો ચતુરસુજાણ, બાણુદળ આ-
ંધુરે જાદવજી; દીશે શૈન્યાચારેપાસે. હવેશું થાશેરે જાદવજી.
એતો બળિયાસાથેબાથ. નાથ કેમ લીડારે જાદવજી; સામો
દૃત્યછે કપાત્ર; માટે હરીને હીંડારે જાદવજી. ઓછા આંધું
બળવંત; હીસેરીસે રાતરે જાદવજી; એકલડા અસુરને મુખે;
રખે તમે જાતારે જાદવજી. ઓ ગજ આવે બળવંત; હંતકેમ
શેહશોારે જાદવજી; અસુરઅરણુવધાય; તમોનાજસોરેજાદ-
વજી. એવુંજાણીને ઓસરીએ; ન કરીએ કોધરે જાદવજી; એ
કલડાનો આશરો શનોમાનો પ્રતિષેધરે જાદવજીધીરાથા-
એને ધાયો; વદોતે ઝાંસુરે જાદવજી; મહારી ઝર્દેછે જમણી
આંખ; વરસેછેઅંસુરે જાદવજી; મુને દિવસ લાગેછે ઝાંખો
લોંગળહેથીનાંખેરે જાદવજી; હું તમને સમજાવું આવાર; વ-
ચન મારું રાખોરે જાદવજી. તમોમુજદેહલડીના હંસ; મુહેને
જુદ્ધરે જાદવજી; પાછા વળોળ લાગુ પાય; માનો માયુધરે

નદવજી. ઘેલી દીશેછે ઘડણી, તારણી આશી ટેવરે રાણીજી; અમે ભાણુ થકી ઓસરશું, તો કરશું સેવરે રાણીજી આંથે। ભાણુસુર ભુપાળ, તેને હું માર્યે રાણીજી; એનાછેદુ હાથહંજર, દણ સંહારે રાણીજી, અનિરૂઢુ રણુથકી ઓસરેતો, લાને શ્રી ગોપાળરે રાણીજી; હવે અંત આપણો આંથો, હવે નાઠે આસરે રાણીજી. વલાણુ-નાડેઆવેચાળ, નવકીજીયેઉપવાદરે; કહેપ્રેમાનં દયેઓખાબાઇએ, અનિરૂઢુને કર્યોસાદરે

કરું દર સું:

રાગ વેરાડી-ઓખા કરતી કંથને સાહૃરે, હો હડીલારાણુા; એ શા સારુ ઉન્માદ, હો હડીલા રાણુા. ૧ હુંતો લાગુંતમારે પાથ, હો હડીલા રાણુા; નાવીષેસો માળીયા માંન, હો હડીલા રાણુા. ૨ હુંતો ભાણુને કરું પ્રમાણુ, હો હડીલારાણુા; છેકા લાવાલાનું કામ, હો હડીલારાણુા. ૩ એતો બળીયાસાચે ખાથ હો હડીલા રાણુા; તેતો જોઈને ભરીયે નાથ, હો હડીલા રાણુા. ૪ એતો તરવુંછે સાગર નીર, હો હડીલા રાણુા; બળો ન પામીએ ચેલી તીર, હો હડીલા રાણુા. ૫ એતો લેદે તમારુંગાત્ર હો હડીલા રાણુા; સામા હૈત્ય છે કુપાત્ર, હો હડીલા રાણુા. ૬ મને થાયછે માન શુકન, હો હડીલા રાણુા, મારુ ઝરુંકેછે જભણું લોચન, હો હડીલા રાણુા. ૭ મારો મોતીનો તુટથોડાર, હો હડીલા રાણુા; ડાયે નેત્ર વહે જળધાર હો હડીલા રાણુા. ૮ હીસે ગગને ઝાંખો ભાણુ, હો હડીલા રાણુા; હીસે નગરીતે ઉજડ રાન, હો હડીલા રાણુા. ૯ દૂવે વાયસ ગાયને સ્વાન હો,

હડીલા રાણૂ; એવા માડા થાય શુકન, હો હડીલા રાણૂ. ૧૦
 હુંતો દૃજતીહેખી ધરણ, હો હડીલારાણૂ, એતો સાગરે ઓએ
 હુંત વરણ, હો હડીલા રાણૂ. ૧૧ આવ્યાઅગણુંત અસ્વાર
 હો હડીલા રાણૂ; માંહે માંહે થાય છે હોહોકાર, હો હડીલા
 રાણૂ. ૧૨ ઓ હુંભી વાહ્યો ધાય, હો હડીલા રાણૂ; એતો
 સેન્યા તમપર ધાય, હો હડીલા રાણૂ. ૧૩ ઓ આવ્યુંદળવા
 દળ, હો હડીલા રાણૂ; એા ઝળકે ભાલાનાં ફળ, હો હડીલા
 રાણૂ. ૧૪ પાખરખકતરપેચાઈ ટોપ, હો હડીલા રાણૂ; દૈત્ય
 ભરાયા આવે ડોપ, હો હડીલા રાણૂ. ૧૫ એવાને વુધરમાળ
 હો હડીલા રાણૂ; અખહેતા આવે ફાળ, હો હડીલારાણૂ. ૧૬
 એતો સુરવીર મહાકાળ, હો હડીલા રાણૂ; હવે થાશે ડોણુ
 હવાલ, હો હડીલારાણૂ, ૧૭ નાથ જુવો વિચારી ગગન, હો
 હડીલા રાણૂ; જુદ્ધ રે'વાહો રોજન, હો હડીલારાણૂ. ૧૮ ને
 લોઘો મારી વાણ, હોહડીલારાણૂ; તમને માતપીતાની આણ
 હો હડીલા રાણૂ. ૧૯ આઠો ભાણ તે પ્રલ્લેકાળ, હો હ૦
 રાણૂ; મેઘા ડંમરછત્ર વિશાળ, હો હ૦ રાણૂ.

વલણુ-મેઘા ડંમરછત્ર બિરાને, ઉલટી નગરી યુધરે; અગ
 ણુંત અસ્વાર આવીયા, તેણું વીઠી લીધો અનિરૂધરે.

૧૫૬૧-૧૩ મું.

રાગ સિંહુ—આવી સેન્યાઅસુરની, અ.નીરુધ લીધો ધેરી
 કામકુંવરને મધ્યે લાવી વીઠી વહ્યા ચોકેરી. અમર કહે શું
 નીપજશે, દર્શા પરમેશ્વરી; રીપુ ગજના, જુદ્ધ માંહે, અની

હૃદ લઘુ ડેસરી. બાળુરાયને શું કરું, જો ભોંગળ ધરી ફ્રેંગટ; વેરી વાયસ હોટા મજૂયા, હવે ડેમ જીવશે ચોપટ. બાળુસુરે સુભટ વાર્યા, નવ કરશો હો ધાત; વીટા ચોદશ સહુમળીને કું પુછું એનેવાત. માળીચેથી ઓાખાખાઈએ, રૂદન સુકયુંછોડી; પીતા પાસે જોઢું સર્વે, હાથ રહ્યાતે જોડી. બળવંતહીસે અતી ધાણું, સેન્ય બીહામળી, પવન વેગે પાખરીયાતે રહ્યારે હણુહણી. આદળવાદળકેમશેહેસો, ઓસ્વામી સહોમળ; અરે દૈવ હવે શું થાશો, પ્રગટ કામનાંફ્રા. હૈવના કીધા હૈસ સુવા, તને દ્યા નહી લવલેશ; કાચીવયમાં નાથજીને નથી આવ્યા સુછને કેશ ચાર હીવસનું ચાંદરણું, કર ચઠી ગણું વહી; આ જોઢ્હા પીઉને મારસે, દઈવડાજીવુંન દીં. અરમક્તામારેએકદો તને વિટી વહ્યાઅસુર, એવું જાળીને સાહાય કરનો, ઓસા-મળીયા સુર કષ નીવારણુકશ્રા, હુથઈતમારી વહુ, જો આંચ આવસે તમ પુત્રને, તો લાજસે જાહવ સહુપ્રજનાંપતીપાળ છો, તમે પનોતામેરારી; સંભાળસર્વનીલીજીએ, નવમુકીએ વિસારી, અમને તો પણ આશાતમારી, અમે તમારાંછોડ; લાજ લાગસેવધને, કાંઈકહસેકાળુંગોડ. પક્ષાપલાણપ્રલુલ, પુત્રીની કરવા પક્ષ; ભગવાનને ભજતી ભામની, ભરથાર છે રીપુ મધ્યમુખ વક નેત્ર બીહામળાં. મુખ મુછો મોટીમોટી તેવા અસુર આવી મજૂયા, એક શાખને સપ્ત ડોટીદળ વાદળ શેન્ય ઉલટી, મધ્યે આણુચોઅનીર્દ્ધ; વીરવાટચોવેરીએ, જેમ મક્ષીકાએ મધ્યધનુષ્ય ચઢાંયાંપાચશે બાળુ, બહુચઢા-

ન્યાંબાળુ; ગાએ ગુણીજન ગદગદે, અહુ ગડગડે નીશાન, અં-
તર અરભક એમ વીંટીચો, તેમ શાલેછે ઈદુ લઘુજેમ ઉંલટ
ઘણીને લલાટે સ્વેત ઓંદુ લઘુ કુંજરની સુંદ સરખા, શાલે
છે એ ઝુજ; સરાન સરખી અગુરી, નેત્રાએ અંધુજ. તરણ માત્ર
જે વઠતો નથી, બાળનો જે બાહુ; અનીધ અસુર એવા
શાલે, જેમ ચંદ્રમાને રાહુ. ચચિ જોયું વક્ફરશ્ટે, મુછોમેટી
ચક્ષુ, વપુ શોભાવે ઝુજ અવાને, કેશ રૂપનુંછે પ્રક્ષ. આસમે
કહોવાડાને, અથવાભાંગળનેધાર; અરોટળું રોપુસંસારનો
ઉતારાંનો ભાર. શાંવપુભાળનું ભાલવછે; માહેસર્ફનોસાથ;
કે પેટમાં પુર્વજ વસેછે, પીંડ લેવા કાઢેછે હાથ; કાઠ નાકે
નાખવા. એણે ઘડીને ચોટ્યા; કરઅથવા કોઈ પંખી હીષેછે
એણે વખેર્યા છેપર ત્યારે હસતું આંદું બાળને, એશુંયોદે
છે બાળકૈભાંડ કહે સાંભળો, એ તમને હેછે ગાગ બળીસુત
અંતર બળયોને લોકમાંતે બળવાન; થું કરજ લાંછન લાગે
નાકર વીધીએહેઉ જૈઉ કન્યાદાન; સુભટનીકરાય આંદોયા, યો
લીચો અહુ ગરવે; નફુટ લપુટ નથી લાજતો. વીટયો હણવા
સર્વે; કુળ લજામણો કોણ છે, તસ્કરની પેડે નીરલજ; અપ
રાધ આગળથી કેમ ઉગરે, જેમ સિહ આગળથીઅજઅં-
ગથી આવી ચડયો કાંઈ કારણું સરખું ભાષે; સાચુ કહેલેમ
શીશ રહે તુજ; બાળક વિશ્વાષે; કોણ કુગમાં અવતર્યો,
કોણ માત તાતનું નામ, અનિરૂધ્ય કહે વિવા હવે, હવે પુ-
છયાનું થું કામ, પિતરપીતા મહાપ્રસીધ્યછેનોદ્વારીકાંસં

સાર; છોડી છતપતીનીવર્યો; હવે ચતુર મન વિચાર, વૈષણવ
કુળમાં અવતર્યો મારું નામ તે અનીરુદ્ધ; જે છોડશો તો ન
ગરી બધી નાંભીશ સાગર મધ્ય બાણુસુર સામુ જોઈને,
કઉભાંડ વગતું ભાખે, ચોરી કરી કન્યા વર્યોટિ, કોણ વેશ્વવ
પાખે. પુત્ર જશી હૃષ્ણુનો, પછી બાણુ થસેઠે કર; નીચ વરે
કન્યા વરી, દાનવ મારું બેદુંઘર રીસે ડોક ધુણાવીને ધનુષ્ય
કરમાં લીધું; બાણુસુરે યુધ કરવાને, દળમાં હુદંલી દીધું.
કૃષ્ણ ૪૬ સુઃ.

રાગ ગોડી-અસ્વરુંઘર રથ ભાથાભરી, આંયો બાણુસુર
વેગે કરી; જોદ્રાને નવ માચે સુર, ચઢીઆંયું જેમ સાગર-
પુર. જીવાજે પંચશાખાં રણતુર, મારી જોધા કર્યા ચકુચુર; બા-
ણુસુરનાં છુટે બાણુ છાઈ લીધોઅભલીયામાં ભાંણુ રથયું
કટક દળ લેળાલેળ; જેમ કાચે હોવાડે કેળ; આંયો એટલા
ધરણી દ્વારા, તેમાં હોઈ પાછા નવ વહ્યા. ત આવી ગઢાતે
વાગી શીશ, નાડો હસ્તી પાડીને ચીસ; બાણુસુર ઉપર બોં-
ગળ પડી, ભાગ્યો રથ પડ્યો. કડકડી. જરાયની ગઈ છે સુધને
સાન, ભાગ્યું કુદાગ છેધા કાન; પાંછા લેઈચાલ્યો પ્રધાન; ધેર
જતામાંઆવીસાન. પપછીયોદેછેરાજનસાંભળોમારા પ્રધા
ન હાયહમણુંલોંગળાવસે, બાણુંછુંજેજુવડો જસેદું પ્રધાન
કહે કાં થયા અજાણુ, કચ્ચાં ગર્યું મહાદેવનું બાણુ; મેદ્રા તો
થાંચે કદ્વયાણુ; આઝુણીએબંધાસે પ્રાણુ. ઉતે લેઈ બાણુસુર
પાછો ફર્યો, તેઉપર માળીએસંચર્યો; અનીરુદ્ધેવીચારીવાત

હવે હું એ જોડું હાય. ૮ શીવનું વ્રતતે સાચું કરું, વચ્ચન એ-
નું ભર્સતક ધરું; અનીર્ધે એ જોડયા પ્રાણું; બાણુસુરે મેલ્દું
બાણું. ૯ આજણીએ બંધાઈ પડયો; ઉપરથી પર્વત ગડગડયો;
લાતો ગડદા પાટુપડે, તે હેખીનેઓખા રડે. ૧૦ ત્યાંથી મનમાં
વિચારજ કર્યો, અનીર્ધને લેઈ સંચર્યો, મારતાં કુંવરને લેઈ
નાય, ઓખા રૂવે માળિયા માંય.

.૫૫૩.૬૫ સુઃ.

રાગ રામકળી—મધુરેને સાહેરે રેરેહોા, ઓખારૂચે માળિ-
યેરે બાઈ માહારા ચેઉનેલ્દઈઅય, સખીમાહારી વતીતોનવ
અમાય; હમણું કોઈ કહેશરે રેરેહોા, પીઉલુને મારીયારે. ૧
બાઈ મારાં પેલાતે ભવનાંપાપ, બાઈ મારેચાવડાશાસંતાપ
સે નથી ભરતો પાપી બાપ, માથેથી ઉત્તરતીરે રેરેહોા, પડજો
સગો બાપનેરે. ૨ હંંરે મારા કંથની કોમળ કાય. એવાયેવા
મારતે કેમ અમાય; ઓ પેલા દુષ્ટને ના મળો દ્વાયા, રંડાપણ
આંધુંરે રેરેહોા; બાળપણું વેશમાંરે ચાલ—ચિત્રલેહા કહે
બાઈ શાને રડેછે, તારા કંથની નહી ચાય હાણું; જઈને હું સ
મજલુંછું જે, તારા પીતાના પ્રાણું. ૧ ચિત્રલેહા આવી ઉભી
રહી, જ્યાં ચાતાનો તાત; સાંભળો પીતાવીનતી; કહેસો સ-
મજલી નહી વાત. ૨ એછે મોટાનો છોકરો તે, તમે જોઈને
છેદજે શીપ; માચા ઉપર શત્રુ ચાશે, હળદરને જુગઢીશ. ૩
એને વડઉચે બળી પાતાળો ચાંઘ્યો, એવાંછે એનાંકામ વગર
વીચારે મારશો તો, ઝોશો ધરને ગામ. ૪ પ્રધાને જઈને કહું

જ્યાં છેખાણુસુર ભુપાળ; રાજ રખે એને મારતા, એછેમો-
દાનેા બાળ. ૫ પરણીકન્યાકોઈ પરણું નહીં, માથેરહેશેઆળ;
લોકમાં કહેશે જમાઈમાર્યો, એવી હેસેગાળ, માટેધાલોકારા
અહુમાં હાથે ન કીજુએ ઘાત, એકલે દરશ લાખ માર્યો તે,
માટી કીધી વાત. ૭ પછી વજન કેરીકોટડીમા, એસાર્યોએ
તન; સરપે એનેવીટીયારે, કચોઈ ફરતો અગન. ૭ તે પુંદેજ-
ણની ખાઈયો ખાદી, મેદ્યા બહુ રખવાળ; સર્પ કેરા જેણ્ઠી,
પરજળવા લાગ્યો બાળ. ૮ અનીરુદ્ધને બંધન કરીને, વીટીયા
બહુ સર્પ; કામ કુંવરને બાંધીઓ, પછી ગાજુઓતેનૃપ. ૧૦
વલણું—નૃપ ગાજ્યો મેધની પેર; ઉત્તરાવી ઓાખાયરે; અની
ઇંધતે બંધન કરી ખાણુસુર મંદીરમાં લઈ જાયરે. ૧૧

કુંડં ૧૧ સું:

રાગ રામશ્રી—બાળું બન્યોને બાંધીયાં, નૈતમ નરનેનાર;
અનીરુદ્ધ રાજ્યો મુખ આગળ; ગુપ્ત રાખી કુમાર. બારણું
બન્યોને બાંધીયાં. ૧ ચૈટામાંચારજળણાવીએા; દાકયો ન્યલ્લી-
ચાર ઓાખા છાનીમંહીરમોકલી; રાજ્યો કુગનેાતે ભારભા-
ણુરલક્ષ્યાવંતોહીંડેલેહેકતો; એહેકતોતે અવાસ; હૈત્યનું દળતે
પુંડું પણો, ઘેરી હીંડેછેદાસ. બાળું. ૦ ઉએકપેચછુટએાપાચડી
તણું. તે આંદ્રો પાધ પ્રમાણ; ચોરતે ભોરજ મારીએા, તેનાં
કરેલોક વખાણ. બાળું. ૪ ઓાખા ફરીને વરણોપરણષે, તો
ભુલષે ભવ ભરથાર; તે સ્વામી શું સુખ પામષે લીધું એણું
અમૃત સાર. બાળું. ૦ પકોકહો એમાં હૈવત હીષેખરું ઇપવંતો

રસાળ; કટાક્ષમાં કામની મોઢી પડે એવી ભાયા મોહજળ
બાણે. ઇતેની લુલવણીભરકુટી તણી, લુલીપડેતેનાર; કુંવારી
કન્યાને કામણુ કરે, સંતાડોસર્વ કુમાર. બાણે. ઉસખી પ્રત્યે
સખી ઓચરી, હેખી અંગ ઉવેઠ; બાંધ્યો જુવે છે આપણ્ણા
ભણી, એને છે એવી ટેવ બાણે. ઈચ્ચારમાસ આશાઘેઠી
ઘણી, લાગ્યો સ્નેહ વિવાદ; માળીએ સુખ પાખ્યોધણુ, પછી
લાગ્યો લોક અપવાદ. બાણે. ઈવલણુ-લાગ્યો લોક ઉપવાદ
પણુ, પાખ્યો હેવકન્યારે, પછી બાણુસુરે અનીરૂધને રાજ્યો
ઓખાના ઘરમાંથરે.

કૃતું ૬૭ સું.

રાગ ધવળ ધનાશ્રો-શુક્રહેવ કહેછે પરિક્ષતને, તમેસાંભળો
કરું જોકેરાયજ્ઞ; કુષળુંવરને બાંધીરાઓરાએ, ઓખાનાધર
માંયજ્ઞ. ૧નાનાવિધિનાં બંધન કીધાં, કાહાડી નશકે સ્વાસ-
જ્ઞ; એક એકનાં સુખ હેખી દામણું, હેખી થાય ઉદાશજ્ઞ. ૨
બાણુમતી બાણુસુરની રાણીજળભરેછેયક્ષજ્ઞ; પુત્રીજમા
ઇને લુખ્યાં જાણી, છાતુંમોકલે ભક્ષજ્ઞ. ૩ કસ્ટદેખી નાથનુ
ઓખા નૈણુભરેછેનીરજ્ઞ અનીરૂધઆપબળોકરીને, ઓખાને
દેછે ધીરજ્ઞ. ૪ આઈર તો અસુર કુળને, તેવઙુ તરણ માત્રજ્ઞ;
સેબા રાખવાસ્વસુરનીને, હું બંધાયોધુંગાત્રજ્ઞ. ૫ આગમાં
ઉકું તો રીધ છુદું, દણુદાનવજુથજ્ઞ; હું કરું જોસ્વસુરપક્ષમાં
રાખવુંતેસુશજ્ઞ ઈ આકાશ અવની એક થાશે; એવો નિ-
પજસે ધંધજ્ઞ; અગનીકેતીજવાળખુંમભમાયસુરથાસેઅંધજ્ઞ

જસહાય ચાશે શામરામ અખળા, સધ છુટશે બંધજી; કૃષ્ણ
આવી બાળુસુરનાં, છેદસે સધળાં સ્કંધજી. ૮ મારા સમજે
સુંદરી તમો, જાંખુ કરો સુખચંદ્રજી, બંધનપે હુઃ ખઘેછેધણું,
તાહાં અસુરનાં યુંદજી. ૯ એમઆશનાવાશનાકરીને, રાજ્યું
ઓખાનું મનજી; ત્યારપછી ત્યાંથું થયું, તમે સાંભળો રાજ
નજી. ૧૦ પછી ભવાનીનું સ્મરણું કરીને, બાળકલાગ્યો પાયજી
ભગવતી ભવતારણી મારી; આવીકરને સહાયજી. ૧૧ ચાલુ
માતું બ્રહ્માણી તુંદ્રિણીકરણુા; સ્થાવરજંગમતું સચરાચર,
મૃગ ઉપરતૃશણુા. ૧૨ દઈતને પાતાળ ચાંચ્યાં, રક્ત ખીજરણુ
રેણ્યા; સુભનીસુભ મહીસાસુર માર્યા, ચંડ મુંડ ઢંઢોણ્યા.
૨ ધુઅલ્યો ચનને હાથે હણ્ણીઓ, મધુ કૈટભતો માર્યા; અને કરૂપ
ધરયાં તેં અંબા, સુરીનરનાર ઉતાર્યા. ૩ એ હીંગળા જહીં
ગોળી માત, કેામેલાપુરતે કાલી આધર્યારી તું અંબા, સં-
ખલપુર બહુચર બાળી. ૪ નગરકોટની તું સીધવાઈ, બગ-
લા મુખી લાગુ પાય; રાણી રૂઢી ઉંટવાણી માતખીરાજતી
દક્ષીણ માચ. ૫ ચાન્નપુરણુા લેરનીત્રીપુરા; રેણું કાછત સંગી;
રાજેસ્વરી ચામુંડા માત, હુખ હરણી માતંગી. ૬ અણ્ણી રીતે
સ્મરણું કીધું, તતક્ષણુભવોની આ; અનીરૂપને માચે કદ્યુ,
બાળક તેં કેમ યોલાવી, ૭ અનીરૂપ કહે સાંભળો માતા,
માદું હુઃ ખ કદ્યું નવ જાય; સરપ કેરા ઝેરથી, મારી ધણીબળો
છે કાય. ૮ ભવાની અસન્ન થઈને, ઝેર કર્યું સાવે નાશ; પછી
અંતર્દ્યાન થયાં માતાંબાળકની પોહોચી આશ. ૯ એવાં-

માંત્યાં નારદ આયા, અલાના કુમાર; જુવે તો કારાગઢમાં
અનીરવે, વરસેછે જળધાર. ૧૦ નારદ કહે અનીરથને માર્દ
સંકટકાપો; રડીવહૃતમો પરણ્યા માટે, મુજને દક્ષણા આપો.
૧૧ તમને દક્ષણાની પડીને, જાયછે માહારાપ્રાણ; શરીરધુલે
અતા અણુંને, બોલી ન શકે વાણ. ૧૨ શીદ બીહે છે પ્રાકભી
તું, બોલ્ય મુજ સંગાથ; બાણાસુરનીવરનો પુત્રિતેથઈ પૃથ્વી-
માં ખયાત. ૧૩ દીપાંદ્રોવંસ વાસુદેવનો, બંધાયે લંછનશુંય;
કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉછું હુંય. ૧૪ ઉંડળમાંને
આભ ઘાલ્યો; અંતરમાંશેનપુલે, ઘોડેચેડે તે પડે પ્રથવી; બજે
તે નરભુલે. ૧૫ વલાણું-અંતરસેનપુલ્યોજોદ્રા, મુકાવસે ભગ-
વાનરે; અનીરથની આજા લઈ; રૂષિહવા અંતરધ્યાનરે. ૧૬
કંડણ ૬૮ મું.

રાગખીહાગહો-દ્વા ન આવે પેલા દઈતપતીને, માહાખ-
ળિયા દુરમત્યણુખાકરી બાધી હીવજવર સાથે; વહેર વધાર્ય
સત્યજીદ્વા ન આવે. ૧ પાતાળીયા પંકજતુખ પીઉલ્લને;
નાગપાસના બંધજી; બાંધી લીધો બરે કરીને કોમળ રૂપે
મહજ. દ્વા. ૨ જેરે ધરણી ધરશ્રીવર, આપહા પામેનાથજ,
પુત્ર તમારા ઉપર પ્રહારજ, કરેછે હૈત્યનો નાથજ, દ્વા. ૦ ૩
ભાં રોળ કોળાંદે મેલ્યું, વકરાય બળીયોવીરજ, તોએરણુથી
નવ ઓસરિયો, સાગરનું જેમનીરજ. દ્વા. ૦ ૪ લેદકરીનેખાં-
ધીલીયો, નાગ પાસના બંધજી, જ્વાસન માયે બહુ અકળાયે.
અંગ આકાસમાં સંધજી. દ્વા. ૦ ૫ તાપસમાય નહી સ્વામી-

નો, હું કરેદેહનો પીતાજી; વારલાગે લક્ષમીવર તમને તો યસે
મહા ઉતપાતજી. દ્વારા ૦૬ કોમળામુખ અમથી સુકાયું, કન્યા
કરે આકંદજી, અનાર્દ્ર શામરે શામળીયાને, કમળવર ગો-
વિદજી. દ્વારા ૦૭ નાહે ત્રાહેરે ત્રીકમજી, સુતની કરજ્યો સ-
ધાયજી; વિપતવેળાવાંને ચડીને, કરે ભક્તીરક્ષાયજી. દ્વારા ૦૮
ગજ પ્રહારી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્વર્દ્ર રક્ષાયજી; દ્વા-
નવ કુળ નિકંદન કીધાં, કીધી પ્રહાદની સહાયજી; દ્વારા ૦૯
આજ આંખથી આંસુડાં ચાલે, જસે મહારા પ્રાણું; સુખ
શરીર શાતા નહીં અંગેલાગીઓદવનિર્ણયજી. દ્વારા ૧૦ મ
નસા વાચાયે વર વર્ણો, અવર તે મિથ્યા જાણું; ઇથે અને
ગુણવંતો સ્વામી, સત્ય કહુંછું વાણું. દ્વારા ૧૧ તાતકઠોર
દ્વારા નહીં રહીએ, કોમળામહારો કંથજી; પ્રહાર કરીને બાંધી
લીધો, શ્રી હરી વેગળે પંથજી. દ્વારા ૧૨ કોણુસહેદરાવત
અવસર, સોધ કરવાનેજાયજી; તાતભરાતનેજાણુનહીંતે, કોણ
ઉઠીને ધાયજી. દ્વારા ૧૩ પીતા પીઓને વેરીરે હેણે, પરભવે
ખાડુ ચેરજી; નાગતણાયું ફારા હળાહળ, ઝેરવી નાંખે દહેરજી.
દ્વારા ૧૪ હળાહળો અંગઅભીરે ઉઠ્યો, કંદે પડીએ સોષજી
પુર્વતણું કર્માવી નડયાંકેને દીજે દોપજી. દ્વારા ૧૫ તાત
મારી કાચારે પાડું, વિખ ખાડું આ વારજી; સ્નેહ ન જાણુરે
કેાંઈ મનનો, સર્વ પીડેભરથારજી. દ્વારા ૧૬ તાતતણું મન કાંઈ
નહીં, મુનેસભરેલાગે સ્નેહજી; છોર્દેપોતાનાં જાણી દ્વારા કીજે
દ્વારાણ નહીને છેહજી. દ્વારા ૧૭ બાણાસુર મહા પુરુષજ્ઞાતા,

જેથી ચુક ન થાયજુ; ખાળક ઉપર મહાર સેં કરવો, જદ્ધી
હોય અન્યાજુ. દ્વારા ૧૮ વહાલા થઈને વેરજવાળો, શું નથી
આવતી લાજજુ; નિય પહારથ નથી કુળ નિયું, કશ્મ કુંવર
મહારાજજુ. દ્વારા ૨૦ સકળ પૃથ્વીચાડેચાવી, અસુરને ફેડ્યો
ઠામજુ; વૈર વધારી વીઠલ સાથે, કયાંકરસેં સંચામજુ. દ્વારા ૨૧
૨૧ સ્વાનીમહારાને શીર સમરથ, તેને ચટસે ફોપજુ; ભદ્ર
ઇચ્છેછે તાત પોતાનું, વિનું બીજાણું રોષ્યજુ. દ્વારા ૨૨ જુદ્ધ
સમે આકાસે રહીને, જુદ્ધે નારહ દેવજુ; ભયમાં આણીશ
અમોલશું દ્વારામતી, જુદ્ધકરશુંતતખેવજુ. દ્વારા ૨૩ નિર્ભય
જાણી વીણાધર ગયા, પરવરિયાઓકાશજુ; પોણીચી દ્વારકાં
ઉતરી હેડા, બેટથા શ્રી અવીનાશજુ. દ્વારા ન આવે. ૨૪

વલણ-બેટથાશ્રી અવીનાશને, કુશળ વારતા પુછી વળી,
કહે નારહ અનિર્ધને, રાખ્યો કાળાગ્રહમાં હેતે મળીરે.

કૃત્યં ૬૬ મું.

રાગ ધાનાશ્રી—શુક્રદેવ કહે છે પરીક્ષતને, બાંધ્યોને જાદ્વ
નેધજુ; હવે દ્વારીકાંની કહુકથા, જાદ્વકરે સાધારોધજુ. ૧
હિંડોળા સહીત કુંવરહરીએ, છોડીગયું ફેર્દીદેરીજુ; હાહા-
કાર થયો પુરમધે, અનીર્દ્ધની થઈ પુર ચોરજુ. ૨ રતિ અ-
તિઓકંદ કરેછે, મહયુંતે વિનતાનું વુંદજુ; રક્ષમણીરોહણી
હેવકી, સરવે કરે આકંદજુ. ૩ જાદ્વકહેછે માધવને, શું એકા

છોસ્વામીજી; વીચાર કરી વીલંબ નડીને, કુગનેલાગી આ-
મીજી. ૪ વાસુદેવ કહે શામ રામને, શુંભેડા છો લુપજી; વિ-
ચારે શકે જળમાં યુડ્યો, કયાં ગયો કુંવર અનુપજી. ૫ ઉત્ત્ર-
સેન કહે અચરજમોડું, કોણે હર્યો હોડાળોજી; હેતુદૈત્ય રા-
ક્ષસનુંકારણ, તે ખપ કરીને ખોળોજી. ૬ સાથને જહુનાથકહે
છે, ભાઈશાને કરોછો અમજી; ગોત્ર હેવાનું ગમતુંથાયે, કુંવર
હરાયાનું કર્મજી. ૭ અગ્રિયાર વરસ ગોકુળસેંયું, મામાલને
ત્રાસેજિ; પ્રદ્યુમનને શખહરિ ગયો; આંધો સોણમે વરસેજિ
ઈતેમ અનિરૂદ્ધ આવશે, સાચવશે કુગદેવજિ; કૃષ્ણકુંદનને
જાદવછે મહા દુખીજિ; શ્રોણીતપુરથીકળણું સભામાં, આંધો
નારદ ઇવિજિ. ૧૦ હરીઆહે જાદવથયા ઉભા; માનમુનીને હી
ધુંજિ આણું હે આસન આપ્યુંને; ભાવે પુજન કીધુંજિ. ૧૧
નારદજિની પુજ કરીને; હરીએ કર્યાપ્રાણામજિ; કહે સુનીવર
કયાંથી પધાર્યા; અમસરઘું કાંઈકામજિ. ૧૨ કરણેડીને ના-
રહ કહેછે; સાંભળો જુગજિવનજિ; પુત્ર તમારાસર્વેનું મારેક
રવુંછે દરશનજિ. ૧૩ મારા જેતાં પુત્ર સર્વેને; સાથેથી તેડા-
યાજિ; એક લાખને એકસડ હજર; એંસી આગળ આવો
જિ. ૧૪ સર્વે પુત્ર સાસુ જોઈને, પુત્રેછેનારદ સુન્યજિ; આટ-
લામાં નથીદીસતો; પ્રદ્યુમનનો તનજિ. ૧૫ ભગવાન કહેછે
નારદજિને; કાંઈ તમેજાણુંછો ભાગજિ; ધરમાંથીજતોરહોછે;
પ્રદ્યુમનજિનો આગજિ. ૧૬ નારદકહેછુંશુંજાણું; તમેરહોછો

સાગર બેટજિ; જેને આજા દીકરા; તેને તો હેવની વેડજિ. ૧૭
 ત્યારે ભગવાન કહેછેનારદને; પુત્રવિનાકેમરહેવાશેજિ; ત્યારે
 નારદ કહેછે પ્રશ્નમાંચાવશેએવુંકહેવાસેજિ. ૧૮ પછી આ-
 સન વાળી દીધી તાળી; નાકમાદ્યું મનજિ; વેદાગણીને ના-
 રદ કહેછે; સાંભળો જુગનજિવનજિ. ૧૯તમારા પુત્રનું એકનો
 રીએ કર્યું છે હરણજિ, ત્યારે હરી કહે દ્વારિકામાં આવે તેતો
 પામે મરણજિ. ૨૦ નારદ કહેછેતમે સુષોાશામળા; સાંભળાવું
 એક વાતજિ. મારી એવી પ્રતીજ્ઞાછે. જુદું ન બોલું જતજિ.
 ૨૧ સરોખિયતપુર એકનથે, તેમાંબાણુસુરનું રાજજિ. પ્રસંગે
 હું ત્યાં ગયોતો, મારેકાંઈ એક કાજજિ. ૨૨ રાજભાણુનીપુત્રી
 ઓાખા તેને એવું સ્વર્ણજિ. અનીરૂઢું સેહેજે વરીગયો. તેનું
 વિભળ થયું છે મનજિ. ૨૩ ચિત્રલેહા ચંચળનારી વીધાતીનો
 અવતારજિ. તેઓબી દ્વારિકામાં પછી, મન કર્યો વીચારજિ
 ૨૪ કઠણુકામ કરવું છેમારે, એકલાનુંનહીકામજિ. મારુંતેણે
 ધ્યાન ધરીયું, હું આવીએ તેણે ડામજ. ૨૫ મેં તેને તામસી
 વીધાભણું વી, તે ઉદ્યું બદ્યું ગામજ. અનીરૂધને દેઈગઈને
 ઓાખાનું થયું કામજ. ૨૬ કેઈ પેરેલેઈ જાએ. એમ બોલ્યા શ્રી
 જુગદીશજી ચક મારું ઉધે નહીને, છેહી ન આ શીપજ. ૨૭
 ચકનો વાંક નથીનેએ નીસર્યુર્તું ફરવાજ, અમ સરખાસાધુ
 મજ્યા તેણે બેસારથું વાતો કરવાજ. ૨૮ ભગવાન કહેછેશા-
 ભાશ નારદીયા, એવાં તારાં કામજ; માયાઉપરઉલો રહીને
 બદ્યું મરાંથું ધામજ. ૨૯ નારદ કહેછે કશ્ને, મેં નથી કર્યો.

અન્યાયજી; જેથા પછી તમે જાણુનો, ધણી મુટડીછે કન્યાયજી
૩૦ ભલીરે કન્યા ભલીરે વહુ, તમે ભલો કરો વીચારજી; હવડાં
મારા પુત્રના ત્યાં, શાછેસમાચારજી. ૩૧ મહારાજ જેણે બો
ગવી છે, બાળાસુરની બાળજી; હશલાખ હઈત્યનો એકીવારે,
પુત્રે આણુચો કાળજી. ૩૨ શીવનો વર સાચો કરીને, ગયોચ
સુરને હાથજી; હમણા તમારા પુત્રની, ધણી હુખનીછેવાતજી
૩૩ ઉદ્ઘે મુસ્તક બાંધીઓ, ને તળો લગાડ્યો અગનીજી; લીલા
વાંસનો માર પડે જેમ, ભાગ્યહુસે તોજીવશેતનજી. ૩૪ વાત
સાંભળી વધામણીની, વગડાંયાં નીશાનજી; શામળાતતખર
થાવો હવે, જીતવો છેખાણજી. ૩૫ તે માટે તમને કહુ, વીડ
વજી વહેલા થાંઓજી; જે પુત્રનો ખપ કરોતો થોણીતપુરમાં
જાઓજી. ૩૬

કડકં ૭૦ મું:

રાગ સારંગ-કમળા તો કદ્વપાંત કરે છે, હૈદે તે ઉઠીજવા-
ગાનો; મારો કુંવર કારાથહમાં બાંધીએરે. મારાને પાંડીઓં
ધતાં ન આવડેરે; મારો અનીકુદ્ધ નાનેર્ખાળો મારો કુંવર
ટેક. ૧૩૬ મણીએ કશ તેડાવીયારે, તમે સાંભળો હીનાનાથનો
મારો બાળક અસુર ધેર બાંધીએરે, તેતોકહી નારહજી એવા
તણો. મારો ૨ મારો અનિર્દ્ધ યોલીનથી જાણુતોરે, તેતોશું
જાણુ જુદ્ધ ડેરીવાત નો; હિડતાંચાલતાંચાખાઈપડેરે, અનિ-
ર્દ્ધ નાનેર્ખબળનો, મારો. ૩ મારાને નીસાળે ભષુવાનથીમો
કદ્વયારે, નથી સહ્યો અધ્યારૂનો મારનો; પલુએ અમનેપુર્ણા

ન સરજાડયારે; સૌ ચેહેવાં વઠવા જાતને મારો. ૪ ત્યારે શ્રી કષુણ ગરૂડ તેડાવીઓરે, તેતો આવીઓ તતકાળને; ભગવાન કુહેછે ગરૂડનેરે, તમે કેટલો સેહણો ભારને, મારો. ૫ તમે એ પન ડોટી જાહેવ જેટલારે, તેતો સર્નેથાઓ અસ્વારને; તમે સાંબળો કષુણકેડામણારે, મારા અંગતણું રખવાળને, મારો. ૬ મુજ ઉપર ચડે બધી દ્વારીકારે, તો એ મુજને ન આવે આંચને. છાણી જોજનની મારી પંનારે, ત્રણું જોજનની મારી ચાંચને; મારા. ૭ પછી ગરૂડે ચડીને ગોવીંદપરવયારે ત્યારે ગડગડીયાંની શાન ને; પંખના વાગી જ્યારે ગરૂડનારે ત્યારે નાશી ગયા સર્વો સરપણે. મા. ૮ મારો કુંવર કારાચ્છણીછું-ટીઓ, જ્યારે ત્યાં આંધ્યા સારંગ પ્રાણુને શ્રીકષુણવાડીમાં ઉત્થાર્યા, તેનેં કોણું કરે વગાણું. મારો. ૯

વલાણું—કશ્ચ વાડીમાં ઉત્થાર્યા, માણણું રાયનું વનરે. ગરૂડને આપો આજ્ઞા, મુકાવી લાવે તનરે. ૧૦

કડવું ૭૧ મું.

રાગ દ્વાળ—ગરૂડત્યાંથી પરવર્યો, એક નહીં આવી અષોશા તેમાં તેણું ચાંચ ખોણી, પાણીલીધું શોષી ૧ત્યાંથી આધેરો પરવર્યો, જ્યાં ખોતરણું અંગાર; પાણું પેણું પીધું હતુને, વાવરયુંતે ઠાર. ૨ ત્યાંથી આધેરો પરવર્યો, જ્યાં લુનને પરેત પાંખે મારી પાઢીઓ કીધાં સર્વો અચેત. ૩ ત્યાંથી આધેરો ચાલીઓ, કુંવરને. કોટેનાગ, નાહાનાને આખાગહુયા, મોટાના કુંવર્ણ બે ભાગ. ૪ બહુ થને ભગવાન તમારું પુરણું પામ્યો.

અહાર, કુંવરને સુકાવી લાગ્યો; જ્યાં છે જુગત આધાર. ૫
ઓધ્વને અકરૂડ એ હસીઆ, ભલાકણુના તન; તમેરેઆ
વ્યા પરણુવાને, અમને ન લાગ્યા જાને. ૬

કુદું ૭૨ મું.

રાગ ઢાળ-આણુવાતે કુંવરમારા; શરમાણા નવ થઈએ
મારી વાતો તુજને કંઠું; તું રાખ્ય તાહારેહાઈએ. ૧ કુઅજાપેલી
રાંટી, કંસરાયની દાસ મારા મનમાં વગમી, એસારી રાખી
અવાસ. ૨ નરકાસુર મારીને, સોળહજારલાવ્યોધરણી; તારા
સમજે એમાં મુજને, એકે નથી પરણી. ઉતારી માને જઈને
લાગ્યો, બાંધવને બંધાવી જાંખુવંતી રીછદીતેનેમાનીતીકહી
ઓલાવી. ૪ તુંતો મારે હીકરો, ધનતારીમાનુંપેટ; બીજા સર્વે
હીકરા તે, હેવ ડેરી પેઠ. ૫ આપણા કુળમાં ચાદ્યથું આંધું, શ
રમાણા નવ થઈએ; રૂડી નારી હેખીએતો, હરણ કરીલેઈજ
ઇએ. ૬ ઓધ્વને અકરૂડ એ હશીયા; અડઅડ મેલ્યાદાંનરૂડી
શ્રીખામણ છોકરાનેહોછો સુંદર સ્યામ. ૭ જોઆવી શ્રીખામ
ણું અમારા છોકરાંને દેશોતો, સુકદું પડસે દ્વારીકાંગામરે. ૮

કુદું ૭૩ મું.

રાગ જેનેવંતી-શ્રીકૃષ્ણે જાદવ મેાકલ્યો, તે સીરોણીતપુ
રમાંજથ; જઈનેકહેજેભાણાસુરનેપરણુવોકન્યાય. શ્રીકૃષ્ણે. ૧
હેંશ હોય તો જુદ્ધને આવો, તેમાં નથી અમારે નાય; જાદવ
ત્યાંથી સંચર્યો, આગ્યો અસુર સભાનીમાંય શ્રી. ૨ સાંભળને
રાજ વીનતી આવ્યા છે વધકુંઠનાથ; હીકરી પરણુવી ચરણું

લાગો; નહીંતો જુદ્ધકરો અમ સાથ, શ્રી.ડ બાણાસુરને મા હા હુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન; નીચ જાહેવને નેદુંએ મા રી, કુળવંતી એ તન. શ્રી ૪ ચાલ-એ ભરવાડોએ પીંડારો, ગોકુળમાં ચારી ગાય; મારથા વિનાસુકું નહીં; જેથનારહોય તે થાય. ૫ સેન્યા લેઈને રાજ ચાહ્યો, જેદ્ધાનો નહીંપાર; ૬ સ્તી વોડાને સુખપાદો, બાંધ્યાં બહુ હથીયાર. ૭ અડગાખાંડા ને તુંબરઝોર, ગોળી હાથને નાળ, ત્રિશુળ સાંગને મુદુગર ફર સી, તોમરને ભીડી માળ ઉદ્ઘાલ લોહમય ઝગે ઊરી, હાથ ધરી તરવાર; જેધા જેર કરતા આવ્યા, ને કરતા મારો માર ટકો જેજન હો એ જેજન ઉંચા, ટોને સસ આવાનહીશીપ વિકરણ હંત મોટા હેખાડીને, વળી પાડે ચીસ. ૮ પુમરાણુ કરતા આવી પડીયા, જાહેવની સેન્યા માંદ્ય; ગીરધારીને ઘેરી લીધા, પડેખાણાસુરના ઘાય. ૧૦ પરીક્ષત્રીશુરાને પડે હોવાડો મુદુગરને વળી ફરસી; સંઘ્રામસહુ સેન્યા કરે, આયુદ્ધ ધારા રહી વરસી. ૧૧ જુલ દીશ જાહેવ હલકારયા, કર ધનુષ્યબા ણુને તીર; તુટે કુંભસ્થળ પુટે હંતુશળ, ચાલે નીરરહ્ધીર. ૧૨ બહુ ભડ ત્યાં પડ્યા લાગ્યા, જુગળને ભડાકે; વાંકડી તરારયો સારે; અડગને છડાકે ૧૩ તુટે પાખરને પહે બખ્તર, કીધીએક ચરથાણુ; સર્વનોદ્ધાને મારી કરીને, પાછા વહ્યા ભગવાન, ૧૪ વલણુ—પુરણુ પુરુષોત્તમ પાછા વહ્યા, કરી અસુરનો નાશરે; સેન્યામાં આવી કરીને, સુખનો કર્યો નાહરે. ૧૫

કદવું ૭૪ મું.

રાગ માહે-શાંખશબ્દતેવિકારણું, રીપુ હૈત્યનું વિદારણું કશ
આંથા તે જાણુને થયું, બાળું ગ્રાંડ્સ મતે કયાં ગયું. ૧ અની કૃદ્વ
કહે સુણું સુંદરી; શાંખ જણાયો આંથા હરી; છુટયા બંધતે
આજ થકી; એંગાને હળધર સાતવીક. ૨ બોલે પ્રદુમનમોટે
સ્વરે, બાળું પાણું છેદીશે ખરે; ગોવિંદની ગત્ય ન જાયેકળી
જાદુવ સેન્યા આવી મળી. ઉજાદુવ સેન્યા એચાંખ્યો દેશ, મંત્રી
કહે ઉઠો નરેશ, અનુચર આંથા તેલાંથા વાત, કહેદ્વાંદ્રીશે
ઉતપાત. ૪ મંત્રીને કરી નેત્રની સંજ્ઞા. સેન્યાતે આપો આજ્ઞા
હુંદલી નાનાવીધ ગડગડે, આયુદ્ધ કરીને ચુધ્યેચુધેપત્યાંઝૈ
આ કહાડિયા લખી, સેન્યા સજી ટોપળવ રાખી; પાટ સ્વધર
અખતરપાળ, ડચકારેધોડા દેકાળ. ૬ મોર્ડેમણી પુમતાં લટકે
પોતાના પડછાયા હેખી બડકે; વાંદરેવાંદેનાચંતા; દુટે ધીડાને
પાણી પંથા. ૭ કાળા કાબરાને કલંકી, કુમેદલીલાતે પચરંગી
હાસાળો હય હણુંચો જોહ, કાળા કંઢી કાબરા તેહ. ૮ પીળા
પાખર ચોપટ સ્વેતવાયુવેગી માકડીઓ હેત; રથમાળાઅસ
વાર અનંત, દર્ઘિસેપુરખકરે હંત. ૯ પુરની પોળે સેન્યાન
માય હણો જાદુવ કહેવાજય ટોળા ઉપરટોળાં આવે; પગને
પહારે ધર્તી ધુજાવે. ૧૦ રીસેં અંતરમાં ધરહડે, રણે રાય
બાળુસુર ચઢે; અટકારકરે બાળુસુર મહા, પૂર્ણી થઈ જ્યારે
ઉચ્ચા. ૧૧ ગર્જના કીધી મુખથી લુપાળ, ખળભળ્યાત્યારે
સાત પાતાળ; અદ્વાલોક સુધી પોહેત્યોનાંદ, બાળું કશને દી-

ધો સાદ. ૧૨ ગરૂડ આસન આંયો ખેપ કરી, નહી જવાહતે
કુશળ ફરી; ઉનમણ જાહવ ઉધાધવા, તમો પામો સકગ સં-
સાર. ૧૩ કુંવારી કન્યા કષ્પટે કર્યો બેલાવે શ્રાવ પધારો; કુંડ
કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવીએ ઉપરે. ૧૪ ત્યારે
હશાને બોલ્યા ભગવાન, અમોલેનાંબાંયાછુઅન; જેવિધાતા
એ કીદો સબંધ; વર કન્યાના છોડો બંધ. ૧૫ ત્યારે ભાણુ
સુર બોલ્યો તતકાળ, સબંધશાનોરે ગોવાળ; એવી આપીશ
ચેહેરામણું; સઉને મોકલ્લીશ જમપુર ભણું. ૧૬ ભાણુસુર
જ્યારે બોલ્યો. બ્યંગત્યારે કૃષ્ણ કીધું સારંગ; કડાજુડ બેકટક
થયા; ઉધાડા આયુદ્ધ કરમાંગદ્ધાં. ૧૭ ખાંડા ફરશીનેતલવાર
કેા કહાડે માથેથી ભાર; ત્રિશુળ તોમર ગદામુશળ, ગાજેરામે
ધરી મુશળ. ૧૮ પછ્યત્તકરોડ જાહવ ગડગડે દાનવ ઉપર તુટી
પડે; દાનવ દળ ખુલ્લુ પળાય, ભાણુસુરદેખી અકળાય. ૧૯
કડું જ્ય મું.

રાગ ઝુલાણા છંદનો—અદ્યા જપરો જપરોનાહાન તો-
કરા, વઢવાને તુમારી પાસ આંયો અદ્યા નીચ ગોવરીયા
નત કહાંયો મારી સાથે નહી જય હાંયો ૧ અદ્યા ગોકુળ
માણી તું ગાવડીચારતો, પરનારી કેરાં તુંચીર હરતો, હાથમાં
લાકડી ખાંધે હતી કામળી, મધુચન વિષેતુંરેફરતો અદ્યા. ૨
શાંગ્ય શ્રી સુર્યતણી તેજ ત્રિશુળ તણું, માદરા હાથમાંતેહ
ચળકે; મારે કરોધી કરી હોલેછે દેવના, બધી ધરણું પુનેઅને
શ્રી શળકે અદ્યા. ૩

રાગ દાળ-એની વાણુ સંભગતામાં કોષ્યા દીનદયાળ
બાણાસુરના હાથ છેવા, સચાભી શ્રીગોપાળ. ૧ કોષ્ય કર
પાસ્લ મેહેદિયું, વળતુંતેણુિવાર; એ હાથ રહ્યા છે બાણાસુરને,
તનો કહું વિસ્તાર. ૨ દૃધીર વહેછે બાણાસુરને, મન થર્યોની
રાશ; મહાડેવજલે હાથ આખ્યા, માટે ગયો કૈલાશ. ઉનારદ
ચાલી આવીયા; જ્યાં બાણાસુરનીમાય; તારા કુંવરના હાથ
વાદ્યા, કહોવલે શી થાય. ૪

કુંવ ૭૭ મું.

રાગ ગુજરી—શુક્રહેવ કહે છેવાત વેવાણુ આવીયારે, જેની
જેવા સરખી જાત. વેવાણુ આવીયારે. ૧ માથે કેસવાંસની
બળ, વેવાણુ. જેનું નેત્ર સરોવરપાર વહેવાણુ; રજેના સુપડા
જેવાકાન, વેવાણુ. જેનુંમસ્તક ગીરીસમાન. વેવાણુ. ૩ એ
ની આંખ અંધારો કુપ, વેવાણુ. જેનું મુખ દીસે છે કદૃપ
વેવાણુ. ૪ હળદાંડી જેવાદંત, વેવાણુ. દીઠે જાયે એનો અં
ત વેવાણુ. ૫ એનાંસ્તતનદુગરશાંડોઝા, વેવાણુ, કાને ઘાલ્યાં
હાથીનાં હોંઝા, વેવાણુ. ૬ કોટે ખજુરાનાતનમનીયાં, વેવાણુ
કાને ઉટના ઓાગનીયાં વેવાણુ. ૭ પાસે રીછ કલ્લાં વિકાળ,
વેવાણુ. કેહેડેપાડાની ધુઘરમાળ, વેવાણુ. ૮ વાંકડાસર્ફએના
હાથે વેવાણુ. બળતી સઘડી મુકી માંથે, વેવાણુ. ૯ કોટરા
આવી જ્યાંમોરાર, વેવાણુ. કુંવરે સામુ જોળીસાર, વેવાણુ
૧૦ જેની પીડ દુંગરશાંડોઝાં, વેવાણુ. એના મુસ્તકમાં દૂરેરો
ઝાં, વેવાણુ, ૧૧ મુખ જોલે વચનનીકરણ, વેવાણુ. દેખીપડે

જાદ્વનેઝાળ, વેવાણુ. ૧૨ ડોટરી આવી જ્યાં ભોરાર, વેવાણુ કુંવરે સાસુ ખોગી સાર, વેવાણુ ૧૩ ચાલ-કોડરા કહેછે કરગરી; એના બાપને ચાંપ્યો પાતાળ; જાણુશેતો ઘણું થયું એછે તમારો બાળ. ૧૪ કરણાસાગર હૃપાનિધી, ક્ષમા કરો આ વાંક; દીન જાણું દ્વાયા કરો એછે તમારો રાંક. ૧૫ ચક્ર ચત્રલુને પાછુ તેડયુ, કરણા કરી જગનાથ; નવસેછનું કર છેદી નાંખ્યા, રાખીયા ચાર હાથ. ૧૬ રધીરભર્યો આંસુગળતે આવીયા શીવની પાસ; એમ કહુને પાંચે લાગ્યો; સાંભળો પતી કૈલાશ. ૧૭ એક મારી વીનતી, તમો સાંભળો જગદીશ સાંભળી ડોપે ભરાયા, પોતે ઉભીયા ઈશ વદ્ધાણું—મનમાં રીશ ચઢી ઘણું, તમો સાંભળો રાજકુમારરે; સદાશીવ યુધ્યે ચડ્યો, તેણે ધ્રુજીધરો અપારરે.

કુદું ૭૮ મું.

રાગ સારંગ—એ ભરવાડોએપીંડારો ગોકુળમાંચારી ગાય ભાહારા આખ્યા હાથને, છેદીને કયાં જાય. ૧ બડબડતા ગ હુશ ચાલ્યા, ઉદરડે અસવાર; ઉદર ઉપર સ્વામી ડાર્તીક, ચાલ્યાશાંકરના કુમાર. ૨ સીંહઉપર વીરચંદ્ર ચાલ્યાવૃષભઉ પર શીવરાય, સેન્યા બહુ લેળી કરી; કહુ તેહ તણોમહીમાય ત ડાકણું સાકણું ભુતપ્રેત, પીશાચવંતગાત્ર, દદુકદુક ચાલે ભુતડા, જેના હંલ્સાસરખાં માથાં. ૪ હરી જઈ કૃતવરમાને ક હે છે જાદ્વને સમજાવો, અસુરનું ઉપરાણું કરી, જોગીડોવ દવા આંધો, પથંકર મુખથી બોલ્યા આવી, લાગીમનમાં

જવાળ સનમુખ આવી ઉભા રહી; માંહેમાંહે ભાડ ગણ. ૬ હે કાળા અજૂનના સાળા, ભરયાઓણા જોહ; મધ્યરાતે મથુરાંથી નાઠો, ગચેા વીસરી તેહ. ૭ મારી માશી પુતનાને, દહીનાં લીધાં દાણ; મુસાળનુ છેદન કરીને થઈ બેઠા રાજતટ તું આહીરડામાં અવતર્યો, નથી વાત મારી અગણું; ત્યારે શાંકર પ્રત્યે ડોપ કરીને બોલ્યા સારંગપ્રાણુ. ૮ મહેમસાણુ ફરતો હિંડે; રાખ્યોણે અંગ, આક ભાંગ ધંતુરો ચાવેનફેટ તારા દંગ. ૧૦ ડાકણુ સાકણુ લુતપ્રેત જે, નીચસાંગરો જોડો બળદ ઉપર ભાર મુક્યો, તાહારા ઘરમાં નમળો ઘોડો. ૧૧ રાત દહાડો બાવો થઈ ફરતો, તાહારા ઘરમાં રોતી નારી; ત્યારે કષ્ટ પ્રત્યે ડોપ કરીને બોલ્યાછેત્રીપુરારી. ૧૨ અલ્યા છોકરી ઓમાં છાશ પીતો, મદદ મરી થતો મહેરી; જગતમાં એવું કહેવાયું જે, કાનુડે કાંચળી પેરી. ૧૩ પરનારીશુ કીડા કરતો કહેવાયો વ્યસીચારી; ત્યારે શાંકર પ્રત્યે ડોપકરીનેબોલ્યાહેવ મૌરારી. ૧૪ ભગવાન કહે હું વ્યસીચારી, મુનેઅધી વીસ્વેનો યો; તું એવો સાધુ હતો. ત્યારે ભીકડીશુ મોહયો. ૧૫ વચન એવું સાંભળીને, ડોપીયાસીવરાંય; કહાક લઇનેત્રીસુળ માર્યું ચુનાર હૈય તે થાય. ૧૬ ત્યારે શ્રીકૃષ્ણે સુક્યું સુહરશન આન્યા ચપટ થાય; માંહે ચુદ્ધ કરે છે, બળ કહું નવ જાચ ૧૭ ગણુપતીને કુંવર પ્રદુમન, વદતાં બન્યો કુમાર વસુમાન ને અદુક લેરવ, કરતા મારા માર. ૧૮ વિરલદ્રબળરામ સામાચુદ્ધ કરે માંહેમાંહે; શીવને શામળીયો વઢે, ત્યાં જોવા સરુ

ખું થાયે. ૧૬કાળભૈરવકપાળ ભૈરવ તૈક્ષણ લૈરવસાર; સંહર
ભૈરવ કોધે, દંભભૈરવનો માર. ૨૦ ઉત્ત્રસેનને વીરસેન એ,
બળીયા જેદ્રા કેહેવાય; આપ આપણું લીર લઈને, ચુદ્ર કરે
રણુમાંચ. ૨૧ ખુત પ્રેત પીચાસવંતર, ડાકેણ વળગેયુસે; અવ
ળાપગ જેને ચુદેલ કહીએ, રૂધીરસનુંચુશે. ૨૨ ફૂશ્ર કેરામારના
ભાલા વાગે ભય; તરવાર્યાંની ધારાયે, કેનાનાકવાઢ્યા કચ
૨૩ હોઈને અધસાતા કીધા, હાથ તણી લપડકે, કોઈનેમાર્યાં
પાઠુપાણી, બોંગળને ભડકે. ૨૪ જાદવ કેરા મારથી, બહુજો
ળીયે ધાદ્યા જાય; કોનેરણુમાં રોળીયા, તેનેથરથર ધુજે કાય.
૨૫ પરીધ ત્રીસુળ તુંબર ફરથી, હુસ્તનાળ છુટે સરરાટ ગડ-
ગડતા ગોળા પડે, થાય બહુખડખડાટ. ૨૬ હુસ્તીચ્ચર્મનેમાં
સની, એ પાળ બંધન થઈ; સાગરસુ સંગમ મહુયો, એમન્નો
ણૂઠપુરની સરીતા વહી. ૨૭ પાંડુરોગને હૈયાહોડી, ભગંદર
કેરી જાત; હર્ષ નારેને પાઠુ કહીએ, કરણુતુલ્ય સનેપાત. ૨૮
રોગ તણું માર બહુ હેખી, જાદવ નાશી જાય; રોગનાવરસા
દ્વથી કોને જિલ્લુ નવ રેહેવાય: ૨૯ રોગના વરસાદ્ધી, ચઢી
હરીને રીસ; તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યાં શિષ. ૩૦
તાવ વાણી બોલીયા, રહેવાનો આપો ઠોમ, તમેમુજને ચેદાક
રીને; કયાં મારા ભગવાન. ૩૧ પાપી તમે મૃત્યુંલોકના, મા
નવીના દ્યો પ્રાણ; તાવ કહેને કથા સાંભળો, હરીહર કેરું
જાન. ૩૨ માહારાજ ત્યાં અમે નહી જઈએ, સાંભળો અશરણ
શરણ; ચતુર માસમાં સાંભળો, જે કોઈ આ ઓખાહરણ. ૩૩

તેના સ્વમાતરમાં જોશો તો, છેહી નાંખીશ શીપિ; તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જુગહીશ. ૩૪ ઓખાહરણને સાંભળો, મન ભાવ કરીને જેહ; તેને પીડિ તો મારી નાંખુએમાં નહીં સંહેઠ. ૩૫ તાવ કહે એકવાર સાંભળેતેવરસમાંનજવું એ વાર જે સાંભળો; તેને દીઠિથી નાશી જાઉ. ૩૬ રણુવારને સાંભળે, અમારું તમારું જ્ઞાન; તેને જનમ માંહે નવ પીડું તમો સાંભળો ભગવાન, ૩૭ ઓખાહરણને સાંભળો, તેનું ક્ષેઈએ નામ; કોલ લઈને સંચર્યો, ગચ્છા કૈલાશ ધામ, શુ-કૃદેવ કહે પરીક્ષતને, તમે સાંભળો કહું રાય; વળતી ભાથા ભીડીયા કૈલાશ કેરે રાય. ૩૮ શાસ્ત્ર એવાં કહોડીયાં તેનો કોઈન પામે પાર; ઈશને જુગહીશ વઢતાં કોઈ ન પામે હાર. ૪૦ વજરાસ્ત ત્યાં મેલીયું, પોતે શ્રી ત્રીપુરાર; ત્યારે મોહાસ્ત મેલીયું, સામા રહી હેવ મોરાર. ૪૧ નાગાસ્ત ત્યાંમેલીયુંસા મા રહી ઉમીયા ઈશ, ગરૂડાસ્ત ત્યાં મેલીયું પોતે શ્રીજુગહીશ ૪૨ પર્વતાસ્ત ત્યાં મેલીયું, સામારહી શીવરાય; ત્યારે વા-વાસ્ત્ર ત્યાં મેલીયું તેનું જોર કહું નવ જાય. ૪૪ સુરદ્ધનત્યાં કહોડીયું; કરોધ કરી જુગહીશ, ત્યારે ત્રીશળ તે લઈ રહ્યા, પોતે ઉમીયા ઈશ. ૪૫ એકે પોડીઓને એકે લીધો ગરૂડ; ત્રીશળને સુરદ્ધન વળગ્યાં, તે આવ્યાં કડાજુડ. ૪૫ તેમાંથી અભ્યિવરસે તે અહ્માંડ પ્રલે થાય; શેષનાગ શણકવા લાગ્યો, ભારન અમે ધરાય. ૪૬ અહ્માણી કહેછે અહ્માજને તમે સાંભળો માહારા નાથ; શીવને શામળીયો વઢે, નારહે કીધ્યો ઉત્પાત. ૪૭

રાડ જઈને ચુકવો, તેમાંથી થાય કદમ્યાણુ; હંસે ચઢીને અલ્પા
જ આંધ્યા, વીચારીને જ્ઞાન. ૪૮

કદમ્બ ૭૮ મુઃ

રાગ ધનાશ્રી-આખેમાં કોને નંદુને, સાંભરો શીવ રણુછો
૬૭; વિરોધને વગરો મુકીને, પુરો જગતનાહોડ્ય. ૧૩ાંકર
કહેછેકષણુલ્લને, તમોક્યારેઆંધ્યાભગવાનલ્લ; હરીહરણેકોટે
વળાંધ્યા, હીધું ઝાઝુમાનલ્લ ૨ શીવે કષણુને તાળી મારી, બો
દ્યાનો વિવેકલ્લ; વઠનારાતો કોઈકહશેપણુ, આપણુએકના
એકલ્લ. તુ કૃષણુ ચકને પાછુ લીધું, શીવ લાધું ત્રીશુળલ્લઅ
ક્ષાએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શૂલલ્લ. ૪ શીવે
લઈને પાસે તડયો થોળીતપુરનો નાથલ્લ; અદ્યાતુજનેભુજ
આદ્યા માટેવઠવા આંધ્યો મુજ સાથલ્લ. ૫ વળી હેંશહેય
તો યુદ્ધ કરો, શામળીયાનો સાથલ્લ; મહ ભતસર અહુંકારથી
મેંખોયા હજરહાથલ્લ. ૬ બાણુસુર કહેહવે વહુતો, છેઠે માર્દ
શીપલ્લ; બાળુવળતી શરણે ચાદ્યો સાંભરો ઉમીયાઈશલ્લ.

વલણુ-મેં ખોયા હાથ હજરને, હવે શીપ છેદાવુંરે; જેમ
તેમ કરીને જાન તેડાવી પછી કન્યાને પરણાવુંરે ૮

કદમ્બ ૮૦ મુઃ

રાગ સોહીણી-હરીહર અલ્પાત્રણે મહ્યા, હુઃઅ ભાગીયારે;
ત્યારે દાનવનું શું જોર, મહ્યા મન માનીયારે. ૧ અલ્પાવિશણું
ત્રણુ એક છે, હુઃઅ ભાગીયારે; તેમાં તે શી વઠવાડ, મહ્યા. ૨
શિવ બાણુ નમાવિયો, હુઃઅ શરીરે કૃષણુ કેરૂંધ્યો. હાથ, મ-
હ્યા. તુ કાદ્યા કરની પીડા મરી, હુઃઅ. જ્યારે પ્રસન થયા

જહુનાથ, મહુયા. ૪ હવે ગરૂડને દ્વારકાં મોકદ્યા, હુઃખ તે
હવે સથરો પરીવાર, મહુયા. ૫ શોળ સહુસ્ત્ર એકસે આઠ
પટરાણુંઓ, હુઃખ. તેડાવો પરીવાર મહુયા. ૬ ગરૂડ ઘોચ્યો
દ્વારકાં, હુખ, તેડાવે જાહેવનાર, મહુયા. તેડી છપન્ન કોટી-
ની, હુખ તમો તેડો સૈા પરિવાર, મહુયા. ૮તે ગરૂડઉપર સૈા
એ ચદ્યાં, હુખ. ત્યારે ગરૂડ ની પાંખભરાય; મહુયા; મહુયા. ૯
તેડી શોળુંતપુરમાં આવીયા હુખ. આવી જાહેવની સર્વેનાર
મહુયા. ૧૦ જાની વાસ આપવા મન માનીયાં, હુખ; તેમાં
ઉત્તર્યાં છપન્ન કરેડ; મહુયા.

કુદું ૮૧ મું.

રાગ ધોળ-પારવતીને પીયરનાંનો તરફંરે, બેસવાતો રૂહાંલા
વળો પાથરણું રે; તેડાવોને ઉદ્દીયાચળને અટાચળને. તેડાવા
વિધ્યાચળ પીનાચળરે; વરરાયને નાવણું વેળાથાયરે, વરરાયને
પીડી ત્યાં ચ્યાળાયરે.

કુદું ૮૨ મું.

રાગ શુભરી-કશ્ચ કેરી ધરૂણુંની દ્રાનવ ચોદશોરે, અનિરુ
દ્ધને તે લઈ સંચરો રૂક્ષમણુંની જગવુંરે બળભદ્ર કેરી ધરૂણું
નીદ્રા નવ ચોદશોરે અનિરુદ્ધને તે સંચરો રેવતી જગ-
વુરે વાસુદેવ કેરી ધરૂણુંની નીદ્રા નવ ચોદશોરે. અનિરુદ્ધને તે
લઈ સંચરો; રમુમતી જગવું મહાદેવા કેરી ધરૂણુંની નીદ્રાનવ
ચોદશોરે, ઓખાખાઈ નેતે લઈ સંચર પારવતી જગવુંરે ગ
ણુપતી કેરી ધરૂણુંની નીદ્રા નવ ચોદશોરે, ઓખાખાઈ નેતે લઈ

સંચરો; સુધ યુધ જગવું બાળાસુર કેરી ઘરણી નિદ્રા નવ
પોઠશોરે ઓખાખાઈને તે લઈ સંચરો; બાળમતી જગવું રે
કોભાંડ કેરી ઘરણી નીદ્રા નવ પોઠસારે. ઓખાખાઈને તે લઈ
સંચરો; ઇપમસ્તુ જગવું રે.

કઢું ૮૩ મું.

રાગ વોળ-હલહલહાથાણીશાળગારીરે, હસ્તતીફરતીસોના
ની અંબાડારે; તેના ઉપર યેસે વરજીની માડીરે, સોનેરોકેાર
કસુંબલ સાડીરે. માથે મોડભરીરે ઝગકેરે. ઉશાણોફકે વ-
રને કરાંયું સ્નાન, નાના વીધનાં વસ્તુ પેહેરાંયાં પરીધાન
કનકુભેર ખાપુંચીએ બાળુભંધ, અનોપમ ઉપન્યો આનંદ
મુગટ માણી મય ધર્મેંા અનિરૂદ્ધ શીશ, લખક ઝાંક ઉદ્યજન
જેવા દીસે કસુરીનું તીળક કર્યું છે ભાલવળતીતેને ટપકું
કર્યું છે ગોળાપાલ હરી હળવરનો. જશ બોલે બધા જનજ
હવ સહિત શોહે છે જુગાળવન સાત પાંચ સોપારી શ્રીફળ
આપાય, વરજીને તો ઘોડી વેળા થાય.

કઢું ૮૪ મું.

રાગ દેશિ ઘોડલીનો—અનિરૂદ્ધની ઘોડલી. ટેક
અંત્રીક્ષથી ઘોડી ઉતરી, પુજીએ કુમકુમ પુલ; ચંચળ ચરણે
ચાલતી, એનું કાંઈ ન કરી શકે મુલ. અનિરૂદ્ધજીનીઘોડલી
૧ મોઠે મોતી જડ્યા હીરા જડીત પવાણુ રતન જડીતજેના
પંગડાં, તેના વેદ કરેછે વખાણુ અનિરૂદ્ધ. ૨ અંગજેનું અવ
નવું, ઝગકે તે આકાશમાળ; ઝયુકે જેમ વિજળી, તેને કંદેછે

શુદ્ધ ભાગ. અનીર્જ્ઞ. ત હેવદાનતમાનવીરે, જોઈ હરખ્યાતે
સુંદીર સ્થાભ; થનક થનક ચાલતીરે, એનું પંચ કલયાણીએ
નાભ. અની. ૪ ઇપનંતી ઘોડી ઉપરરે, અનીર્ધથયાઅસ્તાર
પાનનાં આખ્યાં બીડજાંરે, ઉપરશ્રીહળ ફેલગ સાર. અનીર્ધ
પહિંડે હળવે હાથીઆરે, ઉલટ અંગ ન ભાય; સુરીનરમુની
જન જાણે વારણેરે, આગળ ઈન્દ્ર રદ્ધાછડીહાર. અની. ૬ સ-
નકાદીક શીર છન ધરેરે, નારદ વેણુા વાય; ચંદ્ર સુરજ ઐઉ
ચેગંડરે, આગળ વેદ ભણે અહાય, અની. ૭ વાજં બત્તીસ
વાજતાંરે, નગર એને પરદેશ; લોક સર્વે જોવા મળીયું, શોણી
તપુર દેશ અની. ૮ રાયે નગર શોહરાવીયુંરે, શોહરાવી છે
વાટ; ધજપતાકા જળહરેરે, શોહરાયાં સોણીતપુરનાં હાટ
અની. ૯ હેઠ સર્વે ત્યાં આવીયારે, જશ ઐલે બંદીજન; જ
ચક કરે બણુ જાયનારે, જેને હરી ટળો નીરધન, અનિ. ૧૦ રા
મણુદીનો કર ઇક્ષમણીરે, લુણ ઉતારે એની ધીર; ગાન કરેછે
અપસરારે, ત્યાંતો જોવા ઈચ્છે જહુરીર, અની. ૧૧ એવી
સોભાયે વર આવીયારે, તોપણ ઘોડી થાય વરરાય; સાણો
છાંટે છાટણુંરે, મળી ભાનુની મંગળગાય, અનિ. ૧૨ ધુસળ
મુસળ રવઈએરે, સરીઓ સંપુટનાક, ઈડી પીડી ઉતારતારે
વરનું તીલક કરી તાણું નાક, અનિ. ૧૩ નાચે અસરાઈ-
દ્રનીરે, નારદ તુસુર વાય; મધુંરી વાણી વાજતીરે, એવો આ
નંદ ઓછન થાય, અનિ. ૧૪ પુંખવાચાવી પ્રેમદારે, ભાથે
મેલી મોડ; રામલુદીયો જળહળોરે, ઇક્ષમણી ધાદ્યો મોડ. આ

નિ. ૧૫ ગળે ઘાટ ઘાલી તાણુંયારે, આંધ્યા માહેરા માંદા; આડા સંપુર્તદેવરાબીયારે ત્યાં વરત્યોછે જેજેકાર. અની. ૧૬ ઘાડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન; વાંઝીઓખામે પુત્રનેરે, નીરધનીએ પામે ધન. અની. ૧૭

કઢણું ૮૫ મું.

બાણુસુર પખાળે ચરણ, સોભા ઘણુરીરે; ત્યાંતો બ્રાહ્મણ તી મામવરુણ, સોભા ઘણુરીરે. ૨ ત્યાંતો પહેલું મંગળવરતાય સોભા. પહેલે મંગળ સોનાનાં દાન અપાય, સોભા. ૨ દાન કેછે કષણુંનો સંતાન, સોભા. ત્યાં તો બીજું મંગળ વરતાય સોભા. ૩ ત્રીજે મંગળ ધેનુનાં દાન અપાય, સો. ત્યાં તો ત્રીજુ મંગળવરતાય; સો. ૪ મંગળ હસ્તીનાં દાન અપાય સો. દાન કેચે કષણ સંતાન, સો. ૫ ત્યાં તો ચોથું મંગળ વરતાય, સો. ચોથે મંગળ કન્યાનાં દાન અપાય સો. ૬ ત્યાં તો વરત્યાં છે મંગળ ચાર; સો. આપે ગરથ સહીતા ભંડાર, સો. ૭ લાવે બાણુમતી કંસાર સો. ત્યાં તો પીરસે છે ચાર વાર, સો. ૮ ત્યાં તો આરોગે નરનાર, સો. ત્યાં તો દુધડે સ્નાન કરાવે, સો. ૯ ચાર સોભાગ્યવંતી બ્રાહ્માવે, સો. ઓાખા સૈભાગ્યવંતી કહેવરાવે, સો. ૧૦ ઓાખા અનીરુદ્ધ પરણીને ઉઠ્યા શો. ત્યાં તો શાનૈથે મેરુનુદ્યા શોભા. ૧૧

કઢણું ૮૬ મું.

બાણુસુરગોરવનોતરે; સૌધે સાથસુરે; સાચેજ મણુનીરી

રીત હળવધર આતશુરે; શ્રીકણુ કરે પ્રમાણ હળવધરશ્રાતશુરે.
તમે ગોરવ વેળા પધારને સૈડો આવનોરે, સાથે માણુસની
શી રીત ગમે તેને લાવનોરે; વેવાણો ધરમાં ગણ જ્યાં વરની
માવડીરે; તેના કુમકુમ રોજ્યા પાય જર્દ પાયે પડારે. અનિ
હૃદની માવડી બોલીયાં રીત અસાચીરે; તમારીપરઠણ જેહ
મનાંનું ગોરડીરે; ભાણુમતી બોલીયાં રીત અમારીરે; ગોરવ
મનાવિને ચાલીયા મનશું માલતાંરે. હાલ હાલ કરો રશોઈ
રાંધણુ ચાલતાંરે; જન ખાડુ પ્રકારનિ ગણુતાં કાંઈ નવિ લખુરે
કાંઈ વસ્તુ અનેક ગણુતાં સઉ કહુરે; જાદવ ફેરી જોડી સઉહોા
સાથશુરે આંદ્યા શ્રી કશ્મ મહારાજાધ્યપન કરોડશુરે વેવાઈનિ
વાતકાંઈસાંભળિરે; જોજન કરવાડામહામ જુગતિએ ભલીરે
આજા આપી રાય સૌડો બેડા થયારે, એતો સ્નાનકરી મં-
હિરમાં ગયાંરે સ્મરણુ કીધું નાથનું બેડા બેસણુરે; નવનોઘન
વંતિ નારનિકળિ પીરસણુરે; ચકમકના તકીયા ધણુા ઝારા
નલોટડારે, માંદે બેસણુખુ વિવેક દીસેપુટડારે ભાવનપરની
થાળીસેનાનાવાડકારે પીરસનારીપ્રમાણ જમનારા લાડકારે
ખાંડ પકવાનના મેવાબહુધણુારે, પુરણુને દુધપાક સાકરીયા
ચણુારે; ગોટા ગળીયા તડજુચાં આંખા સાખશુરે; પિસ્તાને
અખરોડ હાઠમ દ્રાખશુરે. તલાંસાતળિ મોળાં દલીથરાં શેવ
છુટી કળીરે બોબલડે પીરસે ખાંડ મરડી બેવડીરે; ખાજાં
જલેખી ફસમી ફળિયાં મશામસેર, ઘેબરને મોતિચુર જમતાં
સહુ હસ્તેર, મગફળને મેસુર પેંડાલાવિયારે; પકરાન ખીજાં

અનેક લાખણું શરીબાની આરે. ભાટઅંધરો રાધીયો માંહેખાંડ
લેળિરે; ગવરીનાં તાવ્યાં ધી સેવા ગળગળારે; સારે કર્ચો કં-
સાર પોળી પાતલિરે, સાકરની ભીડાશાઆણી કચોળેભરીરે
જમવા બેઠી નાર જાહુવાપડીરે; જમતાં કહેલદ્વારે લવીંગ
સોપારી એલચીપાન સમારીઆંરે; બીડલે બાસઠપાન સૈને
આપીઆરે; સાજન હતું શ્રી કશ્મનું તે સર્વે જમુંરે; પ્રેમા-
નંદના નાથ ત્યાં વહોણું થયુંરે.

કદવું ૮૭ મું.

રાગ પેહેરામણીનો-આપ્યું મુક્યું સર્વે પોક્યું; કન્યાનેવળા
વો, માહારા નવલા વેવઈઓરે. રથ ધોડાનેપામરીયો; સૌ જ
દવને બંધાવો; બંધાવો માહારા નવલા વેવઈઓ. જરકશી
જામા તમે કશ્મને પેરાવો; માહારા નવલા વેવઈઓ, પંચવ-
સ્ને શણુગાર; તમે જમાતને આપો; મહારા. દક્ષિણાં ચીર
રાણી રૂક્ષમણીને આપો; માહારા. જરી મુગટનેશાલદેશાલા
જાહુવને તમે આપો; મહારા. સાણુ ઘરાચોળાને ઘાટ ઘણેરા
સતી સતભામાનેઆપો; મહારા. પાટણુના પટોળાંરાણીજા
ઝુવંતીને આપો; મહારા. વલાણુ-પેરામણી પુરણુ થઈ, હઈડે
હુરખ ન માયરે; કન્યાતેડો કોડે કરી, હવે કશ દ્વારકાં જાયરે.

કદવું ૮૮ મું.

રાગ વેલાડો-ઓખા ચાલી ચાલણેહારા, સઈયરે વળાવા
સંચરી; ઓખા ઉલ્લી રહે મળતીજા, માને વહાલી દીકરી.
કોઈ લાવે એકાવળ હાર, લાવે સોનાનાં સાંકળાં; કોઈ લાવે

સોળ શણુગાર; ઓખાખાઈને પેહેરવા, ઓખાને વળતાં બો
લીઅં કહેખાઈરે, ચીત્રલેહા આવ ઓારી લાવ્ય વાહરે; આદે
સોનાનાં સંકળાં બોલ્યા બાઈરે, શુંકરેસોનાનાંઓલ્યાબાઈરે
તારા ગુણુ ઓશીગળ થાઉ બોલ્યા બાઈરે, નીતનીતગો મતીને
રણુછોડ આવ્યા નહીરે; ત્યાં મુજને સંભારજ્યો બાઈરે એ-
દિલે પોહોચ્યા ડોડ લાવ્યા વાહીરે.

કડવં ૮૬ મું.

રાગ ધોળની હેઠી—ઓખાખાઈતો સાસરીએ હવે જાયરે,
માનુની તો મળી મંગળ ગાયરે; રથ અગ્ર પઈડું ત્યાં શ્રી ઇણો
સીચાયરે, ઓખાખાઈને લાડકચોળુ અપાયરે ઓખાખાઈને
શીખામણુ હેઠે માયરે.

કડવં ૮૦ મું.

રાગ બીભાસ—સાસરીયાના સાથમાં, તુંડાહીથને હીકરી
હું તુજને સીખામણુ હેઠો, તેરખેજતીનીસળી. સાસરીયાના
સાથમાં, હળવેહળવેચાલીયે; સાસરીયાનાસાથમાં ખોળોખા
વુંન ઘાલીયે. સાસરીયાના સાથમાં કંથસારુભાલીયે, સાસ-
રીયાનાસાથમાસહડકોઅધોતાંણુચે; સાસરીયાના સાથમાં
સસરેખેડાહોનતોપીતાનાહોકાણુ જાણુચે સાસરીયાના સાથ
માં કુવે વાતનકીણુચે; સાસરીયાનાસાથમાં પરપુરુષ આવ
તો હોયતો વાતકરતાંણીણુચે, સાસરીયાના સાથમાં સાસુને
ગાળન હીણુચે. સાસરીયાયાનાસાથમાં દુઃકીપાણુનવલીણુચે
સાસરીયાના સાથમાં પરપુરુષની હસી તાળી નવ દીણુચે;

ચઉલ્લને પરસેશ્વર જાણું, પગ ધોઈ પીળું.

કડું ૬૧ મું.

રાગ ફટાણુનીયાલ-આંયો દ્વારકાંનો ચોર, લાખેણુલા
ડીલેઇ વઠ્યોરે; જેણુ વગડે ચાર્યા ઢાર, લાખેણુ. હાર્યોડાર્યો
ભાણુસુર રાય કલ્યાણુરાય જીતીયારે; વેગે વહિને આંયોવ
દ્વારકાંનીમાંયકેશવરાયજીતીયારે; રાણુની રક્ષમાણુંચે વધાવી
ને લીધા, ત્રીકમરાય જીતીયારે; તેતો પુરાણુ પ્રસીદ્ધ; દીધલ
મલ જીતીયારે. તેતો ગોનજ આગળ જય, કલ્યાણુરાયજીતી
યારે; થંનેનાંહાંથકાંકણુ મીંદળદોડાય, કલ્યાણુરાયજીતીયારે

કડું ૬૨ મું.

રાગ ધોળ મંગળ-તારાબાપનો બાપતેડાવ, છોગાળાહોર
ડો નવછુટે તારો કશ વડુવો તેડાવ, છખીલા હોરડો નવછુટે
તારી રક્ષમણું માત તેડાવ. છખીલા. તારો પ્રદ્યુમન તાત
તેડાવ છખીલા. તારી રતુમતીમાત તેડાવ. છખીલા. અમા-
નીવાળીગાંડ તે ડેમછુટીજય, છખીલા. તારો બળભદ્ર કાહેા
તેડાવછખીલા. તારી રેવતીકાડી તેડાવ, છખીલા. અનીરૂધ્યે
ખાંધી ગાંડ હોરડો ઓાખા. છોડવા જય છેખીલા. બેડી ગાઠ
કરીનેતે ડેમ છુટી જય. હો લાડી. તારો બાણસુરતાતતેડાવ
હો લાડી. તારી બાણમતી માત તેડાવ હો લાડી. તારો
શંકર તાત તેડાવ, હો લાડી. તારાં પારવતી માત તેડાવહો
લાડી તારો ગણુપતી શ્રાતતેડાવ હો લાડીતારીસુધ બુધલો-
જાઈ તેડાવ હોલાડી. તારી ચીનલેહા ચોર તેડાવ, હો લાડી.

આખા છોડે હોરડા, તે અદવજુ રંતી ગાય; છભીલા. બીજી ગાંડ
તે થડ કરીને તે ફેમ શુટી જાય. છભીલા હોરડા ફેમ છુટે.

કૃષ્ણ ૬૩ મુ.

રાગધનાશ્રી-રીતભાતપરીપુરણુ કરીને, ઉઠિયા કૃષ્ણ તનજી
નવુરે મંદીર વસવાને ત્યાં આપ્યુરે લોવનજી એકવાર શ્રી
કૃષ્ણ, ઓખાને, ખોળામાંદેસારીયાજી; માગવુંદ્રાયતેમાગી
લેજે, તુંછે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો, તમે
આપોરે ભગવાનીજી; અગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર
નાણજીબાણુસુરનોગયાસુર, વંશવધારણુહારજી, કહીકથાને
સંદેહ ભાગ્યો પરીક્ષત લાગ્યો પાયજી શુકજી અમને પાવન
કીધા સંભળાંયો મહીમાયજી; આરાધુ ઈષ્ટગુરુહેવને, ગણુ-
પતીને લાગુ પાયજી ઓતા વકતા સમજતા કહેકવી કરજો
ડજી; ભાવધરી સહુ ઓદજયો, જેને શ્રી રણજોડજી.
ઈતી શ્રી ભાગવતે મહાપુરાણે દશમસ્કરંધે શ્રી શુક્રેવ પરિ-
ક્ષત સંવાહે પ્રેમાનંદ કૃત ઓખાદરણુ સંપુર્ણ.

શ્રોક.

અચ્યુંતં ફેશવં રામનારાયણુ ॥ કૃષ્ણ દામોહરં વાસુહેવ
હરે ॥ શ્રીધરં ભાધવં ગોપીકા વલ્લભ ॥ જાનકી વીનાયક
રામચંદ્ર ભજેત. ॥ ૧ ॥

અમૃતચરિત.

લટુગ ૧-૨-૩ બો.

(ભક્ત આપાલાલ વેણુરામ કૃત)

આ પુસ્તકમાં સલ, શિલ્પ, ગાન, નીડીમાલાના પ્રકાશ, મુખોધા, મહુર-
ધર, સુવાણી, અંદ્રાસ, આમાયનો રિચાન વોરે જ કો છો) મહુર ગતઃ આપનો
તેમજ બીજાં મોખપદ દાખાતો આવ્યા છે.

અસોભાવન વૈષણુતી વાતા.

(શુદ્ધ ગુજરાતી ભાષાંતર.)

આચાર્યની મદાપ્રભુજના સેવા વરેનું આમેદુલ તર્ફન આ પુસ્તકમાં કર્તામાં
આન્ય છે વેણુરેને અ પુસ્તક પ્રાણ સનાત પણ કરતા યોગછે, માટે દરેક વૈષણુવો કલ્યાણ્યે
આ પુસ્તક અરીએનું યોગ છે, અન્યર ધર્માનુમોદા છે.

ભક્તમાળ પ્રસંગ.

સરળ ગુજરાતી ભાષામાં આ સંસ્કારમાં ધ્યાય ભક્તિજ જન્મ મરણાદિ સથળ દુઃખેને
દ્યાળનારી છે. જન્મ જન્માંતરમાં પરમ સુખ આપનારી છે. આ પુસ્તકમાં મોહોસ કીતેર ભગ-
વદ ભક્તોનો અપૂર્વ ભક્તિભ્રંષ ધર્મિદાસ આપનારી આવ્યો છે.

મણિરતનમાલા

(ગુજરાતી ભાષા અને ભાળમોદ અક્ષરમાં) યથા નામા તથા ગુણ્ય—એ કહેવાતા
તુસાર આ અથવું જેવું નામ છે રેખેન તેનો પ્રચાવ છે.

શિક્ષાપત્ર.

(શ્રી હરીરામજ કૃત મોદુ) મુજ સ્ટોટ અને જોસ્ટાનીજ શીમહ જોગેશરજ ! મહારાજે
કરેલી દીક આપારે ગુર્જર ભાષામાં.

સ્તપશ્રીકાન્ત.

આ પુસ્તક સંસાર સામરમાંથી તરવા એક નોકા રૂપ છે. આ પુસ્તકમાં સંસાર વ્યવહા-
રમાંજ રહી કેવસ્યપદો માર્ગ દેખાડેલો છે, વિશ્વમાં ધાર્મિક જાતો દ્વારા સિદ્ધાની દ્વે
આપેલી છે.

શુક્લેશ્વર મહાદેવ રામચંદ્ર જગુણે.

નથુ દરવાન—અમદાવાદ.

કબીર કાવ્ય.

આમાં ભણતા કબીરના ઢાડરા અને તેમાં રહેવો શુદ્ધયે કથા
ભાષામાં એવો વિસ્તાર પુર્વક સમજાયો છે કે તે વાચવાથી સુધી, હલ્લી
શુદ્ધ વિગેર સખાધીનો બણોજ ઉત્કષ્ટ પ્રયાલ અપે છે ગમે તેવા
કદ્યવાળા આણુસને પણ આ પુસ્તક સારે ક્ષાન આપી તુલન છાંદોણ
કરતે છે. પુસ્તક ઇકત એકજનાર વાચવાથીજ તે વારે વારે વાચવાની
કરે એવો એમાં અદ્ધૃત રસ છે. આમાં કુલ ૨૦ અંગ છે અને તે એટાં
આ કથક છેડ તેનો વાચવાથીજ સારોખ્યાલ થશે આમાં ભણતા કબીર
પણ અંદર દાખલ કરેવો છે. પુસ્તકનું કદ જા X પા ક્ષય લાંબું પહેંચ
બેઝ ઉચ્ચા પ્રાચ્ય સંખ્યા ૩૨૦, પાડું ઇસેરી વર્ણવાળું પુદું છાં ડિમતકુ
પેસેન નાથ.

શાક પાક પકુવાનું શાસ્ત્ર.

અતુભ્ય જાંદી નિમાનુંને જોરાક એ મુખ્ય ચીજ છે; પરંતુ ને તે
કરવામં ન આવે તો દેખને રોધણું કરવાને જરૂરે ચુંબ, શુગ, ઉલ્લી, અદ્દરો,
અર્જું વનેરે અને દર્દો ઉત્પત્ત કરે છે અને તેથી એ રાક તેરી રીતે તેથાં
ગાન તે ધંધાન મહિતપણે ખામેરી મેળની આપણાં આંદું છે આમાં દ્વારા
અનાતી અને ભણાતી રીત રીતાનાં શક, પાંચ, પકુલાં, મુરબ્બા, અથાણું, કા
ચટથી અને મનાલાનિ અથ રિયરો સંમદ છે. દર્દે બી પુરુષોને એજનાર દાખલ
અધારણું છે. જોજ કામગ, પાડું સાનેરો પુદુ. ડિ. ૨ રૂ. ચોંદું ને આના.

અવિષ્ય હૃત.

એમાં ૧, શુદ્ધ, અરીથ, ચાંદી, પાડ, અગસી મરસન, તલ, તેલ, ૧
વનેરે દર્દે વરણું તેજ મંદી તથી શુકાગનો દુકાગનો નિષ્ઠિય દાખોંનો છે
૧. ૦—૪—૦ અદારમાનનાન ઓઝે કૃપાલ અથી જહિલ ૦—૧—૦ ની
દીક્ષા મૈલાની.

મળવાલું ડેકાણ;

મહાદેવ રામચંદ્ર જાગુણે શુકસેવન

નશ દરખા

